

Date of Publication 10th Posted on Every Month

₹ 20



પરબ

સમાનો મન્ત્ર : । (અધ્યાત્મિક)
સમાની પ્રપા : । (અથર્વવેદ)

તંત્રી : યોગેશ જોખી

અપ્રિલ : ૨૦૨૧
વર્ષ : ૧૫, અંક : ૧૦



ગુજરાતી સાહિત્ય પરિષદનાં મહત્વનાં પ્રકાશનો



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૧

(ઈ. ૧૧૫૦-૧૪૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનભાઈ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૪+૩૧૨, કિંમત રૂ. ૨૧૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૨/ખંડ-૧

(ઈ. ૧૪૫૦-૧૬૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૬+૪૮૨, કિંમત રૂ. ૨૮૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૨/ખંડ-૨

(ઈ. ૧૬૫૦-૧૮૫૦) મધ્યકાળ

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,
યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ, પૃ. ૧૬+૮૮૫, કિંમત રૂ. ૨૫૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૩

(દલપત્રરામશી કલાપી)

પ્રથમ આવૃત્તિ : સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,

યશવંત શુક્લ; સહાયક સંપાદક : ચિમનલાલ ત્રિવેદી

શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ : સંપા. રમણ સોની

પાંકુ પૂર્ણ : પૃ. ૧૬+૬૫૬, કિંમત રૂ. ૫૦૦/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૪

પ્રથમ આવૃત્તિ સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,

યશવંત શુક્લ સહાયક સંપાદક ચિમનલાલ ત્રિવેદી

શોધિત વર્ધિત આવત્તિ સંપાદક : રમણ સોની

પાંકુ પૂર્ણ પૃ. ૧૬ + ૬૦૦ કિંમત રૂ. ૫૫૦/-

સમાનો મન્ત્ર : (ગુજરાતી)

સમાની પ્રપા (અર્થવર્વેદ)

પરબ

સ્થાપનાવર્ષ : ૧૯૬૦

વર્ષ : ૧૫

એપ્રિલ : 2021

અંક : ૧૦

પરામર્શનસમિતિ

પ્રકાશ ન. શાહ

પ્રમુખ

અજ્યસિંહ ચૌહાણ

પ્રકાશનમંગ્રી

તંત્રી
યોગેશ જોધી

ગુજરાતી સાહિત્ય પરિષદ

મેઘાણી શાનપીઠ ♦ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશનવિભાગ), ગોવર્ધનભવન,

ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ફોન : ૨૬૫૮૭૮૪૭ • Email : gspamd123@gmail.com

પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- ◆ 'પરબ' દર માહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
- ◆ 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
- ◆ 'પરબ'નું વાર્ષિક લવાજમ ₹ ૧૫૦ છે.
- ◆ વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ ₹ ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.
- ◆ ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
- ◆ પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક ₹ ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક ₹ ૩૦૦ છે. સભ્ય થવા ઈચ્છનારે પરિષદના નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
- ◆ પરિષદના આજવન સભ્યપદનું શુલ્ક ₹ ૨,૦૦૦ છે તથા સંસ્થા આજવન સભ્ય ફી ₹ ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
- ◆ 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓડર અથવા ઇમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

લેખકોને :

- ◆ 'પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
- ◆ લેખકોએ પોતાનું લખાણ ફૂલસ્કેપ અથવા A4 સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અથરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઈનલોન્ડ કે ચબરખીઓમાં ફૂતિ મોકલવી નહીં. પ્રતેક ફૂતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ ફૂતિઓ મોકલવા વિનંતી.
- ◆ સ્વીકૃત ફૂતિની જાણ કરાશે. ટપાલ-ટિકિટો ચોંટાડેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત ફૂતિ પરત કરવામાં આવશે, અન્યથા ફૂતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.
- ◆ પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઇસ' પાછળ, નદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

Parishad Email : gspamd123@gmail.com

E-mail : parabgsp@gmail.com

Web-site : www.gujaratisahityaparishad.org ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭
www.gujaratisahityaparishad.com

પરબ

ISSN : 0250-9747

ધૂટક ક્ર. ₹ ૨૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : અજયસિંહ ચૌહાણ. ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮ * તંત્રી : યોગેશ જોખી * મુદ્રણસ્થાન : ભગવતી આઓફસેટ, અમદાવાદ-૩૮૦૦૦૬

આજીવન સર્વ્ય/સંસ્થાની સુધારણા માહિતી



આજીવન સર્વ્ય નંબર _____

[‘પરબ’ના સરનામાના લેબલ પર નંબર હોય છે.]

આજીવન સર્વ્યનું પૂરું નામ _____
અટક નામ પિતા/પતિનું નામ

સરનામું _____

_____ પીનકોડ

મોબાઈલ _____ રહેઠાણનો નંબર

આધારકાર્ડ નંબર _____

આજીવન સર્વ્યની સહી

નોંધ : આ ફોર્મ સાથે આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ મોકલવા વિનંતી છે.

અ નુ ક મ

આ ક્ષણો :	‘પરબ’ સંદર્ભે મારી સંપાદનયાત્રા, યોગેશ જોખી 7
પ્રમુખીય :	ભાષક અને ભાષા, પ્રકાશ ન. શાહ 11
કવિતા :	બે ગીત, હરીશ મીનાશ્વર 14 બે ગીત, વિનોદ જોશી 15 બે ટેબલ કાવ્યો, રમણીક સોમેશ્વર 16 ચાર ગજલ, હેમંત ધોરડા 17 એક ગીત, અનિલ ચાવડા 19 બે ગજલ, ઉર્વિશ વસાવડા 20 પાંચ કાવ્યો, વજેસિંહ પારગી 21
એકાંકી :	હું, તું અને મિસ્ટર સ્મિથ, હિંગીશ મહેતા 22
વાર્તા :	ના – એક પ્રલાપ, ધીરેન્દ્ર મહેતા 33
નિબંધ :	પ્રભાવતી, રવીન્દ્ર પારેખ 36 માસ્તર, પારુલ રંગપરિયા 38
આસ્વાદ :	સુભાષિત સ-રસ-વતી ધારા, દેવાસુરસંગ્રહામની પુરાકથાની કવિતા, વિજય પંડ્યા 42 નવી આબોહવા, મહેન્દ્રસિંહ પરમાર 44
શતાબ્દીવંદના :	અજ્ઞ સર્જકતાનો વૈભવ : સુરેશ જોખીના નિબંધો, રમણ સોની 46
વક્તન્ય :	ભારતીય શાસ્ત્રીય નૃત્યોના પરિપ્રેક્ષમાં નૃત્યાંગના ચંદ્રલેખાનું સમકાળીન નૃત્યમાં યોગદાન, સુનીલ કોઠારી 53
અભ્યાસ :	એક વાર્તાકાર, નોખો, અનોખો અને એની એક વાર્તા, હરિકૃષ્ણ પાઠક 68
સમીક્ષા/ગ્રંથાવલોકન :	કાલપાશ : કોરોનાકાળની કથા, સંધ્યા ભહ 71
પરિષદવૃત્તા :	સંકલન : કીર્તિદા શાહ 74
વિશેષ :	ગુજરાતી કવિતાની તાસકમાં બનારસી પાનનું બીંગું : બનારસ ડાયરી, અજ્યાસિંહ ચૌહાણ 84
આવરણચિત્ર : સંદર્ભનોંધ :	પીયૂષ ઠક્કર 88
આ અંકના લેખકો :	89
આવરણ :	જનક ત્રિવેદી

આ કાણે

‘પરબ’ સંદર્ભે મારી સંપાદનયાત્રા

‘મમ્મી’, મારી દીકરી કૃતિ બારમામાં હતી ત્યારે કહેતી, ‘પખાને તો આપણે માટે ટાઈમ જ નથી, નહિએ?! આખું અઠવાડિયું પખાને ઓફિસનું કામ અને રજાના દિવસે ‘પરબ’નું કામ.’

અત્યારે કૃતિ કેનેડા છે ને દોહિત્રી જિયા દર ‘સમર’માં દાદાને કેનેડા બોલાવે છે. આમ હવે લગભગ દર વરસે કેનેડા જવાનું થતું હોઈ ‘પરબ’ છોડવાનો નિર્ણય લીધો. તા. ૨-૧-૨૦૨૧ના રોજ એપ્રિલ, ૨૦૨૧નો અંક પ્રગટ થયા બાદ ‘પરબ’ છોડવા અંગે પ્રમુખશ્રી તથા મહામંત્રીને પત્ર લખ્યો ત્યારે જાણે હંમેશા માટે વતન છોડવાનું હોય તેવી લાગણી થયેલી. (ના યોગેશ, ના કવિ; આમ ભાવુક નહીં થવાનું.)

જીવ રેડીને અઢાર વર્ષ ‘પરબ’નું કામ સંભાળ્યું. ૨૦૦૩માં ‘પરબ’નું કામ મને સૌંપાયું ત્યારે અભિનંદન અને શુભેચ્છાના અનેક પત્રો મળેલા. એ પત્રો આ કાણે યાદ આવે છે. સિતાંશુભાઈએ લખેલું :

‘નિર્મણ સર્જકતા સાથે ‘પરબ’નું સંપાદનકાર્ય સંકાયાયેલું અનો આનંદ છે. ક. મા. મુનશી અને ઉમાશંકર જોશી, બંને પ્રભણ શક્તિમંત સર્જકો. પણ સંસ્થાસંચાલનના બે વિભિન્ન માર્ગ એમણે પરિષદને દર્શાવ્યા. પંસંદ પોતપોતાની; પણ તમને આ કામ સૌંપાને જે નિર્ણયરીતિ પ્રગટ કરાઈ, અનું સ્વાગત.’

તો, રાખેશ્યામ શર્માએ લખેલું :

‘‘પરબ’ના સંપાદકીયની સોડમ (‘આ કાણે’માં પણ) માણી ! સંપાદનનું કાર્ય તમે સર્સ બજાવશો જ. જૂથ, વાદ, પૂર્વગ્રહોથી તમે કવિ-સર્જક હોવાના કારણો ઠીક ઠીક મુક્ત રહી શકશો. તમાંનું સ્વમાન અને સ્વાતંત્ર્ય અકંબંધ રહે તો એ શબ્દની સાધનાનું વૃક્ષ ઓર મહોરી ઊઠશે..’

‘પરબ’ની કામગીરી મને સૌંપાઈ અનું કારણ મારો ‘વિશ્વમાનવ’ના સાહિત્ય વિભાગના સંપાદનનો અનુભવ. ‘વિશ્વમાનવ’ માટે મુ. ભોગીભાઈએ મને પૂરી સ્વાયત્તતા આપી હતી અને મોકાણા પણ.

હું કોઈ જૂથમાં નથી કે માટું કોઈ જૂથ નથી. કવિ, સર્જક હોવાના કારણો મારી ભીતર સમભાવ કેળવાયો છે. જૂથ, વાદ, પૂર્વગ્રહોથી મુક્ત રહીને ‘પરબ’નું કામ સંભાળવા મેં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. દર વર્ષ ડિસેમ્બરના અંકમાં પ્રગટ થતી ‘પરબ’ની વાર્ષિક સૂચિ જોતાં એનો જ્યાલ આવશે. પરિષદના મંત્રીઓ, હોદેદારોની કૃતિઓ પણ ‘પરબ’ માટે અનુકૂળ નથી લાગી તો મેં સાભાર પરત કરી છે. અન્ય ભિત્રોની કૃતિઓ પણ સ્વીકારી ન શકાઈ કે સ્વીકાર્ય પદ્ધી પ્રગટ કરવામાં વિલંબ થયો છે તો અણખો થયો છું ને કેટલાક ભિત્રોને માહું લાગ્યું છે. આ કાણે પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને કવિ સર્જક ઉશનસ્ સાંભરે છે. આઠ સોનેટમાંથી ચાર સાભાર પરત કર્યા હોય એનું એમને જરીકે ખરાબ ન લાગે; પણ બાકીનાં ચાર સોનેટ છધાય ત્યારે એમનું ‘ઇનલેન્ડ’ આવે; એમાં લખ્યું હોય - ‘તમે ચાર સોનેટ પ્રગટ કર્યા એનાથી પ્રોત્સાહિત થઈને આઠ સોનેટ રચાયાં

છે એ આ સાથે મોકલું છું.’ (ઉશનસ્સે સાભાર પરત કર્યા એવાં જ સોનેટ જો કોઈ નવોદિત કવિ પાસેથી મજાં હોત તો એ સ્વીકાર્યા હોત. સોનેટમાં ઉશનસ્સ પાસે ખૂબ અપેક્ષા હોવાના કારણે ઓછાં ગમેલાં સોનેટ પરત થતાં.) હા, પરિષદના ટ્રસ્ટી અને મોટા કવિ ભગતસાહેબની કેટલીક નબળી રચનાઓ પરત કરી શક્યો નહોતો. અંતિમ વર્ષોમાં એમના જન્મદિન નિમિત્તની નબળી, પ્રાસંગિક રચના ‘પરબ’ માટે મળતી અને હું પ્રગટ કરતો. કારણ આશા હતી, આમાંથી જ કોઈ ખૂબ સરસ કાવ્ય પણ સાંપદશે. તો, એમના અંતિમ જન્મદિન અદ્ભુત કાવ્ય ‘પરબ’ માટે મળેલું -

‘મૃત્યુને’

‘મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.

....

....

ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.

ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’

(‘બૃહદ છંદોલય, ૨૦૧૮, પૃ. ૪૨૨)

‘પરબ’ મને સોંપાયું એ પછી સૌપ્રથમ તંત્રીલેખ - ‘આ કાણે’માં મેં લખેલું :

‘બધીયે દિશાઓમાંથી શુભવિચારો પ્રાપ્ત થાય - ની જેમ બધીયે દિશાઓમાંથી ઉત્તમ રચનાઓ મળતી રહેશે ને સહુના સાથ-સહકારથી ‘પરબ’ વધુ ને વધુ ઉઘાડ પામતું જશે એવી શ્રદ્ધા સાથે વિરસું છું. (‘પરબ’, મે, ૨૦૦૩)

‘પરબ’ માટે અનેક સુંદર રચનાઓ મળતી રહી, એકાદંબે ઉદાહરણ આપું તો, સિતાંશુ યશશ્વન્દ્રનું કાવ્ય ‘વખાર’, ગુલામમોહમ્મદ શેખનો સુ.જો. વિષેનો લેખ - ‘મરમી ગોઠ ગુરુની’. (આ યાદી ઘણી લાંબી થઈ શકે.)

કોઈ ચોક્કસ સમયગાળામાં તાજગીભરી કૃતિઓની ભરતી ઉમટતી જોવા મળે છે, તો કોઈ સમયગાળામાં ઓટ, તો કોઈ ગાળામાં દુષ્કાળ. સુ.જો.ને ‘ક્ષિતિજ’ માટે જેવી કૃતિઓ સાંપાદી હતી તેવી તેઓ જ સંપાદક હોવા છાતાં ‘એતદ્દ’માં જોવા મળતી નહોતી.

એક પ્રમુખશ્રીએ પત્ર દ્વારા ‘પરબ’ માટેનાં સૂચનો મોકલ્યાં હતાં, એમાંથી એક-બે - ‘પરબ’માં પાંચેક પેજથી વધુ લાંબા લેખો લેવા નહીં. એક લેખકની કૃતિ ‘પરબ’માં પ્રગટ થાય ત્યારબાદ છ મહિના સુધી એ લેખકની કૃતિ ‘પરબ’માં ન લેવી. વગેરે. પરંતુ કવિ-સંપાદકે મૌનપૂર્વક એ સૂચનોનો અસ્વીકાર કરેલો.

‘પરબ’ને આકર્ષક બનાવવા માટે તો પછેરી પ્રમાણે પગ લાંબા કરવા પડે તેવી સ્થિતિ; છતાં પૂંઠા પર રંગીન ચિત્ર, સ્ટેપલર વગરનું બાઈન્ડિંગ, પૂંઠા માટે વધુ સારું કાર્ડ, થોડા વધુ સારા કાગળ વગેરે શક્ય બન્યું. ‘પરબ’ના પૂંઠા પરનાં ચિત્રો લા.ઠા.ને ગમતાં. એક વાર એમનો ફોન આવ્યો, ‘પૂંઠા પર સરસ ચિત્રો તમે પસંદ કરીને મૂકો છો; એ દરેક ચિત્ર વિશે તમે ટૂંકી નોંધ પણ લખો.’ (લા.ઠા. પાસે સત્યાજિત રેની ફિલ્મ ‘પથેર પાંચાલી’ વિશે લેખ કરાવ્યો હતો ત્યારે પૂંઠા પર એ ફિલ્મના એક દશયનો ફીટો મૂક્યો હતો - અપૂર્વની હથેળીનો કલોઝ-અપ અને એમાં ફરતો ભમરડો.) થયું, ચિત્રો

વિશે નોંધ લખવાનું તો માણું ગજું નહીં, પણ કવિ-ગ્રિતકાર મિત્ર પીપુષ ઠક્કરને કહ્યું હોય તો ? પછી પૂંઠા પરનાં ચિત્રોની પસંદગી, એની સજાવત તથા એના વિશે નોંધનું કામ પીપુષભાઈએ હરબનેર સંભાળ્યું એનો આનંદ વ્યક્ત કરું છું.

ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી આવી ત્યારે ‘પરબ’નો વિશેખાંક કરવાનું મન થયું. પરિષદ તરફથી એ માટેની મોકળાશ મળી અને એમનાં કાન્ના આસ્વાદનો વિશેખાંક થઈ શક્યો એનો આનંદ છે. અમેરિકાથી મધુસૂદન કાપડિયાનો ફોન આવેલો, વિશેખાંકથી તેઓ ખૂબ રાજી હતા, કહેલું - તમે ખૂબ સરસ રચનાઓ પસંદ કરી છે તથા કયું કાવ્ય આસ્વાદ માટે કોને સોંપવું એની પસંદગી તો ઉત્તમ થઈ છે. એ પછી અન્ય વિશેખાંકો પણ શક્ય બન્યા. પ્રભુલાદ પારેખ વિશેખાંક, કાન્ન વિશેખાંક, લા. ઠા. વિશેખાંક, ઉમાશંકરે કહેલું, ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં.’ આ અદાર વર્ષ દરમિયાન ‘પરબ’માં અનેક કાવ્યો / વાતર્થોના આસ્વાદ લેખ પ્રગટ થઈ શક્યા. લા. ઠા. જેવા અથરા કવિના કાવ્યોનો આસ્વાદ વિશેખાંક કરવો એ પડકારજનક હતું. કેટલાક મોટા વિવેચકોય મને ફોન કરીને કહેતા - ‘આના બદલે મને ‘વહી જતી પાછળ રમ્યઘોખા’ માંથી કોઈ કાવ્ય આપ ને !’ હા, રાજેશ પંડ્યા જેવા કવિ-વિવેચકને પડકાર ગીલવાનું ગમ્યું હતું. કોઈ અધરું કાવ્ય, જેના આસ્વાદ માટે બે-ત્રણ વિવેચકોની ‘ના’ આવ્યા પછી રાધેશ્યામ શર્મા વહારે આવે અને આસ્વાદ લેખ કરી આપે. આ વિશેખાંકો અભ્યાસીઓ તથા વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

અત્યારે ગ્રંથસમીક્ષા/અવલોકન માટે સમયસર સારો લેખ કરી આપે એવા અભ્યાસીઓની ખોટ વરતાય છે, સુ.જો.ના શબ્દો જરી બદલીને કહું તો અત્યારે વિવેચનનો નાભિશ્વાસ ચાલે છે; આવી પરિસ્થિતિમાં જયારે જયારે પ્રાસાંગિક લેખની જરૂર પરી કે વિશેખાંક માટે લેખની જરૂર પરી ત્યારે રાધેશ્યામ શર્મા, ચંદ્રકાન્ત શેઠ, રધુવીર ચૌધરી, ચંદ્રકાન્ત ટોપીવાળા, નરોત્તમ પલાણા, રમણ સોની, મહિલાલ ડ. પેટેલ, અરુણા જેજા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાળા પાસેથી લેખો મળતા રહ્યા છે. એમનો વિશેખ આભારી છું.

મે, ૨૦૨૦માં સુરેશ જોખીના જન્મદિવસ આવ્યો. જન્મશતાબ્દીવર્ષ શરૂ થયું. એમના વિશે ‘પરબ’નો વિશેખાંક કરવાનો ઉમળકો તો થયો; પણ લોકડાઉનના કારણે, કોરોનાના કપરા કાળાં પરિષદમાં મીટિંગ થઈ શકે તેમ નહોતું. આથી ‘શતાબ્દીવર્ણના’ વિભાગ ડેઢણ આખા વર્ષ દરમિયાન સુ.જો. વિશે, એમની કૃતિઓ વિશે કંઈક ને કંઈક પ્રગટ કરવાનું વિચાર્યું, મિત્રોને આ માટે ફોન પણ કર્યા ને લેખો મળતા રહ્યા તેમ પ્રગટ કર્યા.

‘પરબ’ માટે ક્યારેક મીઓયાનોય લાભ મળ્યો છે. ‘ફેસબુક’માં નવોદિત પારુલ ખખ્ખરની રચનાઓ જોઈ, એમાં તણખો જ્ઞાયાયો; તો એમની પાસેથી ‘પરબ’ માટે કાવ્યો મંગાવ્યા; ત્યારે એમનું નામ જાણીતું થયું નહોતું. અન્ય નામ પણ આમાં ઉમેરી શક્યા. સુરત તથા પાલનપુરના જ્ઞાનસત્રોમાં એક બેઠક નવોદિતો માટેની હતી. એમાંના બે-ત્રણ લેખકોની કૃતિઓ ‘પરબ’માં પ્રગટ કરેલી. આમ નવોદિતોની કૃતિઓ ‘પરબ’ને મળતી રહી એનો વિશેખ આનંદ. તો, WhatsAppના ચ્રૂપ - ‘સંસ્કૃત રસિક વુંદ’માં ગયે વર્ષ મિત્ર વિજય પંડ્યાએ અદ્ભુત સુભાષિત મૂકેલું ને એના વિશે સ-રસ નોંધ મૂકી હતી. એ જોતાં જ થયું, સંસ્કૃત સુભાષિતોના અશકૃતભંડારમાંથી પરિયામાં થોડો થોડો પ્રસાદ દર અંકે ‘પરબ’ના વાચકોને મળતો રહે તો ?! તરત મેં વિજયભાઈને ફોન કર્યો

- ‘પરબ’ માટે સુભાષિતોનો આસ્વાદ આપો. અને ‘પરબ’ને ‘સુભાષિત સ-રસ-વતી ધારા’ મળતી થઈ. વર્ષો અગાઉ મેં નીરવ પટેલનું કાવ્ય ‘પરબ’માં પ્રગટ કર્યું એ અગાઉ ‘પરબ’માં એમની કોઈ ફૂલ પ્રગટ થઈ નહોતી. એ કાવ્ય નીતિન મહેતા સંપાદિત પરિષદ્ધના કવિતાચયનમાં સ્થાન પામેલું.

મેં ‘પરબ’ સંભાષ્યું ત્યારે મને એકાદ વર્ષ ચાલે એટલી અગાઉના તંત્રીએ સ્વીકારેલી સામગ્રી વારસામાં મળી હતી. એ બધી મેં કમશઃ પ્રગટ કરી હતી. એમાંથી કેવળ એક લેખ પ્રગટ નહોતો કર્યો; એ લેખ મારી નવલકથા વિશે હતો. હું પણ છ-સાત મહિના ચાલે એટલી સ્વીકૃત સામગ્રી વારસામાં સોંપતો જઈ છું.

‘પરબ’ મને સોંપાયું એ અગાઉ ‘પરબ’માં ‘પ્રમુખીય’ લેખો પ્રગટ થતા નહોતા.

મેં બધા પ્રમુખોને વિનંતી કરી અને ‘પ્રમુખીય’ લેખો ‘પરબ’ને મળતા થયા. પરિષામે સિતાંશુ યશશ્વર પાસેથી ત્રણ વર્ષ સુધી, ‘સમકાળીન ભારતીય કવિતા : આપણી વાત આપણી રીતે’ લેખમાળામાં અદ્ભુત લેખો મળ્યા. સિતાંશુ જ લખી શકે તેવા લેખો. સમકાળીન ભારતીય કવિતા વિશે આવા સ-રસ લેખો કદાચ અન્ય ભાષામાં પણ પ્રગટ નહિ થયા હોય.

‘પરબ’ના કારણો જ કેટલાક દીર્ઘ તંત્રીલેખો થઈ શક્યા. ‘પરબ’ની કામગીરી ન હોત તો આમાંના ઘણા લેખો થયા ન હોત; એ નિભિતે ઊડો અત્યાસ કરવાની તક મળી એનોય વિશેષ આનંદ. મે. ૨૦૦૩થી ‘પરબ’નું કામ કરવા મળ્યું એ બદલ આનંદ અને ગૌરવ સહ ગુજરાતી સાહિત્ય પરિષદ્ધનો આભાર માનું છું. આ સમયગણાના સહુ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ, સહતંત્રીઓ, કારોબારી તથા મધ્યસ્થ સમિતિના સભ્યો, પરિષદ કાર્યાલયના સહુ કાર્યકરો તથા ચી. મં. ગ્રંથાલયના સહુ કર્મિઓનો આભાર માનું છું. ‘પરબ’ના પ્રકાશનમાં ખૂબ ચીવટથી કામ કરનાર ચંદ્રકાન્ત ભાવસારનો વિશેષ આભાર માનું છું. લોકડાઉન, કોરોનાના સમયમાં ‘પરબ’ને પરિષદ્ધની સાઈટ પર અપલોડ કરવા બદલ ડુપલબહેનનો આભારી છું. જ્યારે જ્યારે મારે કેનેડા જવાનું થયું ત્યારે ત્યારે ‘પરબ’ સંભાળીને મને ભારમુક્ત કરવા બદલ મિત્ર પ્રહુલ્લ રાવલનો આભારી છું. ‘પરબ’ના સહુ સહદ્ય ભાવકોનોય આભારી છું. મને ‘પરબ’ની જવાબદારીમાંથી મુક્ત કરવા બદલ તથા નવા તંત્રી - સંપાદકની સમયસર વરણી કરવા માટે કારોબારી અને મધ્યસ્થ સમિતિનો આભાર માનું છું. ‘પરબ’ના વરાયેલા તંત્રી અજ્યાંસીંહ ચૌહાણ તથા સંપાદક ભરત મહેતાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

સર્જન સિવાયનાં અન્ય કામો હવે ધીમે ધીમે આટોપવાનું મનમાં છે. શેષ સમય હવે કેવળ સર્જનમાં (જો સહજ થાય તો) તથા મારાં સંતાનોનાં બાળકોમાં રોપવાનું મનમાં છે. કવિવર રાજેન્દ્ર શાહની પંક્તિ ટાંકીને કહું તો, બસ હવે -

‘મન મારું લઈ જાય તાં જાવું
પ્રેમને સંનિવેશો
નિરુદ્ધરો.’

તા. ૨૪-૩-૨૧
અમદાવાદ.

- યોગેશ જોધી

પ્રમુખીય

ભાષક અને ભાષા

પ્રકાશ ન. શાહ

સહસ્રાબ્દીઓથી ભારતીય જનમાનસને સારુ હનુમાનના પાત્ર માટે જે પણ આત્મીયતા અને ઓળખ રહી હશે એમાં એમણે એક રામભક્ત તરીકે સ્થાપેલ પ્રતિમાનનો સ્વાભાવિક જ સિહાલિસ્સો હશે. પણ આ ક્ષણો કોતુક ને જિજ્ઞાસાને ધોરણો હું જે વિગતમુદ્દો કરવા ઈચ્છા હું તે તો રામે હનુમાનને પહેલપ્રથમ શી વાતે પ્રીધ્યા હશે એ છે. હમણે હમણે આ પાને સહજ ચાલી આવતી ચર્ચા ભાષાની છે, અને એ સંદર્ભમાં મને રામે (ખું જોતાં આદિકવિને) હનુમાનનો શો વિરોધ નોંધ્યો છે એ વાનું બેંગે છે.

સમય સીતાહરણ પછી રામ જે તાવણીમાંથી પસાર થઈ રહ્યા હતા તે છે. આકુળ-વ્યાકુળ, વિરહબ્યગ એવો એ ગાળો એમને સારુ હતો. એવામાં, કોણ છે આ બે, એની તપાસ માટે સુશ્રીવે મોકલ્યા હનુમાન સાથે એમનો જેટો થાય છે. હનુમાનનાં વચનો વિરહબ્યગ રામને કંઈક જુદ્દો જ અનુભવ કરાવે છે. અસ્વસ્થતા વચ્ચે સ્વસ્થતા જગવતાં એ વચનો છે, વસ્તુના અર્થમાં તો બચાવર પણ અભિવ્યક્તિના અર્થમાં; કથ્યિતવની રીતે સરસ પણ કથનરીતિની રીતે સવિશેષ સરસ. રામ નોંધે છે કે આ વ્યક્તિ ‘ઉત્તમ અને સ્પષ્ટ સંભાષણ’નો ગુણ ધરાવે છે. વળી, એણે વ્યાકરણનો પણ સંપૂર્ણ અભ્યાસ કરેલો જણાય છે; કેમ કે સમગ્ર સંભાષણમાં એકે અશુદ્ધ શબ્દ સાંભળવામાં આવ્યો નથી. સ્પષ્ટ શબ્દો અને સ્પષ્ટ પદોવાળી વાણી એ ન તો બહુ ઉતાવળે, ન તો બહુ ધીમે એ રીતે ઉચ્ચારે છે.

એક પાત્રવિશેષની વાણી કે ભાષાની વાત આ તો થઈ. પણ, વસ્તુતઃ સમગ્ર મનુષ્યજીતિને ઈતર માણિસૂચિથી જુદ્દી અને ઊંચી સ્થાપતી કોઈ એક વાત હોય તો વાણી અગર ભાષા છે. મેઝલુહાન જેવા મનુષ્યનો વિશેષ એની જે ઓજારનિર્મિતિની ગુંજાશ છે એમાં ભલે જોતા હોય પણ ‘સિટી’ખ્યાત મર્ફ્ક તો મનુષ્યનો વિશેષ ભાષામાં જ જોશે અને શોધશે.

ભાષા-સંવાદ કહો કે ભાષા-વિવાદ આપણે ત્યાં માધ્યમ આસપાસ ખાસો ચાલ્યો છે. નિરંજન ભગતે એનો આબાદ ઉકેલ, દાયકાઓ પર ‘ઉત્તમ અંગ્રેજ, માધ્યમ ગુજરાતી’ એ કહેવત સંદર્શ લઢણે સૂચવેલો છે. આ સમજ સુધી પહોંચતાં આપણે ખાસો સમય લીધો છે, અને હજુ પણ સમજટાંચા એટલા જ સંકલ્પટાંચા તો આપણે છીએ તે છીએ.

તવારીખના એકબે ટુકડા સંભારું જરી ? ગુજરાતી વ્યાકરણની ભોંગનારાઓમાં રેવરંડ ટેલરનું નામ આપણે હોંશે હોંશે લેતા રહ્યા છીએ. ૧૮૧૭ના ઓક્ટોબરમાં ભરુચમાં

જ્યારે ગુજરાત કેળવણી પરિષદનું બીજું અધિવેશન મય્યું ત્યારે ગાંધીજીએ પ્રમુખસ્થાનેથી બોલતાં ટેલરનાં એ વચ્ચેનો સંભાર્યો હતાં કે ‘ગુજરાતી - આર્થકુળની - સંસ્કૃતની પુત્રી - ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી ! તેને કોણ કદ્દી અધમ કહે ? પ્રભુ અને આશીર્વાદ દેશો !’ જુગ જુગના અંત સુધી તેની વાણીમાં સદ્ગિતા, સદ્ગ્રાન, સદ્ગ્રભનો સુભોધ હજો !’ ગાંધીજીએ ભરુચની કેળવણી પરિષદની રાગેથી ગુજરાતી માધ્યમનો આ જે લગભગ શંખધ્વનિ કર્યો એનો સંદર્ભ સમજવા જેવો છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ સરખા ગુરુજે એ અરસામાં ‘વસંત’માં અંગ્રેજ ભાષા મારફતે જ શાલેય શિક્ષણની હિમાયત કરતો લેખ લખ્યો હતો. ગમે તેમ પણ, હમણાં ટેલરના જે લેખી ઉદ્ગારો સંભાર્યો એમાંથી બુલંદીભેર પ્રગટ થવા કરતો પડકારમુદ્રા, એમના આખા લગ્નામાંથી પસાર થતાં સામો આવી ઊભો રહે છે તે તો આ : યથા ભાષક તથા ભાષા. એ સમય ડેન્ટિના ‘નોવા વિવા’ની અસર તેણે ‘નવજીવન’નો હતો, અને ભાષા ને ભાષક બેઉ વચ્ચે નવ્ય પારસ્પરની બિલવણીના પડકારનો હતો.

ઈતિહાસવસ્તુની રીતે, અહીં જોકે એ નોંધવું ઘટે છે કે ઓક્ટોબર ૧૯૨૮માં નડિયાદ ખાતે નવમી સાહિત્ય પરિષદ મળી ત્યારે આનંદશંકર, આજની ભાષામાં કહીએ તો ગાંધીજી સાથે એક જ પેજ પર જગ્યાય છે. એમણે કહ્યું હતું : ‘૧૯૪૭માં આપણી મુખ્ય યનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિગ્નિયામાં માતૃભાષા સૂત્રવત્ત પરોવાયેલી નથી એ જ છે. રાજી રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણપ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે...’

હવે તો એ વાતને સાત દાયકા કરતાં પણ વધુ સમય થયો. જ્યારે ‘૧૯૮૪’કાર જ્યોર્જ ઓરવેલે, એમનો સુપ્રતિક નિબંધ કરેલો, ‘પોલિટિક્સ એન્ડ ધ ઇન્ડિયલ લેંગ્વેજ.’ કેટલું બધું કુગાવીને લખતા હોઈએ છીએ આપણો, ઓરવેલે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આજકાલ જે બધું લખાય છે તે સ્પષ્ટ કથન અને સ્પષ્ટ અર્થ સારુ યોજાતા શબ્દોથી વધુ તો જથ્થાબંધ જાથુકી શબ્દસમૂહોની છાપ આપે છે. રામને હનુમાનના શીલનો સાક્ષાત્કારક પરિયય એમના શુદ્ધ સંભાષણ થકી થયેલો એ વાલ્ભીક્રિવિધાન યાદ કરીએ તો તરત ઓરવેલની એ વાત પણ સમજાશે કે ભાષામાં ખરાબી વરતાય તે સમજામાં, સત્યતામાં પ્રવેશેલી અને પ્રવેશી રહેલી ખરાબી દર્શાવે છે. પણ આટલું કહીને ઓરવેલ છૂટી નથી પડતા. જે એક માકનીની, બિલકુલ માર્ભિક વાત એ ઉમેરે છે તે એ કે ભાષા કેવળ સમજાનું પ્રતીક્રિય દર્શાવે છે એવું નથી; ભાષા સમજાજને ઘડે પણ છે.

બધા છેડા ઠીક જોડાયા ન જોડાયા પણ વાયક ફેલ્બુઅારી, માર્ય અને એપ્રિલનાં પ્રમુખીય સાથે રાખીને વાંચતાં કંઈક સમગ્ર ચિત્ર મેળવી શકશે એ આશા સાથે આટલે

લગી પહોંચતાં જે કહેવાનું પ્રામૃ થાય છે તે એ કે ભાષા અને ભાષક વચ્ચે એક અવિનાભાવ સંબંધ પ્રવર્તે છે અને પ્રશ્ન ને પડકાર કોઈ પણ હોય તો તે સાર્થક પારસ્પર્ય કેળવવાનો છે.

હમણાં ગાંધીજીને આપણે ભરુચમાં મળ્યા, ૧૯૧૭માં; ને કેળવણી પરિષદની રાંગેથી એમને સાંભળ્યા પણ. હવે થોડું આગળ ચાલીએ ? ૧૯૨૦માં. એ વરસે, એપ્રિલમાં અમદાવાદમાં સાહિત્ય પરિષદનું છુંછું અધિવેશન મળ્યું હતું, હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે. બરાબર એકસો એક વરસ પરના આ અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગ્યા કરતું હોય છે કે ગાંધીજીને હરાવીને કાંટાવાળા ચુંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ કહે કે કાંટાવાળાએ પ્રમુખીય વક્તવ્યમાં ગાંધીજીને કેવી રીતે સબહુમાન સંભાર્યા હતા ? એમણે કહ્યું હતું :

‘જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની છિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગુર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.’

ઓરવલે જે યુગચિંતા બોલી બતાવી હતી - ભાષાના પતનની ને સભ્યતાની હાજાની, એમાં સર્વાંગી ને સર્વાંગ ધોરણે રસ લઈ નેતૃત્વ, કર્તૃત્વ અને યોજકત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ગાંધી ભાતના છે કોઈ ખરીદાર.



સાહિત્યવૃત્ત મોકલવા માટે ઈમેઇલ આઈડી

આપની આસપાસ થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ, જેમાં આપ ઉપસ્થિત રહ્યા હો, આપે ભાગ લીધો હોય કે પછી આપે આપોજન કર્યું હોય તો એ કાર્યક્રમ વિશેની ટૂંકી નોંધ ઈમેઇલ દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદને મોકલી શકો હો. નોંધ જે ફોન્ટમાં કંપોઝ કરી હોય એ ફોન્ટ સાથે અચૂક મોકલવા. એ માટેનું ઈમેઇલ આઈડી છે : vruttparabgsp2018@gmail.com

બે ગીત | હરીશ મીનાશુ

એક

ભાણો બેસો તો થોડું ભાવશે
મનમોળું! તમે ભાણો બેસો તો થોડું ભાવશે
(સ્મરણપુષ્ય: અરવિંદ ભક્ત)

*

ઉંબરે ઊભીને વાટ જોશો તો પરદેશી
પોપટાની જેમ કોક આવશે
ટગરી પર ઝૂલીને, ઓલ્યા ઓલ્યા ભવનાં તે
સાગપણ અધૂરાં સંભારશે

કરશો જો કાન તમે સરવા તો સંભળાશે બીજમાંય મર્મર ઘેઘૂરની
શોધશો તો જડશો એકાં ધૂટી ધૂધરી કીડીના ખંડિત નૂપુરની
આંબાની ડાળખીને ચપટી વસંત તમે
આલશો તો મંજરી ઝૂલાવશે
પડી ટેવ લીલા તે રંગની એ વૈશાખ
કેસરિયા જાણે ભુલાવશે

કરવાનું આટલું છે, કાગળને કાગળ નેં, સમજો કે એ તો છે વ્યોમ
શાહીનું ટપકુંયે જળહળશે જાણો માણોકંઠારી પૂનમનો સોમ
બત્તીસાં ભોજન ના હોય ભાસે પીરસેલાં
ભાણો બેસો તો થોડું ભાવશે
દૂધ મહીની સાકરને ભેળવ્યા લગાર
કોક મુસીભર તાંદુલ ભભરાવશે

(પુષ્યસ્મરણ: નવલરામ પંડ્યા - બ. ક. ઠાકોર)

*

બે

પાંચ સાત પાંચ
બાજરીના એટલા જ દાણા સમાય, મારી હાઈકુના માપની છે ચાંચ
વાત પિત કફ અને કાફિયાનો એવો તો
અધરાતે વત્યો પ્રકોપ
પડતી મૂકું રે હું તો અડધી ગજલ, કરું
વાર્તાયાં ઘટનાનો લોપ

જૂલવા ગયો તો હવે જૂલણાય માંગે છે મહેતા નરસૈંયાનું સાંચ
પીગળી ગયું રે મારું કાંદુ કલમ સોત, અડકી જ્યાં અક્ષરની આંચ

ચકલાંનું જોડું જો નંદવાય, થાય મને
પુરાકથા જેવો વિખાદ
ચીપિયાથી ચાપ હે પકું અનુષ્ટુપ કે
પિંગળમુનિય દિયે દાદ

સરસતીએ શીધું, કરાવ્ય હવે ભાઈ, લોહી મૂતર ને જોડણીની જાંચ
‘પૂછું, કટેવ મહને’ - એમ કરી બલલુકાકાય વેણ કડવાં ઉવાચ
ઓસડિયાં ચાટી ઓથારિયા હડકવાનાં
નવલો નિબંધ ઘડી વાંચ

બે ગીત | વિનોદ જોશી

૧. ઓ જાદુગર

ખાંડી ખાંડી તડકો એનો નરમ છાંયડો ક્રીધો,
ઓ જાદુગર! તેં વગડાને સાંગ ચાખી લીધો...

તારી આંખો હજી પીરસે ગળયહું પકવાન,
હજી હોઠ પર હડી કાઢતાં તસતસતાં તોફાન;
જરા જાંબૂલી બધો ઉમળકો તળિયાંજાટક પીધો...

મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ,
મખમલિયા ગાલીયા પર પથરાતું ભીંનું તેજ;
કમળપાંદડી વરયે મેં ભમરાને ભીડી દીધો...

૨. આ હું આવ્યો...

આ હું આવ્યો, ધસ્યો, જાંબૂલ્યો, ગયો નીકળી ચોંપટ,
ભલે કહે તું વાવાઝોડું, હું વગડાનો પોપટ...

અમથી પાંખો સાવ અજાણી એક વેલને અરી,
રણહણતાં ચિક્કાર પાંદડે ખળખળ નદિયું ચડી;
કોને કોની તરસ એ જ કરવી'તી મીઢી ચોવટ...

મને ઊડવું ગમ્યું હવાના વળાંક ચાખી ચાખી,
ખરબચડા ટહુકાથી ટોચી, ભરી પાંખમાં આખી;
સાચ્યેસાચ્યું કહું મને મેં, તને લાગતું ફોગટ...

બે ટેબલ કાવ્યો | રમણીક સોમેશ્વર

૧

શબ્દો
 ધૂમમસમાં દૂબ્યા છે
 અને હું
 સૂરજ ઊગવાની
 રાહ જોયા કરું છું
 દરિયા જેવું ટેબલ
 ભરતી-ઓટમાં
 ઊચકાતું-પદ્ધતાતું રહે છે
 અચાનક
 મોજાં ઊછળે છે
 હોડીઓ
 તણે-ઉપર થાય છે
 કંઠે બેઠલા થોકરાના ગલમાં
 પકડાતી નથી
 એક પણ માછલી
 પરવાળાના ટાપુ
 દરિયાનાં મોજાંના
 ચાળા પાડે છે
 હેઈસો હેઈસો
 પોકારતો હું
 હલેસાની જેમ
 હલાવ્યા કરું છું કલમને
 આમથી તેમ
 ઓચિંતું
 શાલીનું એક ટીપું
 ટપકે છે
 હવે
 સૂરજ ઊગે
 તો ખબર પડે કે
 એ
 ટપકું
 મોતી છે
 કે
 રેતી

૨

કપાયેલા જંગલોના કણસાટથી
 કંપતું ટેબલ
 ફસડાઈ પડજું છે
 દીવાલો વચ્ચે
 થોડેક જ ઉંચે
 ફેલાયેલી છત
 એજ એનું આકાશ
 બંધ ઓરડાએ
 ભૂસી નાખી છે
 બધી ઋતુઓને
 દૂર દૂરથી
 આવતા રહે છે વાવડ
 ગંધીલી હવાઓના
 કબાટમાં
 ઢણી પડેલી ચોપરીઓ
 ભૂલવા લાગી છે
 પોતપોતાની ભાષાઓ
 ટેબલ પરનો કાગળ
 સુંધ્યા કરે છે હવે
 કુવળ
 પડછાયાઓને

ચાર ગજલ | હેમત ધોરડા

૧

રાતે થઈ ચાંદની દિવસે થઈ તડકો નીકળું
સાંજથી મારી હું કયારે કદી આખ્યો નીકળું
કટકે કટકે પ્રતિદિન નીકળું છું મારામાંથી
થોડો નીકળું ફરી થોડો ફરી થોડો નીકળું
કદી તો હોઉં હું દોચા વિના ખોબો મોતી
તો વળી મોતી વિનાનો કદી દોરો નીકળું
હું જ છું આંગળી પણ ને વળી નખ પણ હું જ છું
રહીને વેગળો થોડો જ હું મારો નીકળું
ઘાસ છું જાણે શું હોવું શું ન હોવું મારું
પાછો ધરબાઉ હું મારામાં ને પાછો નીકળું

(છંદ વિધાન : ગાલગાગા / લલગાગા / લલગાગા લલગાગા ગાગા / લલગા)

૨

થર પછી થરનું નીકળું ન કદી પૂરું થાય
મારું કહેવું મને સમજાય નહીં એવું થાય
મારી પાસે જરા પણ બાકી સિલકમાં હું નથી
આંખો ભીંચી મને ખર્યો મેં તો બીજું શું થાય
ગાંઠ રેશમની નથી બાંધી મેં મારી સાથે
કૃયાંક બંધાય કશું કૃયાંક કશું છૂઢું થાય
જીદ પણ પકડી તો શું પકડી કે કાદવ ના થાઉં
હું જ માટી હું જ પાણી તો પછી કેવું થાય
મારા અંધારમાં હું એકલો હું ગુમસૂમ હું
મારી સાથે હું કશું બોલું તો અજવાણું થાય

(છંદ વિધાન : ગાલગાગા / લલગાગા / લલગાગા લલગાગા ગાગા / લલગા)

૩

મારી સાથે હજુ હું કેટલું ખોટું બોલું
 કદી મારા વિશે અડધું કદી પડધું બોલું
 હવે તો સાવ અજાણ્યો મને હું લાગું છું
 મારી સાથે હવે બોલુંય હું તો શું બોલું
 નથી એવું કે સદા વરસું કદી જરમરું છું
 ઓછું આવે મને મારાથી તો ઓછું બોલું
 ફળ રૂપે જૂલવું ના હો તો ઊગું ઘાસ રૂપે
 મને કંઈ કહેવું ન હો મારે તો અમધું બોલું
 મારી સાથે મને બનતું તો નથી પણ શું થાય
 મને કયારેક મળું તો હસું સરખું બોલું

(છંદવિધાન : ગાલગાગા/લલગાગા લલગાગા/ લલગાગા ગાગા/લલગા)

૪

જુદો જરી ફરી દર્પણમાં હું તરી આવ્યો
 મેં ક્યારે પાછો મને આમ થોડો બદલાવ્યો
 આ દોડધામમાં હું ઓળખી શક્યો ન મને
 હતો હું સામે અને મેં મને ન બોલાવ્યો
 મેં મારી વાત કદી માની છે કે માનું હવે
 મેં આખી રાત મને બહુ ધીરજથી સમજાવ્યો
 હું ઢાળ પણ ને જરણ પણ ને હું જ પાંદરું પણ
 મેં ખોયો કયાં મને હું કયાં મને મળી આવ્યો
 હું કોઈ વાતે મને આજ છોડતે જ નહીં
 ગજલ કહી અને મેં મારો જીવ છોડાવ્યો

(છંદવિધાન : લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા)

એક ગીત | અનિલ ચાવડા

અલ્યા જાડ! બહુ રાખ નહીં તોર!
કાલ સુધી સૂક્ષ્મભઠ તિભુ'તું, આજ તને માંડમાંડ આવ્યા છે મોર;

ભૂલી જ્યું વગડાઉ એકલતા ઓઢીને
તિભુ'તું સુક્કા વેરાનમાં?
એ વખતે આવીને રોજરોજ રેડ્યા'તા
ટહુકાંઓ મેં જ તારા કાનમાં,

આજ તને અંગઅંગ ફૂટયું છે યૌવન, આ એનું છે લીલુંછમ જોર?
અલ્યા જાડ! બહુ રાખ નહીં તોર!

જૂના ખંડર જેમ જર્જર બહુ થઈ ગઈ'તી
એકએક ડાળખીની દેરીઓ,
આજ બધા આવ્યા છે કારણ કે તારી પર
બેરી છે મધ્યમીઠી કેરીઓ;

કુલશશી ના થા આમ અતિથિ પંખીનો સાંભળીને કલબલતો શોર!
અલ્યા જાડ! બહુ રાખ નહીં તોર!

બદલાશો મોસમ તો પળ બે પળમાં જ તારા
ખરવાનાં ફળ-કૂલ પાન,
યાત્રાળું પંખીઓ તુડી જાશે ને પછી
તારી પર દેશે કોણ ધ્યાન?

એ વખતે એકલા જ વેઠવાના ધગધગતા તડકા ને અંધારા ધોર,
અલ્યા જાડ! બહુ રાખ નહીં તોર!

બે ગ્રંથા | ઉર્વિશ વસાવડા

૧. કઈ રીતે મળશે તને?

અન્યના વહેવારમાં તું જાતને શોધે અગર તો કઈ રીતે મળશે તને?
મૂળમાં જે વ્યાપ્ત છે એ શાખમાં શોધે અગર તો કઈ રીતે મળશે તને?

આ રીતે અભિનથી તું ભોજન પકાવી નહિ શકે નક્કી જ છે!
દેવતાને તું બુઝેલી રાખમાં શોધે અગર તો કઈ રીતે મળશે તને?

એક સપણું આપણે દાટી દીધું એ વાતને વરસો વીત્યાં છે
ને પછી તું સ્વખન મારી આંખમાં શોધે અગર તો કઈ રીતે મળશે તને?

માત્ર ધબકારો જ એક સાબિત કરી દે છે કે જીવન છે અહીં
એ જ ધબકારાને કોઈ લાશમાં શોધે અગર તો કઈ રીતે મળશે તને?

કંદમાં દૂમો થઈ અટકી ગયેલાં આપણા ગીતો બધાં
તું કોઈ તૂટી ગયેલા સાજમાં શોધે અગર તો કઈ રીતે મળશે તને?

૨. સ્વાગત કરું છું હું

પ્રત્યેકના વિચારનું સ્વાગત કરું છું હું
એવી થતા પ્રહારનું સ્વાગત કરું છું હું

મારા શ્રવણ પ્રદેશમાં કાયમ વસંત છે
ટહુકાઓથી સવારનું સ્વાગત કરું છું હું

એવું નથી હકારને પોઢ્યા કરું સદા
હો સ્પષ્ટ તો નકારનું સ્વાગત કરું છું હું

વૈભવ વધે છે ધાસનો એના જ કારણે
મોતી સમા તુધારનું સ્વાગત કરું છું હું

આકાશ ભર્યું ભાર્યું જોવું ગમે મને
પંખીની આ કતારનું સ્વાગત કરું છું હું

પાંચ કાવ્યો | વજેસિંહ પારગી

૧.

વાત હોત
એકાદ વેલ ઉછેરવાની
તો
આંસુ સીંચીનેય
ઉછેરી દેત
અમણે તો
ધરી દીધી
રણ જેવી હથેળી
ન ફરમાયું
રચી દે મને
રણદીપ

૨.

ગમતું હતું
હથેળીમાં રાખ્યું હતું
એ ઊરી ગયું
મેટીના રંગની જેમ
ગમતું નહોતું
લાખ વાર નકાર્યું હતું
એ રહી ગયું
હાથમાં
હસ્તરેખાની જેમ

૩.

એકે ટિવસ
નથી પાડ્યો
આકાશે પડધો
કે
નથી દીધો
ધરનીએ હોકારો
નથી કોઈ
હામી ભરનાર
તો

કુમ પડાવે છે પોકાર

રોજ ઊઠીને

આ પીડા

૪.

અંજ જોયું
મેઘધનુષ
પણ ઊરી ગયા
એક પછી એક
સાતે રંગ
મેઘધનુષ પણ
ભરી ન શક્યું
કોઈ રંગ
ભૂખરી આંખમાં

૫.

જવાનું છે દૂરદૂર
લઈને મારે પાણી
ને જમ્યે જાય છે
પળેપળ કાચો ઘડો
કોણ જાણો
તરસ્યા પાસે પૂગતાં
બચશે ખોબો પાણી
કે રહેશે હાથમાં
ખાલીખમ ઘડો

એકાંકી

હું, તું અને મિસ્ટર સિમથ

દિગ્દીશ મહેતા

(ગતાંકથી ચાલુ; એકાંકીકાર દિગ્દીશ મહેતા : પરેશ નાયક)

પાત્રો

આસીત
રેશમા
પરાગ

પહેલો પડદો

(બસ સ્ટેન્ડ. આસીત અને રેશમા તેમની ત્રિશીના આરંભ છે; રેશમા જરા ઉત્સવને કારણે સાડીમાં છે.)

આસીત : છ પાંત્રીસની ગઈ હશે ?

રેશમા : છ પાંત્રીસની ? સવા સાત થવા આવ્યા હશે. સાડા સાત...

આસીત : કોઈ દેખાતુંય નથી. હમજાં જ ગઈ લાગે છે.

રેશમા : ગમે તેટલી વાર થાય. હું આજે ચાલવાની નથી.

આસીત : થોડે સુધી ચાલી નાખીએને, પોર્ટ ઓફિસ સુધી, તો ત્યાંથી ઘડી મળશે...

રેશમા : ના...

આસીત : ના... તો કંઈ નહિ ! ઊભા છીએ. આવશે.

રેશમા : આ લગ્નમાં મને નકામી ખેંચી લાવ્યો. તું જઈને ચાંલ્ખો કરી આવ્યો હોત તો ચાલત.

આસીત : મને એમ કે...

રેશમા : કંટાળી ગઈ. હા રિસેપ્શન કે એવું હોય તો... જમવાનું તો વેરેય મળત...

આસીત : અરે, હવે તો આપણા લોકો સુધ્યાં એમ કહે. બાકી પહેલાં તો... મેં જોયા છે... મારા ગામમાં... એકચુઅલી થાળી વાટકા લઈ, પિતાભરી પહેરી, ઉઘાડા-ઉઘાડા સાંજે છ વાગ્યાથી વાડીમાં.

રેશમા : ગંદા !

આસીત : ગંદા કહે તો ગંદા. પણ (કંડા પરની ઘડિયાળમાં જોઈ) હજુય કેમ ન આવી ?

રેશમા : મને ન અપાવે તો ચાલે. પણ તારે ઘડિયાળ જોઈએ.

આસિત : પહેલા તારી... મારી તો થઈ પડશે...

રેશમા : તારે ઓફિસે જવું...

આસિત : મારા બાપુજી તને જોવા ન મળ્યા.

રેશમા : તને જોયો છે એટલું પૂરતું છે.

આસિત : અરે એવી એવી વાતો કરતા'તા. ...ક્યાં એ સમય... અને ક્યાં અત્યારનાં રિસેપ્શાનો... આમ ગેટ પાસે જ ફૂલોની થાળી લઈને કોઈ ઊનું હોય ને.... જ્ય જ્ય... ને હાઉ આર યુ... ને શેરીક હેન્ડ... ને.... લેશો? નહિ.... થેંક્યુ....

રેશમા : બોલ, બોલ, બોલ... બસ જતી રહેશે...

આસિત : કોકવાર તો એમ થાય છે કે થોડા પૈસા બચે તો ઘડિયાળ - બડિયાળ તો ટીક પણ એક સૂટ સીવડાવું... કે પછી ભાડે લઈ આવું... ને મેરેજની સીજન આવે એટલ રોજ સાંજે એ પહેરીને નીકળી પડવાનું... હલો... ને હાઉ આર યુ... ને થેંક્યુ... ને લ્યીજ ડૂન્ટ એન્શન ઈટ... બસ સ્માઇલ આપ્ય કરવાનું... બે-ચાર ઠેકાણો ફરી આવીએ તો સાંજનું જમવાનું નીકળી જાય....

રેશમા : આવા ને આવા વિચાર કર્યા કરે છે એના કરતાં... મને નોકરી કરવા દેને... પગાર ટૂંકો પડતો હોય તો...

આસિત : નહિ.... નેવર... તને નોકરી નહિ કરવા દેવાની.

રેશમા : ખાલી ખીસે પાછી ખુમારી !

આસિત : ખુમારી નહિ....

રેશમા : તો પછી બીક... કે હું વળી કોઈ બોસના ચક્કરમાં... ઈઝ્ય...

આસિત : હોતું હશે...? તારે વિષે ?

રેશમા : કંઈ કેટલીય છોકરીઓ નોકરી કરે છે.

આસિત : ભલે કરે ! (હવે જરા વિચારમાં પડી જઈ) પણ કંઈક કરવું પડશે... થોડી એક એકસ્ટ્રા ઈન્કમ હોયને... સાઈડ ઈન્કમ...કેટલી? મહિને દાહાડે બસો ગણો... બહુ બહુ તો સાડા ત્રણસોની... વધારે નહિ... કંઈક આઈડિયા જોઈએ... શું કરી શકાય?... કે જેથી - એક આંટો મારે છે)

રેશમા : અરે અત્યારે મગજ કસીશ નહીં.

આસિત : વીમાનું કરાય. વીમા એજન્ટ થવાય. પણ એ મારા સ્વભાવમાં નથી. (વીમા એજન્ટનું એકશન કરતાં) ભાઈશ્રી મનસુખરાય... તમે આમ બાળબચ્ચાં લઈ બજારમાં અત્યારે મહાલો છો ને કટપીસના સ્ટોરમાંથી નીકળીને ભેળપૂરીના ખૂમચા તરફ ધ્સો છો પણ યાદ રાખજો કે એક દિવસ આવશે કે તમારા પોતાના કટપીસ થઈ જશે ને જ્યારે ખુદ તમને જ ખૂમચામાં ભરીને... તો એ દિવસ માટે તૈયારી કરો અને વી... (એ રોલ મૂકી દઈ) ન ફાવે... મને ન ફાવે... એને માટે જે પરપીડનવૃત્તિ જોઈએને... એ નથી... આઈ

એમ નો સેટિસ્ટ... સાલું એ પણ નથી.

રેશમા : મને તો ધડ્યોય પીડી છે.

આસિત : તારી વાત જુદી છે... પણ... શું કરાય ? શું કરી શું શકાય ? ફાઉન્ટન પેનો વેચું ? ઓફિસ છૂટ્યા પછી ત્રાણ દરવાજે ઊભો રહું... (... એક્ટિંગ કરતાં) શ... (ઉંચો થઈ)... સા... સાહેબ ! (કાલ્યનિક ફાઉન્ટન પેનો ધરતાં) સાહેબ એક્કેક રૂપિયે... એક્કેક રૂપિયે... બે રૂપિયાની એક્કેક રૂપિયે... (રોલ પડતો મૂકતાં) પણ એમાં... શું વળે ? શું મળતર ?... રેશમા ! લોકો વસ્તુઓય જાતજાતની વેચે છે.... તું નહીં માને... એકવાર એક માણસ... તું જુએ તો વળી ગયેલો, ભરકાળી આગળ નાણિયેરનાં છોતરાં પક્ખાં હોય છુને એવો છોલાઈ ગયેલો, ઘસાઈ ગયેલો ચહેરો... જૂનો ફાટેલો કોટ... થોડીથોડી ધોળી દાઢી ફરકે ને રસે ફર્યા કરતો'તો... ને... શું વેચતો'તો ખબર છે ? ચારણીઓ... મોટી રીગમાં કંઈ કેટલીય ચારણીઓ ભરાવેલીને એ રીગ ખભામાં ભરાવીને... મળી રહેતાં'તા ...પણ એનેય ઘરાક મળી રહેતાં તો... હું જોતો 'તો... પણ (જરા નિરાશાથી) ચારણીના ધ્યાનમાંય સ્કોપ નથી. હું વેચવા માંદું તો લોકો આવવાનું જ બંધ કરી દે... ક્યાં તું આવે છે... ગઈ કાલે જ રોટલીમાં...

રેશમા : ઓછું બોલિશ ! ચારણીઓ વેચવા પરથી શી ખબર શું વેચવા પર વાત આવશે... ભલું હશે તો ચણિયા વેચવા પર... હવે તો બસ આવે તો સારું... આવાં ખોટાં ફાંફાં મારે છે એ કરતાં (હવે જરા ખીજમાં પાસે આવી) એમ કરને, એક શો કરને અત્યારેય આવતા જતા તારી સામે જોઈ તો રહે છે... બસો પાંચસો તો સહેજે ભેગા થઈ જશે... આસિત નિવેદી નાઈટ/આસિત એન્ડ પાર્ટી ! (અહીં ફિલ્મમાં કોઈ મોટો બનાવ બને ત્યારે જેવો ઘૂર્ઝિકનો બાર સંભળાય એવો કેશ થાય છે, એ સાથે આસિત પર સ્પોટલાઈટ કેન્દ્રિત થાય છે. રેશમા જ્યાય છે, આસિત હવે સેઝની ધાર પર આવે છે)

આસિત : માફ કરજો પણ મને જ્યારે કોઈ પણ મોટો આઈડિયા આવે છે ને ત્યારે મારા મગજમાં આવો અવાજ થાય છે. ફિલ્મની અસર છે. તમારામાંથી પણ વધાનાને... ગમે તેમ પણ તે હિવસે લગ્નમાંથી પાછા ફરતાં સાંજે રેશમાએ બસ સ્ટેન્ડ પર કહું કે તું શો કરી શકે ત્યારથી એમ તો મને ટોન્ટમાંય કહેતા'તા પણ ત્યારથી મારા મનમાં એ વાત બેસી ગઈ કે જો એકાદ શો ઊભો કરી શકાય તો (હવે વિશ્વાસમાં લેતાં) આમેય મારામાં એક્ટિંગ ટૈલન્ટ ખરી. રેશમાને રોજ કહું છું. ટૈલન્ટ ખરી, પણ બહાર નહીં આવેલી. પણ એ હિવસથી મારા મનમાં એ આઈડિયા રમ્યા કરે કે ઓફિસની નોકરી સાથે જો કંઈ પણ કામ મારા જેવાથી થઈ શકે એમ હોય તો તે એક્ટિંગ.... ----- બસ ! ગીતસંગીત મનોરંજનની મહેફિલ. આવો 'આસિત ઘૂર્ઝિકલ નાઈટ' કે પછી એવું કોઈ નાટક જરૂર જુઓ ! આજ રાત્રે, કાલ રાત્રે ને રોજ રાત્રે... ટિકિટના

દર બે રૂપિયા, પાંચ રૂપિયા, સાત રૂપિયા, દસ રૂપિયા... (હવે પહેલાંના અંગત સૂરે) તો શું કહેતો 'તો ... કે તે દિવસની સાંજથી હું વિચારતો થઈ ગયો કે કેમેય કરીને એક શો ઊભો કરું... કરાયને... કેમ ન થાય? રોજ રેશમાને કહ્યા કરું... કંઈ જાતજાતના કિસ્સા લડાવું... લખું... ફંદું... ઓફિસથી આવીને બસ આજ ધંધો... રેશમા કંટાળે... લઢે... વડે... ઝઘડે... પણ એમ કરતાં એક દિવસ...)

(લાઈટ્સ એક રૂમ જેમાં ગુજરીમાં લાવેલા ધોડા, કબાટ, ટેબલ, ખૂરશી, એક આરામખુરશી એવું રાચરચીલું દેખાય છે. રેશમા ટેબલ પરથી આસિતની થાળી લઈ લેતા, એમ સંજેરતી દેખાય છે. આસીત જમીને વરીયાળી ફાકતો આરામખુરશી પર બેસવા જતાં...)

આસિત : જો મારે એક શો કરવો છે, એને માટે થીમ જોઈએ, (નજીક જતાં) જો રેશમા ! આઈનીડ યોર હેલ્પ ! આંદો પાતળો ય કંઈક ખોટ જોઈએ... વાર્તા જોઈએ...

રેશમા : (જરા ઢીલ મૂકતાં) સા... રું... ચાલો ખોટ જોઈએ... ખોટ એમ કંઈ ઉપરથી પડવાના હતા...

આસીત : કંઈક ખોટ હોયને... કંઈ વાર્તા... કંઈ... ધનિક માબાપની પુત્રી... એ તું... આ બાજુ એક મુફ્ફિલિસ પણ હેન્ડસમ માણસ એ હું...

રેશમા : એ હવે જૂનું થઈ ગયું !

આસીત : માટે જ કંઈક ફેશ... કંઈક શોધી કાઢને...

રેશમા : શોધી કાઢું... જરૂર શોધી કાઢું (વિચાર કરીને, પાસે આવીને) એમ કરને... તારા લવ અફેર્સની જ વાત કરને...!

આસીત : મારા ! લવ અફેર્સ !

રેશમા : (મિમિકી કરતાં) મારા ! લવ અફેર્સ ?

આસીત : મારે લવ અફેર્સ જેવું કંઈ છે જ નહિ, હતું જ નહિ. (મજાકમાં જોડાતાં) એક બની શકે... આપણે તારા અફેર્સની...

રેશમા : મારા અફેર્સ ? મારે જે કંઈ હતા...

આસીત : 'તે તું જાણે છે', કેમ ?

રેશમા : હા વળી... કદાચ તારા વિશે હું...

આસીત : ઓકે સારું. નહીં તારા... નહીં મારા... આપણે આપણા લવ અફેર્સની વાત કરીએ તો ?

રેશમા : (જરા સેન્ટ્ટિમેન્ટલ થઈ) આપણે... આપણે વળી લવ અફેર્સ કેવો ? એવું કોઈક હોત તો આ રૂમ-રસોનું પણ કેવું મહેલ જેવું લાગત ! કેટલું ખાલી લાગે છે ?

આસીત : ખરેખર ?

રેશમા : તો શું ?

આસીત : તો આપણે... આપણે મળ્યા... નજીક આવ્યાં... નક્કી કર્યું... લગ્ન... એ બધું બધું નથિંગ ?

રેશમા : નથિંગ ! ત્યારે શું ? એમાં શું... નવું શું હતું ?

આસીત : નવું શું હતું ? તું આવું...

રેશમા : શું નવું હતું ? તું મને ભાગમાં લોકોનાં ખાખેલાં પડીકાંના કાગળ વચ્ચે બેસાડતો તે ? ગ્રાન્ટ-વીસની ટિકિટમાં પિકચર દેખાડતો 'તો તે ? મોડી રાતે ચલાવીને બસ સ્ટેન્ડો સુધી લઈ જતો તે ? કોઈવાર સવા રૂપિયાની આઈસ્ક્રિમની ખેટ ખવરાવતો તે ? તેમાં...

આસીત : તું સાવ આવું બોલે છે ? તે દિવસે (જરા અંતર્મુખ થઈ જઈ) પણ વાત તો ખરી છે... હું તને શું આપી શકતો'તો... (જરા જોર કરી, ક્ષણિક ભેગો થઈ ગયેલો બોજો હળવો કરી નાખતાં) વાત તો ખરી છે... (હવે મોકળાશથી હસી પડતો) એ તો... (જરા વધુ ખુલ્લવા થઈ) એ તો જો પેલા મિસ્ટર સ્મિથ વચ્ચમાં ન પડ્યા હોત તો...

રેશમા : (જરા ગુંચવાઈ) મિસ્ટર સ્મિથ ?

આસીત : કેમ ? મિસ્ટર સ્મિથ ? યાદ નથી ? મિસ્ટર સ્મિથ...

રેશમા : ઓ... મિસ્ટર સ્મિથ... (સાવ જ મોકળા થઈ હસી પડે છે) મિસ્ટર સ્મિથ...

આસીત : મિસ્ટર સ્મિથ... એમની જ વાત ન કરાય...?

(સ્પોટ લઈટ આસીત પર, રેશમા જાય છે. આસીત સ્ટેજની ધાર પર આગળ આવી ઓડિયન્સને (ઉદ્ઘાસી)

આસીત : એ વખત વાત અખીય બહુ નાજુક તબક્કે આવીને ઊભી રહેલી. રેશમા અને હું લગભગ છ મહીના, બાર મહીના, દોઢેક વર્ષ સુધી મળતાં રહેલાં. બધાંને જાણ પડી પણ પડી, એમ માને પણ ખરાં કે વહેલાં મોડાં અમે... પણ કોણ જાણે કેમ અમારી વાત કંઈ આગળ ન વધી. એટલામાં એક દિવસ...

(લાઈટ્સ દશ્ય ફરીથી આસીતના રૂપ પર. બારણા પર ટકોરા થાય છે, અને આસીત સહેજ વધારે સ્થૂળ, બે-જ્રાણ વર્ષ વધારે (ઉમરનો દેખાતો પરાગ પ્રવેશ છે.)

આસીત : (બારણા પાસેથી એને લઈ આવતાં) ઓહો! પરાગ... આવ... ઘણા વખતે... ઘણા દિવસે... ઈ... ભાઈ હા... હવે મિત્રની શું જરૂર રહી... (ખુરશી ચીંઘતાં) બેસ... કેમ ભાબી કેમ છે?

પરાગ : મજામાં! તું કેમ છે?

આસીત : હું તો... જુઅ છે ને! બસ... મારે શું પૂછવાનું? તમે બંન્નો... કે પછી ગ્રાણેય સુધી તો વાત નથી આવીને?

પરાગ : અરે, ગ્રાણેય શું ચારેય કહેને... પાંચે થ... આઈ લવ ચીલ્ડ્રન... મને થોડો ટાઈમ આપને... આખું ઘર ભરી દઈશ ચીલ્ડ્રનથી.. પણ (દીવાલ પરની

એકટ્રેસના કેલેન્ડર પાસે જઈ) આ મારાં ભાબી કેમ છે?

આસીત : તારાં ભાબી! ઓ... હ... એ જો તું જુએ છેને કેટલો...

પરાગ : કેમ મેળ નથી પડ્યો હજુય? ક્યાં અટકી છે ક્યાં?

આસીત : તું ય રસ્તામાં ગાડી અટકી હોય તેવી વાત કરે છેને?

પરાગ : (અટકેલ કાર જેવા અવાજો કરતાં) પૈંચું ફસાયું છે કે...

આસીત : (જરા નિરાશ થઈ)શી ખબર શું થાય છે પણ...

પરાગ : રેશમા મળે છે ખરી?

આસીત : હમણાં જ ગઈ.

પરાગ : મને એવું લાગતું તું ખરું! ફાધર ના પાડે છે?

આસીત : ના... ના...

પરાગ : તને બહુ દિવસે મળું છું એટલે... પણ... તો શું પ્રોબ્લેમ શું છે?

આસીત : પ્રોબ્લેમ તો... કંઈ નથી...

પરાગ : મને કહેને...

આસીત : કંઈ... (ગુંયવાય છે)

પરાગ : તમે... નજીક કેટલાં આવ્યાં છો?... આશરે કેટલા સેન્ટ્રિમિટરનું અંતર હવે બાકી છે? (જરા દૂર તે ઉભો છે ત્યાંથી આસીત તરફ પગલાં ભરતો) આટલે?... (નજીક આવી) આટલે?... (સાવ નજીક આવી) આટલે?... કે (આસીતનો હાથ પકડી) આટલે? (આસીત કંઈ જ બોલતો નથી એટલે એનો હાથ દબાવીને) એમ કહેને કે આટલે વાત આવી છે કે નહીં? (આસીત માયું હલાવી ના પાડે છે. હવે એ લગભગ પરાગના શિષ્યના રોલમાં આવતો જાય છે) આટલે પણ નથી આવી? અલ્યા છેલ્લા દોઢને વરસથી રહો છો તમે એક-બીજાને ઓળખો છો મળતાં રહો છો ને તું હજ... (નિષ્ણાતની જેમ નિષ્ણય જાહેર કરતાં) હંદૂસ એ બેડ કેસ! (માથું ધૂણાવી) વેરી બેડ! (સહેજ વિચારમાં પડી જઈ, બીજી જ કાણો કંઈક પ્રકાશ મળ્યો હોય તેમ) એમ કર! (આસીત ઉત્સાહથી, પરાગની સામે જુએ છે) અંદર જા! (આસીતનો ઉત્સાહ ઓછો થઈ જાય છે) યહા કર! સાથે બિસ્કીટ લેતો આવજે. (આસીત જવા માંડે છે એટલે ઊભો રાખી) એક મિનિટ! હવે ક્યારે આવવાનું કહી ગઈ છે?

આસીત : (જરા રડમસ ચહેરે) બે-ચાર દિવસે!

(આસીત અંદર રસોડામાં જાય છે)

પરાગ : (સ્વગત) સાલો બુદ્ધ... કંઈ નહિ પણ એની પાસે એક-બે દિવસ છે. એ દરમિયાન (ટેબલ પાસે જઈ, તે પર પડેલા કાગળ પેન લઈ, ખૂબ જ ગંભીરતાથી લખવા બેસી જાય છે. એક-બે મિનીટમાં આસીત પાણો આવે છે. તેને ઊંચું જોયા વગર.) ચા મૂક્યો? જરા સ્ટ્રોંગ કરજે! (એકાદ મિનિટ લખતો રહી, પોતે લખેલું વાંચી જઈ, ડોક્ટર પ્રિસ્કીપ્શન એના હાથમાં મૂકતા

હોય તેમ) જો હાલ પૂરતી આટલી... લખી આપી છે... તેનાથી ફેર પડે તો ટીક. નહીં તો... (હાથ ધોઈ નાખતો હોય તેમ) ન છૂટકે... (ખભો થાબડી) પણ વાંધો નહિ! નિરાશ ન થા! (પાસે જઈ, વિગતે સમજાવતાં) જો... અત્યારે થોડી એક્સરસાઈસીજ લખી આપું છું. એ તારે નિયમિત કરવાની. ફરીથી રેશમા તને મળવા આવે ત્યાં સુધીમાં તારામાં ફેર પડી ગયો હશે. (આ દરમિયાન આસીત પરાગે લખેલી ચિંઠી થાનથી કહી શકાયું એ રીતે વાંચતો રહે છે. એની સાથે વાંચતો) જો... આ પહેલી એક્સરસાઈઝ તો સાવ સહેલી છે! (કુલેન્ડર તરફ ચીંધીને) આની સામે એકીટશો રોજ સવારે ઉઠી દશ મિનિટ જોઈ રહેવાનું (આસીત અત્યારથી જ જોવા માંડે છે?) બનશેને?

આસીત : બનશે!

પરાગ : આનો હેતુ શું કે તારી આંખ છોકરી સામે જોવા ટેવાય. તે છેલ્લા છ મહિનામાં રેશમા સામે જોયું છે ખર્દું? (કુલેન્ડર તરફ ફરતાં) આણો જોઈએ એ કરતાં વધારે કપડાં પહેર્યા છે પણ ચાલશે. નહીં ફાયદો થાય તો હું મારે ત્યાં કેટલાક ફોટા છે તે...

આસીત : (જરા ગભરાઈ) ના... આ પૂરતો છે. આનાથી જરૂર ફેર પડશે!

પરાગ : સારું... આ બીજી, ત્રીજી, ને ચોથી એક્સરસાઈઝ તો સાવ સહેલી છે. આ બધામાં આ ખુરશીનો ઉપયોગ કરીશ તો ચાલશે... બીજી છે તે બધાને બધાને પાસે જવાની પ્રેક્ટિસ માટે છે. બોલતો બોલતો (આસીત જરા ન સમજાવાના ભાવથી જોઈ રહ્યો છે, એટલે) હા... હા... બોલતો બોલતો... કંઈ પણ બોલતો બોલતો... દાખલા તરીકે (જડપથી એક્સરસાઈઝ કરી બતાવવા ખાતર) પિક્ચરમાં ગયો... ટેલિફોન કરત પણ... છાપાં જ બંધ... એમ કે? વહેલું સ્ટાર્ટ થવું પડે... આઈ મીન ગમે તે બોલતો બોલતો એની સાથે એટલે કે આ ખુરશી સાથે ઘસાવાનો... (ઘસાઈ બતાવે છે. બે-ચાર રીતે, ખુરશીમાં બેઠેલી કલિયત વ્યક્તિને વિવિધ રીતે અડી બતાવે છે) અને આ છે... તે... ત્રીજી... એ મુખ્ય છે. (ખુરશીનો હાથો પકડી) હાથમાં હાથ લેવાની... કેવી રીતે કરવાની તે લખ્યું છે. પણ... કરી જો (આસીત પરાગે કહ્યા પ્રમાણે બોલતો બોલતો આવી યંત્રવત્ત અને કંઈક જડપથી ખુરશીનો હાથો પકડી લે છે એટલે) કરી જો. પણ સાવ એસ. આર. પી.નો માણસ કફર્યુમાં બહાર નીકળેલાં કોઈનો હાથ પકડે એમ નહિ... જરા નાજુકાઈથી... જરા... એની વે... ચીઅર અપ... ગો અ હેડ બોંધ...! (પરાગ જાય છે, અને આસીત હવે પરાગે બનાવેલી એક્સરસાઈઝ યંત્રવત્ત કર્યા કરતો જોવા મળે છે. ત્યાં... દશ્ય બદલાય છે, સ્પોટ લાઈટ આસીત પર પડે છે; એ આગળ આવી...)

આસીત : ...અને આમ અમારા ગુરુ શ્રી પરાગ યોગમાર્ગના ઉપાસક, તેમની દોરવણી નીચે મારી સાધના ચાલુ રહી, કે પછી કહો કે આગવા જ ઘરાણાના ઉસ્તાં

પરાગજની નિશ્ચામાં મારી તાલીમ ચાલુ રહી... હું રોજ રિયાજ કરતો રહેતો... એની બનાવેલી પેલી ત્રણ, અને ત્રણ જેવી તો ત્રેવીસ એક્સરસાઈઝ કરતો રહ્યો પણ ચુદ્ધને આ ચેલાના પ્રોગ્રેસથી સંતોષ ન થયો. અને એમ એક સાંજે.. લાઇટ્સ હવે ફરીથી આસીતની રૂમ પર, જ્યાં પરાગ આસીત સાથે વાતોમાં જોડાયેલો દેખાય છે.)

પરાગ : (માથું ધૂણાવતાં) આ તો કેમ ચાલે? તું એનો હાથ પકડી રસ્તા પર હવે ચાલી શકે છે, એને લઈ રેસ્ટોરાંમાં જઈ શકે છે, એને... એ તો... પણ હેટ ઈઝ.... વેલ! એ... સારું (ગંભીર થઈ જઈ) તું એની સાથે અંધારામાં રહી શકે છે?

આસીત : (જરા ઉધાઈ જઈ) ફિલ્મમાં અંધારું હોય છે.

પરાગ : એ તો મને ખબર છે, પણ મૂરખ ફિલ્મનું અંધારું એ પબ્લિક અંધારું કહેવાય... એ સિવાયના સાદા, ચાલુ, આમ... ખુલ્લા... ખાનગી અંધારામાં... દાખલા તરીકે આ તારી રૂમના અંધારામાં...

આવીસ : એક વખત આ રૂમમાં...

પરાગ : (પ્રોત્સાહન આપતા) યસ... આ રૂમમાં...

આસીત : લાઈટ ગયું'તું! ને...

પરાગ : ને...

આસીત : અમે બે બેઠાં 'તાં...

પરાગ : (નિરાશ થઈ જરા પીઠ સાથે) બેઠાં'તાં તો ખરાં પણ... તમે... આ બધાંને દેખતે મારી પાસે બોલાવે છે પણ... (ખુરશીને જરા વ્હાલથી વળગી, કિસ કરી બતાવતાં) આમ... આટલે સુધી વાત આવી છે કે નહિ?

આસીત : (જરા ગભરાઈ જઈ) ના... ના... બિફોર એનોજમેન્ટ...

પરાગ : (સહાનુભૂતિથી) મને કહેને, બને છે શું?

આસીત : કહું? (જવાબમાં એ ખુરશીની પાસે જવા કહે છે, તેને જાણે પકડવા કરે છે, અને એમ જેવો પકડવા જાય છે ત્યાં તેને હાથ અને એ આખોય પાછો પડે છે; આ સીકવન્સ તીવ્ર સંગીતથી સૂચવાય છે)

પરાગ : ઓહ... આઈ સી! ઈટ્સ ધ સેમ સિમ્બટમ... (જરાં થોભી જઈ) જો! તારો કેસ છેને એ ઈટ્સ એ કેસ ઓફ લક્ષમાણ કોમ્પ્લેક્શન!... તું તો ઠીક છે ઘણીવાર નવાનવા પરણેલા પતિઓને પણ પોતાની પત્નીથી પાસે જતાં તારા જેવાં અવાજો સંભળાય છે ને બિચારા ખચકાઈને ઉભા રહે છે. બને છે, એવું પણ બને છે. એવા કેસીજ પણ... હોય છે જો! હવે તારે માટે આજથી એક નવી ટ્રીટમેન્ટ શરૂ દ્ધું... એ છે... (જરા સતતાવાહી અવાજે) મિસ્ટર સ્મિથનું સ્મરણ કર!

આસીત : (ખરેખર જરા ગુંચવાઈને જરા આશ્રયથી પરાગ તરફ જોઈ રહેતાં) મિસ્ટર સ્મિથનું!

પરાગ : હા... મિસ્ટર સ્મિથનું સ્મરણ કરો!

આસીત : (જરા લાચારીથી, પણ તાબે થતાં) સાંદું, મિસ્ટર સ્મિથનું સ્મરણ કરું...

પરાગ : આ આખીય પદ્ધતિના પાયામાં છે મિસ્ટર સ્મિથના પર ધ્યાન કેંદ્રિત કરવું...

આસીત : પણ આ મિસ્ટર સ્મિથ... એ છે કોણ? ક્યાંથી આવ્યા છે? એ જીવતા છે કે...? એ...?

પરાગ : મિસ્ટર સ્મિથ કોઈ વ્યક્તિ નથી, એની કોઈ છબી નથી, એ એક સમજો કે એક આકાર છે, એક ઓળો છે, એ એક... ચાલ તું એમનું ધ્યાન કરવા માંડને એટલે તને સમજશે... (આસીત ધ્યાનની વાત આવતાં નીચે બેસી પદ્ધાસન વાળવા જાય છે, એને રોકી) રોંગ... આ આખો ય જુદ્દો જ યોગ છે. એમાં પદ્ધાસન વાળવાનું છે જ નહિ, હું આપણી આખીય સંસ્કૃતિનો હાલ જોઉં છું. એથી આપણી આખીય પ્રજ્ઞા પદ્ધાસનમાં જડ, સ્તબ્ધ, હિખ્પોટાઈજ થઈ ગયા જેવી થઈ ગઈ છે. આ મારા યોગમાં... ન એને હું મારો યોગ કહી શકું એટલો બધો મેં એના પર વિચાર કર્યો છે... તેમાં... સ્થિર નહીં... સ્થિર તો આપણે ઘણા રહ્યા.. હુંણો આવ્યા તોય સ્થિર રહ્યા, શકો આવ્યા તોય સ્થિર રહ્યા... પોર્ચુંગીજ, ફેન્ચ અને અંગ્રેજ આવ્યા તોય સ્થિર રહ્યા... અને કાલે ઉડીને... ના... હવે અસ્થિર બનતાં શીખવાનું છે... માટે મિસ્ટર સ્મિથનો જે યોગ છે તેમાં મિસ્ટર સ્મિથનું ધ્યાન હાલતે ચાલતે, હરતે ફરતે... સીગરેટ પીએ છે? (આસીત ના પાડે છે) નહીં પીતો હોય.. પણ સીગરેટ પીને, બીઅર પીને, પીકર જોતો, એમ કરવાનું છે... એમાં આખ્યો પ્રયત્ન મનને તેની જડતામાંથી કાઢી, મનને ચંગળ કરવાનો છે.... ઓ.કે. તો.. આંટા મારતો રહે ને ધ્યાન કર. (આસીત કહ્યા પ્રમાણે આંટા મારવા માંડે છે, એટલે...) મિસ્ટર સ્મિથ છ ફીટ છ ઈચ્ચાના પરદેશી છે, તેમણે ચામડાના થીગડાવાળું, ખાખી જેવા રંગનું ખુલતું જેકેટ ને ભૂરા રંગના જ્ઞન્સ પહેર્યા છે... તેમનાં જંગલી, જાડાં, ભૂરાં જુલ્ફામાંથી, તેમની અણિયાળી ભૂરી મૂછોમાંથી, વધી ગયેલી દાઢીમાંથી બીઅરની, વાઈનની મીઠી, ખારી, તૂરી, મધુર મજાની સોડમ આવે છે, તે સાથે તે પીએ છે એ તમારુના પાઉચમાંથી કડક, કડવી, આવી વેનબરી સુવાસ પમરાય છે. મિસ્ટર સ્મિથને કોઈ આચાર-વિચારનાં બંધનો નહતાં નથી, તેમને મા નથી, બાપ નથી, નાત નથી, જાત નથી, સમાજ નથી, તેમને ધર નથી, ગામ નથી, આડોશી-બાડોશી કોઈ નથી. શિકાગોની ચોડીમાં હોય કે બનારસની ગલીઓમાં હોય, મુંબઈની કોઈ આલીશાન હોટલનો કમરો હોય, કે અમદાવાદના કોઈ ધનિકના આવાસની અગાશી હોય, મિસ્ટર સ્મિથની એક જ ઉપાસના છે, એક જ સાધના છે, એક જ સમાપ્તિ છે, અને એ છે (એક ક્ષણ થોભી) સંભોગ સુ.. (આ સાથે આસીત કે જે અત્યાર સુધી પરાગની વાણી સાંભળતો, પણ કંઈક પોતાની ધૂનમાં ફરતો રહ્યો છે, એ જાણો કે

આખો ય બેંચાય છે, પોતાના અંગૂઠા ઉપર, બને તો હવામાં, જરા અદ્ભુત થાય છે, અને બીજી કેશ સાથે, સીધો, જમીન પર નીચે મોંએ પડી જાય છે, કહો કે પટકાય છે; નિશ્ચેષ પડ્યો રહે છે. સાથે પરાગ કે જે પણ અત્યાર સુધી પોતાના કહેવાતા, પોતાના વક્તાવ્ય પર એકાગ્ર થઈ ગયો હોય છે, તેની પણ એકાગ્રતા તૂટે છે, અત્યાર સુધી બંધામેલો ટેમ્પો હળવો થાય છે. આસીત જેમનો તેમ નિશ્ચેષ પડ્યો રહે છે. પરાગ હવે રસળતી રીતે તેનાથી જરા આધો, સ્ટેજની ધાર પાસે, ઓડિયન્સ બાજુ આવતો રહે છે. એ હવે હાથ બંખેરી નાખતો હોય તેમ સ્વગત બોલે છે : ‘આવું જ થાય છે!’...

(દશ્ય ફરીથી બદલાય છે; આસીત હવે મૂર્ખભાંથી ઉક્યો હોય તેમ આંખો ચોળતો, વાળમાં હાથ ફેરવતો, કપડાં ઢીક કરતો આગળ આવે છે)

આસીત : ... અને એમ મારી ટ્રેનિંગ કહો તો ટ્રેનિંગ, યોગ કહો તો યોગ, ચાલુ રહ્યો. મિસ્ટર સ્મિથને મનમાં જાગૃત કરવા, તેમને હદ્યમાં ઉતારવા, તેમનામાં તદ્દરૂપ થઈ જવું, આસીત મટી સ્મિથ બની જવું અધસું તો ઘણું પડતું’તું પણ ધીમે ધીમે મને મિસ્ટર સ્મિથ જચવા લાગ્યા. અને માટે મેં ખૂબ ખૂબ શ્રમ લીધો... ઓફ કોર્સ, પરાગની દોરવણી નીચે...

(અહીંથી આસીત બોલતો રહે છે તેમજ જેશર્સ કરતો રહે છે) મૂળ બધા ગ્રંથો વાંચ્યા : ચીપ પોકેટબૂક્સના ટગલામાંથી એક પછી એક વાંચીવાંચી ફેંકી દેતો હોય તેમ) ડેસ ઓફ લક, લોંસ... ધ સેઇન્ટ સ્ટ્રાઇક્સ અગેઠન... કારપેટ બેગર્સ... ધ સેન્સ્ચુઅલ વૂમન... (ઉભો થઈ, ખીસામાંથી પિકચરની ટિકિટના પાસ કાઢતો જઈ) ખૂબ ફિલ્બો જોઈ... ધ એક્સોરસિસ્ટ... પોલ એન્ડ મિશેલ... મેકેનાજ ગોલ્ડ... ધ ફેન્ચ કનેક્શન... પાર્કે પૈસે મુંબઈ જઈને ચામડી ફાટી ગઈ ત્યાં સુધી બીચ પર પડ્યો રહી તડકો ખાધો...

બીતે બીતે પણ દૂરબીનમાં જોતા હોય તેમ કેબલેમાં ડાન્સ જોયો... સહુથી વધુ તો ચા ચા ને એવા હોટ ભૂજિકની રેકર્ડ વસાવી... અને સજજનો નહિ માનો પણ મારામાં તો ફેર પડતો ગયો, સાથે રેશમામાં... એક દિવસ એ આવી ત્યારે હું નહિ. તેને કોઈ અન્ય જ વ્યક્તિ મળી...

(દશ્ય આસીતની રેશમા આવીને રૂમમાં વસ્તુઓ જોતી, ચોપડાઓ ઉપાડતી મૂકતી, ફરતી દેખાય છે, ત્યાં રસોડાના બારણામાંથી આસીત પ્રવેશે છે જેણે હવે મિસ્ટર સ્મિથનો મેકઅપ પહેર્યો છે, એવા જ વાળ, એવો જ વેશ, એવો જ જરા છાકટો અભિનય. એક કણ બારણામાં ઉભો રહી, જુન્સ આગળના ખીસામાં અંગૂઠા ભરી લોભાવતું હસે છે. રેશમા સત્ખ થઈને તેને જોઈ રહે છે. તે એનાથી આકષ્મિય છે. આસીત-સ્મિથ હવે વિદ્યાર્થી રેશમા તરફ આગળ જાય છે, તેના હાથ પર હાથ ફેરવે છે, તેના મોં પર, તેનું મોં પાસે બેંચવા જાય છે. ત્યાં રસોડાના બારણામાંથી પરાગ તેના ખલે એક થેલો છે તે તાળી પાડે છે. આ સીકવન્સ દરમિયાન વેસ્ટર્ન ભૂજિકના સૂરો જે આ બિંદુ સુધી

ઉંચે ચઢતા રહ્યા છે તે અહીં થંભી જાય છે : આસીત-સિમથ અને રેશમા જેમનાં તેમ સ્થિર થઈ જાય છે. પરાગ હસતો હસતી વચ્ચમાં આવે છે અને એક-બીજાથી છૂટા પાડે છે.

પરાગ : નોટ બિઝોર એન્જેઝમેન્ટ. (પછી આસીતની મૂદ્ઘણો, વાળ વગેરે સામગ્રી તેના ચહેરા પરથી ઉતારી લેવાનું કરતાં) મને આપ તો... વળી કોઈ બીજો તારા જેવો કેસ હશે તો કામ લાગશે. બધી મેકઅપની સામગ્રી બેગી કરી થેલામાં ભરી જાય છે. આસીત અને રેશમા હવે એકલાં જ સ્ટેજ પર છે. એક ક્ષણ બંને ચૂપ અને સત્ય રહે છે. પછી બંને એકબીજાથી છૂટા પરી જરા અંતરે ઉભા રહે છે.)

રેશમા : (જરા નિરાશા સાથે) કેટલું ખાલીખાલી લાગે છે?

આસીત : (વિરોધ બતાવવા જતાં) તું આવું...? (વિરોધ મૂકી દઈ, જરા નિશ્ચાસ સાથે) પણ શું થાય?... આપણી લાઈફમાં...? (ભાર હળવો કરી નાખતાં રેશમા તરફ તેના સાવ પાસે જઈ.) મિસ્ટર સિમથ વગર સૂનું લાગે છે? બોલાવું એમને?

રેશમા : કોઈકોઈવાર બોલાવતો હોય તો... કેટલો ચેન્જ રહે!...
(પડદો)



ગુજરાતી સાહિત્ય પરિષદનું
નવું ઈ-મેઈલ આઈડી

gspamd123@gmail.com

‘પરબ’ માટે ઈ-મેઈલ આઈડી

‘પરબ’ માટે કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકાશે. ‘પરબ’નું ઈ-મેઈલ આઈડી :

parabgsp@gmail.com

કૃતિ નીચે નામ, સરનામું લખવા વિનંતી.

ધીરેન્દ્ર મહેતા

એક પ્રલમ્બ સ્વર ઊઠ્યો, ‘ના’.

જ્ઞાણ સદીઓની સદીઓ વટાવીને મારા સુધી આવી પહોંચ્યો – ‘ના’.

એ સાથે વાવાજોડું ઝૂકાયું, વંટોળ ઊઠ્યો, આંધીએ ઘૂણવા માંડયું. એનો એકસરખો ચિત્કાર ઊઠ્યો. એણે જ પેલા શબ્દનું રૂપ લીધું.

એ સાથે જ આકાશમાં વાદળ ઊઠ્યાં અને સમુદ્રમાં પાણી ઊછળ્યાં. દિશાઓ ઘેરાઈ ગઈ. સમુદ્રજળ ફીઝાફીઝા થઈ ગયું અને પૃથ્વી પરના પદાર્થો ઘૂમરીઓ લેતાલેતા ઊંચે ચઢ્યા. સ્થળકાળ વચ્ચેના ભેદ ભૂસાઈ ગયા. બધું એકાકાર થઈ ગયું. જે આકાર યોમેરની સૂણિએ ધારણ કર્યો તેમાં એક જ શબ્દ રહ્યો, ‘ના’.

મને એમ લાગ્યું કે આ શબ્દાકાર એકલા મેં જ સંભળ્યો કે જોયો તે આ જ કારણે ચોક્કસ કરવું મુશ્કેલ હતું – મુશ્કેલ હતું કારણ કે સ્થળકાળના ભેદ ભૂસાઈ ગયા હતા. મુશ્કેલ હતું કેમ કે હું સ્થળમાં હતો કે કાળમાં, તે નક્કી થઈ શકતું ન હતું. પણ હું જ્યાં હતો ત્યાં મારા અસ્તિત્વને અનુભવી શકતો હતો. અને હા, બીજો અનુભવી શકતો હતો આ શબ્દ – ‘ના’.

એટલી વારમાં ચારે બાજુથી કંઈક ગબડતું હોય એવો ગડગાટ સંભળાવા લાગ્યો. મેં વિહૂવળ આંખે ચારે બાજુ જોયું. કશું ભાણી શકતું નહોતું, સિવાય કે પેલો શબ્દ – ‘ના’. એ શબ્દનો આકાર હવે વિસ્તરી વિસ્તરીને મોટો થતો ચાલ્યો હતો – પૃથ્વીથી આકાશ સુધી, ચારે દિશાઓને આંભી જીવી હોય એમ, દૂર – સુદૂર... એનો જ કદાચ આ ગડગાટ હતો, જે મને મારી અંદર સંભળાતો હતો અને ચોપાસ દેખાતો પણ હતો. એ દેખાતો હતો ત્યારે પોતાના આકારો અવિરત બદલતો જતો હતો અને સંભળાતો હતો ત્યારે અર્થો. એમાંથી ક્યારેક હાસ્ય પામી શકતું હતું અને તે પણ ક્યારેક ખડખાડત તો ક્યારેક કોમળ; એમાંથી કોઈવાર ઉપેક્ષા વ્યક્ત થતી હતી તો કોઈવાર પરિહાસ. કવચિત્ત એમાં કશુંક એવું ચ્યમકી જતું હતું જે અશ્વ હોય એમ લાગતું હતું. આ જ કારણે એમાંથી ‘ના’, એવો જ ધોષ ઊઠતો હતો એના પ્રતિધોષમાંથી વિરુદ્ધાર્થ વ્યક્ત થતો હતો. એને સમજવાની મારી મથામણ મને ક્યારેક એવું સમજાવતી હતી કે આ તો મારા સુધી પહોંચતાં પહોંચતાંમાં બદલાઈ ગયેલો એનો અર્થ છે. ન બદલાય ? એ વિશે કશું કહી શકાય એમ કયાં હતું ? પુનઃ એ જ પ્રચંડ પ્રતિધોષ – ‘ના’. આમ થવાથી હું કોઈ-વાર અકળાતો નહિ કે એનાથી અળગા થઈ જવાનું મન પણ મને થતું નહિ, મનમાં એવી આશા બંધાતી કે ફરીફરીને જે આમ મારી પાસે આવે છે એનું સ્વરૂપ હું જરૂર સમજી પરબુ એમિલ, 2021

શકીશ, આજે નહિ તો કાલે; કેવળ ધારણાથી એને સમજવું મુશ્કેલ છે, અને એવી જરૂરે શી છે?

...વખત તો વહી રહ્યો છે દરમિયાનમાં... એ વીતી રહ્યો છે એમ કહી શકાશે? આવી દલીલ મને સૂજી. સૂજી એટલે એમાં કશું ચાપલ્ય નહોતું... ચાપલ્ય નહોતું તો શું હતું? એવો પ્રશ્ન પણ થયો.

...સામે આ વાવાઝોઝું કે વંટોળ કે આંધી જેવું ઊઠી રહ્યું છે તે શું છે, શાનું બનેલું છે? મથામણ કરીને મેં એવો બીજો પ્રશ્ન પણ પેદા કર્યો અને એવો ખુલાસો પણ મેળવ્યો કે જેમ સામે આ વેગ છે, એ શાનો બનેલો છે તે કળી શકાતું નથી એવું જ કંઈક એને વિશે પણ છે - માત્ર એક આકાર છે, ઊંચે ને ઊંચે ચઢતો કે આગળ ને આગળ વધતો... એમ ઊંચે ચઢીને કે આગળ વધીને એ ક્યાં જાય છે, એની કોઈ દિશા છે કે કેમ, તેની ખબર પડતી નથી... ખબર પડતી નથી કે એ વિશે કહી શકાતું નથી? જે હોય તે. એ વખતે એ માટેનો કોઈ પ્રયત્ન પણ હોતો નથી. પ્રયત્ન એક જ હોયછે - આ રીતે ઊભા રહેવાનો, માત્ર ને માત્ર ઊભા રહેવાનો; જોઈસાંભળીને સમજવાનો પણ નહિ કારણ કે એનો દરેક પ્રયત્ન અંતે તો મિથ્યા નીવડે છે - મિથ્યા કે વૃથા, કારણ કે એ ક્યારે ક્યાં વિખેરાઈ જાય છે તેની ખબર પડતી નથી. હા, શરીર જતું નથી, વિખેરાઈ જાય છે, ઉપર ઊકતાંઊકતાં કે પછી વિસ્તરતાંવિસ્તરતાં. અને એમાંથી એક શબ્દ ઊઠે છે - ના. કદાચ આ શબ્દ જ અત્યાર સુધી ધૂમરી લેતો હતો, વળ ખાતો હતો, અને એ રીતે પોતાને ગોપનીય રાખતો હતો.

*

એની કેટલીક નજીક હું રહ્યો હતો. હું કે અમે બન્ને? એકમેકને લગભગ આશ્લેષમાં રાખીને જ અમે, સમયના વહેણમાં વહી નીકળ્યાં હતાં. એનો ખળખળ વહી નીકળતા નિર્જર શો નિનાદ અનું રૂપ બદલી નાખતો હતો. એમાંથી ઉત્પન્ન થતા સ્વરમાં સંભળાયા કરતો હતો એક શબ્દ 'ના'. પણ આશ્લેષમાં એને જોઈ મને થતું હતું, હું એને આમ જ પકી રાખીશ અને આ નકારમાંથી મનગમતો અર્થ નિપાજીવીશ, અત્યારે શું છે, આ આમ વહી નીકળવાની ઘરીએ? પણ મને ખબર નહોતી એમ એ જ ઘરીએ હું ભીતરની કોઈ જુદી દુનિયામાં વહી જતો હતો, જ્યાં કોઈ જુદા અવાજ આવતા હતા, જ્યાં આંધી, તોફાન કે વંટોળ ન હતાં, જ્યાં સમુદ્રનો ધૂઘવાત નહોતો; જ્યાં હતા ભૂમિ સરસાં ફૂટતાં તરણાં, અને હતાં ઝાડ થવા મથતા છોડ. એ છોડવાં પર ફૂલ નહોતાં, હતી કેટલીક કળીઓ, જેમને હળવેહળવે વિકસિત થતી મારે જોવાની હતી. એમની વચ્ચે નાનાનાનાં પંખીઓનો કલરવ હતો અને એમની હરફર હતી ઉપર આકાશ એકદમ સ્વચ્છ હતું એટલે એની અગાધતા જોઈ શકતી પરંતુ એમાં તારા ઊગી નીકળે ત્યાં સુધી રાહ જોતાંજોતાં એની સામે તાક્યા કરવાનું હતું. પછી તારા ગણવાના હતા, ગણાઈ રહે ત્યાં સુધી, મતલબ કે ગણ્યા જ કરવાના હતા. એમાં વિચલિત ન થવાની શરત હતી. એ શરત અન્ય કોઈ સાથે નહિ, જાત સાથે હતી.

*

અહીં સુધી આવીને એ અવાજ કહી ગયો, ‘ના.’ એનાથી વિચલિત થવાને કારણ ન હતું, કારણ કે મને ખાતરી હતી કે એ મારા આશ્વેષમાં કેદ છે અને એની ભીસ જેટલી વધારવી હશે, જ્યારે વધારવી હશે, વધારી શકશે. દરમિયાન એના અર્થો મેં ખોળી કાઢ્યા હતા. એ પર હું મગર હતો, કારણ કે ખોળી કાઢેલા અર્થ અને આત્મપ્રત્યય વચ્ચેનાં અંતરની એ વખતે મને ખબર ન હતી. પેલા શબ્દનો નકાર અને મારી કેદમાં રહેલા અર્થ વચ્ચેનું એ અંતર હતું. એ શબ્દ જે, જે ચારે બાજુથી મને ઘેરી વખ્યો હતો એ ઈતર સંવાદ અર્થોને પરહરીને કેવળ અહૃહાસ્યમાં ફેરવાઈ ગયો, અને પછી અવકાશમાં વિલીન થઈ ગયો, શેષ અવકાશમાં એના તરંગમાત્ર રહ્યા. મેં બાહુ પ્રસારીને બે હાથમાં એ તરંગોને એકઠા કરવાની ચાહના કરી. એમાં એમને મારી અંદર સમાવી દેવાની ખેવના હતી. એ તરંગો હતા પરંતુ એમાં કશો સંચાર ન હતો. કોઈ એક ક્ષણો એ બધું થશે એમ માની લઈને મેં એ ક્ષણની રાહ જોવા માંડી અને પછી એ ક્ષણ જ પ્રતીક્ષાની ક્ષણ બની ગઈ. તે પછી એ તરંગોનું શું થયું? મેં કાન માંડ્યા. છેવટે એ ના, જે મારી સાથે નહીને મારો પરિહાસ કરી રહી હતી, કમસે કમ એ સંભળાય છે? ના, એ પણ નહિ.



સાભાર સ્વીકાર

નવલક્ષ્યા

આણસાર : સુનીતા ઈજાતકુમાર, ૨૦૧૮, કુસુમ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬૮, રૂ. ૧૪૦. **પ્રિયા :** નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૬+૨૫૪, રૂ. ૨૩૦. **જન્માંતર :** નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૬+૨૫૪, રૂ. ૨૩૦. **સેતુ :** નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૬+૨૭૪, રૂ. ૨૪૫. **પ્રેમછાયા :** નવનીત સેવક, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૬+૨૬૨, રૂ. ૨૩૫. **સાંજનો સૂર્યોદય :** હરેશ ખોળક્યા, ૨૦૧૮, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, ૮+૧૪૦. **કોઈ બતાવો ગોકુણ મારું :** કેશુભાઈ દેસાઈ, ૨૦૧૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૮+૧૮૪, રૂ. ૨૨૫. **રેતીનું ધર :** પ્રીતિ હિતેશ ટેલર, ૨૦૧૮, હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૮+૧૨૦, રૂ. ૧૫૦. **જેકીલ અને હાઈડ :** ભાવાનુવાદ : સાધના નાઈક દેસાઈ, ૨૦૧૮, ફલિક્સ, પલ્બિકેશન, સુરત, પૃ. ૧૨૮, રૂ. ૧૪૦.

પ્રભાવતી મારી બહેન. મારાથી નાની. શાંત અને સ્વસ્થ. એ નાનેથી મોટી થઈ એની બહુ ખબર જ પડી નથી. ગ્રાણ બહેનો ગુજરી ગયેલી. એ પછી ઘરમાં અમે ચાર ભાઈઓ ને ત્રાણ બહેનો એમ સાત ભાઈબહેન રહેલાં. સાધારણ કુઠુંબ. એમાં તો છાનાંમાનાં જ મોટાં થઈ જવાનું હોય. ઉપદ્રવ કરીએ તોય કોઈ કાને ન ધરે. વધારે ઉછળવા કોઈ જાય તો માનો હાથ અને બાપનો પછો શરીરે ફરી વળતો. પ્રભા પણ એમ જ ગુપ્યુપ મોટી થયેલી. વાટિયા વીમેન્સમાં બે વર્ષ ભાડી. પછી અટકી ગઈ. એ અટકી તેનીય નોંધ કોણ લે? મોટી મંજુ અને તે પછી બચેલી બહેનોમાં પ્રભાનો કમ આવે. બંને કોલેજ પૂરી ના કરી શકી. ભાઈબહેનોમાં હું સૌથી મોટો. મને પહેલેથી જ ઘરમાં કોઈ ભણતું અટકી જતું તે ગમતું નહીં. પણ મારો અણાગમો જોવાની કોઈને ફુરસદ હતી નહીં. એમાં છોકરી ભણતી અટકે એનો તો મોટાં કુઠુંબમાં કોઈ હિસાબ રાખે એમ હતું જ નહીં. માબાપ માંડ રોટલા ભેગા થતાં ત્યાં ભણવા ગણવાનું છોકરાઓ પૂરતું જ સીમિત હતું, તે પણ માફીમાં!

મારા બાપુજી સોનીકામ કરતા હતા. ઘરમાં જ હુકાન હતી. એકદરે ઠીક ચાલતી, પણ ગોલ કંદ્રોલ આવ્યો એને કારણે સોનીનો ધંધો ઠપ થઈ ગયો. હવે કરવું શું? - એ મોટો પ્રશ્ન બાપુજી માટે હતો. નાઘૂટકે મારા બાપા ચૌટામાં એક કાપણિયાની હુકાને નોકરીએ લાગ્યા. એ ન ફાય્યું. આમ પણ બાપુજીનો સ્વભાવ કોઈને તાબે થવાનો હતો જ નહીં એટલે એ નોકરી કરે એ શક્ય ન હતું. તો પણ કેંક તો કરવાનું જ હતું. કાકાની દરજની હુકાન હતી, એના ઓટલા પર બાપુજીએ કાપડ વેચવાની વ્યવસ્થા કરી. એ પણ ન ફાય્યું તો ઘરને ઓટલે કાપડ વેચવા માંડયું, પણ પતો ન લાગ્યો. આ સ્થિતિ ગોલ કંદ્રોલ ન હટ્યો ત્યાં સુધી રહી. એમાં બે બહેનો મંજુ અને પ્રભા ભણી કે ગણી તેનો ઘ્યાલ ન રહ્યો. પછી સંજોગો બદલાયા પણ ખરા ને ભણવાનો લાભ સૌથી નાની મીનાક્ષીને મળ્યો અને તે બી.ઓડ કરીને પ્રાઈમરીમાં શિક્ષિકા થઈ.

એ દરમિયાન મારાં લગ્ન વડોદરા થયાં. મારા મોટા સાળા મનોહર. તેના સાણા પ્રકાશ ભડાનકર. એની જોડે પ્રભાનાં લગ્ન થયાં. બે દીકરીની તે મા બની એ દીકરાઓ પણ પરણ્યા. મોટો દીકરો વંદન બીલીમોરા પરણ્યો ને નાનો રોહિત વડોદરા પરણાય્યો. એ બંને પણ બાળકોના પિતા બન્યા. બનેવી પ્રકાશભાઈ વૃદ્ધ હોવાથી ઠીક ઠીક સમયથી નિવૃત્તિ ભોગવે છે. વંદને વલસાડમાં ઘર લીધું છે ને તે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. નાનો રોહિત સિરામિક ટાઈલ્સની કંપનીમાં નોકરી કરે છે. બહુ જગ્યાએ ભાડે રખ્યાં પછી પ્રભા અને પ્રકાશભાઈએ થોડાં વર્ષો પર વિશ્વામિત્રીમાં ફ્લોટ લીધો ને બંને સાથે,

રોહિત ને તેનું કુટુંબ રહે. બેનબનેવી ઘણીવાર મોટા દીકરા વંદનને ત્યાં પણ જતાં ને થોડા દિવસ વલસાડ રહીને વિશ્વામિત્રી પાછા ફરતા.

પ્રભાએ એક કામ બહુ સારું કર્યું હતું.

દેવેન્દ્ર કરીને મારો છેલ્લા નંબરનો એક ભાઈ હતો. તે અમારા કુટુંબમાં સૌથી નાનો ભાઈ હતો ને લાડકો હતો. બાપુજીનો બહુ જ ભાવ એના પર હતો. તે હીરા ઘસતો, પણ વસ્તિની અને જુગારી હતો. તેને ભણવાની બધી જ તકો હતી, અમે બધાંએ બહુ જ કોશખો કરી પણ તે ન જ ભણ્યો. પરણ્યો ત્યારે એના લગ્નમાં હું ગયો ન હતો. મને લાગતું હતું કે કે તે જેને પરણણો તેનો સર્વનાશ કરશે. તેની ચિંતામાં ને તાણમાં તેની પત્ની મોટો દીકરો અને નાની દીકરી નાનાં મૂકીને ગુજરી ગઈ. દેવેન્દ્ર રખી ખાતો હતો ને છોકરાંઓ રખડી જાય તેની ચિંતા તેને ન હતી. તેના દીકરાને પ્રભા વિશ્વામિત્રી લઈ ગઈ અને દીકરીને મારી મારીના નિઃસંતાન દીકરા રાજુએ વિષિવત્ત દંતક લીધી. તેને ઉછેરીને પરણાવી પણ ખરી. દીકરાને પ્રભાએ મોટો કર્યો ને નોકરીએ વળગાડ્યો. એકંદરે બધું ઠીક ચાલતું હતું.

- ત્યાં કોરોના આવ્યો.

મારા કુટુંબમાં એ પહેલવહેલો વિશ્વામિત્રીમાં પ્રવેશ્યો. જુલાઈની આસપાસ પ્રભાનાં નાના દીકરા રોહિતને એ વળગ્યો. કુટુંબમાં બધાં સાથે રહે તો જોખમ વધે એવું હતું એટલે રોહિતની પત્ની સ્વાત્ત્રતા બાળકોને લઈને વડોદરાનાં તેનાં પિયર ગઈ અને પ્રભા તથા પ્રકાશભાઈ મોટા દીકરા વંદનને ત્યાં રૈલમાર્ગ વલસાડ પહોંચ્યાં. ટ્રીટમેન્ટ પછી, પંદરેક દિવસે રોહિત સાજો થયો. તેને બોલવામાં થોડી તકલીફ પડતી હતી, પણ મોબાઇલ પર તેને જોતાં લાગતું હતું કે તે સુધારા પર છે. તેને હોસ્પિટલમાંથી રજા મળી ને તે વિશ્વામિત્રી, ઘરે પાણો આવ્યો.

વલસાડમાં પ્રભા રોહિતની ચિંતા કરતી રહેતી હતી. આમ પણ તે ઘણા સમયથી મનથી બહુ જ ચિંતામાં હતી. ધોધમાર હસતી પ્રભા ધીમેધીમે ચહેરા પર ચિંતાની રેખાઓ ઊપરસાવતી જતી હતી. રોહિત ઘરે આવ્યો એ જ દિવસે કદાચ રાતે પ્રભાને ઊલટી થઈ. એસિડિટી તેને રહેતી હતી. તેને ઊલટી અને માથાના દુઃખાવાની ફરિયાદ રહેતી હતી. કોરોનાએ ભય એવો ઊભો કર્યો હતો કે ખાનગી દવાખાનાઓ બંધ હતાં અને કોઈ પણ સારવાર માટે સિવિલ તરફ જ મોં કરવું પડે એ હાલત હતી.

પ્રભાની ઊલટીઓ બંધ થતી ન હતી. તેને શાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. સવારે તેને સિવિલમાં દાખલ કરવામાં આવી. તે વખતે સ્થિતિ એવી હતી કે રોગ કોઈ પણ હોય તેની સારવાર કોરોનાથી જ થતી હતી ને વિચિત્રતા એ હતી કે તેની કોઈ ચોક્કસ દવા ન હતી. બીજી તકલીફ એ હતી કે એકવાર દર્દી સિવિલમાં દાખલ થાય કે નજીકનાં સગાંઓને પણ તેની પાસે ફરકવા દેવામાં આવતાં ન હતાં. દર્દી દાખલ થાય કે દેખાતો બંધ થઈ જતો હતો. પછી તો બહારથી જ તેની ભાજ મેળવવાની હતી. પ્રભા દાખલ થઈ પછી તેને ઓક્સિજન પર રાખવામાં આવી કે વેન્ટિલેટર પર એ દેખાતું ન હતું. ખબર આવતી હતી કે સારું છે.

કેટલાય વખતથી વાયરસે એ સ્થિતિ સર્જ છે કે દર્દી જોએ શું થાય છે ને એના પર શું વીતે છે એની એના સંબંધીઓને ખબર પડતી નથી. એવું જ દર્દિના સંબંધીઓ પર શું વીતે છે એની ખબર પણ સારવાર દરમિયાન દર્દિને પડતી નથી. પ્રભાની કેં ખબર મળે એની એક-એક સેકુન્ડમાં રાહ જોવાની હતી. સેકન્ડ પસાર થતી દેખાતી હતી ને એમ ધારવાનું હતું કે બધું ટીક ચાલી રહ્યું છે.

સાંજે લગભગ પાંચેક વાગે મારો દીકરો વિવર્ત મને વળગીને રડી પડતાં બોલ્યો, ‘પપ્પા, પ્રભાફોઈ ગઈ !’

થડકો આંસુ થઈ ગયો.

મારી બહેન એક જ કષણમાં ભૂતકાળ થઈ ગઈ.

કમનસીબી એ હતી કે એને શું થયું અને એને શી ટ્રીટમેન્ટ અપાઈ એ આજની તારીખ સુધી જાણી શકાયું નથી. શાસની તકલીફ થઈ એવી વાત બહાર આવી, પણ એને ઓફિસજન પર કે વેન્ટિલેટર પર રખાઈ કે કેમ એની ખબર નથી. ખબર એટલી છે કે એને ૧૮ જુલાઈ, ૨૦૨૦ ને રોજ સિવિલમાં દાખલ કરાઈ અને એ જ તારીખે સાંજે પાંચેકને સુમારે એ ગુજરી ગયાની ખબર આપવામાં આવી. તેનો કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, તે પોઝિટિવ આવ્યો, પણ રિપોર્ટ શું આવ્યો તેની દરકાર કર્યા વગર જ તેણે સૌને ‘આવજો’કહી દીધું હતું.

તે અમને ક્યાંકથી ચીરી નાખતી ચાલી ગઈ હતી.

સૌથી આધાત આપનારી વાત તો એ છે કે ચેપ ન લાગે એટલે કોરોનાના મૃતકનું શરીર એના સગાંવહાલાંઓને આપવામાં આવતું નથી કે કોઈ સંબંધીને પણ એના સુધી પહોંચવા દેવામાં આવતું નથી. અમે કોઈ છેલ્લી વખત પ્રભાનું મોં જોવા ન પામ્યાં એનો વસવસો છેવટ સુધી રહેશે. કેવી લાચારી છે આ ! જિંદગી આટલી ખરાબ તો ક્યારેય લાગી નથી. હશે, સારો કાળ નથી રહ્યો તો આ ખરાબ સમય પણ નથી રહેવાનો એવું આશાસન પણ કામ લાગતું નથી. શું કહું ?

બરાબર જાણું છું, પ્રભા કે તું નથી જ આવવાની તોય ભીની આંખે કહું છું,
‘આવજો બહેન !

માસ્તર | પારુલ રંગપરિયા

રવિવારે માસ્તરને તાવ આવ્યો; ‘આપણે સોમવારે દવાખાને જઈશું.’ વિદ્યાર્થીએ એ માની લીધું. માસ્તરની આજાનું ઉત્ત્વલંઘન કેમ થાય ? સોમવારે વિદ્યાર્થી દવાખાને લઈ ગયો. ડોક્ટરે કહ્યું કે , ‘કેસ બહુ સિરિયસ છે. અત્યારે ને અત્યારે એડમિટ કરવા પડશે. તમે કોઈ હોસ્પિટલમાં લઈ જાવ. એ હોસ્પિટલ લઈ ગયો ત્યારે ડોક્ટરે કહ્યું, ‘કેસ ખલાસ છે.’ વિદ્યાર્થીને લાગ્યું, મારી સાથે વાતો કરતા હતા ને ક્યાંથી કેસ ખલાસ છે ? એણે બીજા ડોક્ટરને બતાવ્યું. એમણે પણ આવું જ કીધું. વિદ્યાર્થીને ચક્કર આવી ગયા.

માંડમાંડ એ સ્વરથ થયો. એણે માસ્તરને બોલાવ્યા - હલાવ્યા પણ માસ્તર તો...

વિદ્યાર્થીએ એમના ઘરે જાણ કરી. ઘરે કોણ હોય ? વિદ્યાર્થીઓ જ. વિદ્યાર્થી આલમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બારે મેઘ ખાંગા થયા હોય એમ વિદ્યાર્થીઓની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. કોઈને કંઈ સૂર્જે નહીં. પડેશી બે-ચાર આવ્યા. એમણે સૂર્યનાઓ આપવા માંડી. એક પડેશીનો દીકરો સાતમા ધોરણમાં ભણતો હતો માસ્તર પાસે. એ માસ્તરથી બહુ પ્રભાવિત થયા હતા. વિદ્યાર્થીઓ ફટાફટ નજામી લેવા ગયા, થોડા વિદ્યાર્થીએ ચોકો કર્યો. ચાર વિદ્યાર્થીએ તો કાંધ આપી. અન્નિદાહ દેવાની બધી તેથારી રડતા મોંએ જ કરી. બે વિદ્યાર્થીઓએ તો મુંડન કરાવ્યું હતું. માસ્તરને એ પિતા સમાન માનતા હતા. માસ્તરના અચ્છા પદ્ધરાવવા ચાંદોછ ગયા હતા. માસ્તર અવસાન પામ્યા ન હતાં, એમના વિદ્યાર્થીઓમાં જીવતા હતા. વિદ્યાર્થીઓ એમના શ્રવણ હતા. શ્રવણ શબ્દ નાનો પડે. શ્રવણ એમના મા-બાપના દીકરા હતા આ તો વિદ્યાર્થીઓ !

એમને જોઈને કોઈ પણ કહી દે ‘આ માસ્તર જ છે.’ બદામી ફેમના ચશમાં, આંખ એમાંથી આર-પાર નીકળતી. સાવ સામાન્ય વાળ. પાછું એમાં તેલ નાંખેલું. ગાલ ચપ્પટ. મોટા ભાગે બલ્યુ શર્ટ પહેરે, એની નીચે ગમે તે પેન્ટ. મેંઝિંગની એમને કોઈ પરી ન્યોતી. ચચ્ચલ રેઝિનના, કોઈ વાર રસના, કોઈવાર ચામડાના પહેરે. અનામિકા પર સોનાની વીટી, ગળામાં સોનાની ચેઠન, હાથમાં ધરિયાણ, એના સોના જેવા પડ્યા. આ ત્રણ એમના કાયમી ઘરેણાં. એકના એક, વર્ષોથી પહેરે. દીવાળીમાં સૂટ અને સફારી બે જ પહેરે. વિદ્યાર્થીઓ એમ વિચારે કે માસ્તર મારે ધેર પધારે તો સારું. મારા ધન્ય ભાગ્ય ! એ જ્યાં પણ ખરા. છોકરાવનો ભાવ જોઈને. મા-બાપ ઊચા-નીચા થઈ જાય. માસ્તર એમને ભગવાન જેવા લાગે.

લાખપાંચમથી માસ્તર ભણાવવાનું શરૂ કરે. એક સામાન્ય ચાલીમાં ભાડે રહે. ઘર બહુ સાંકડું. એમના ઘરમાં ઊભા રહેવાની જગ્યા નહીં. એટલા બધા વિદ્યાર્થીઓ ખીચોખીચ ભણતા હોય. માસ્તર એક ઘણીકેય નવરા ન પડે. છોકરાંવનું એક ટોળું આવે ને બીજું જાય. આખો દિવસ આવ-જા ચાલું જ રહે. પહેલા ધોરણથી બારમા ધોરણ સુધીના છોકરાંવને ભણાવતા પણ મફત. માસ્તર એવું માનતા કે વિદ્યાના કાંઈ પૈસા લેવાય ? એનું તો દાન કરાય દાન ! પણ માસ્તરનો સ્વભાવ બહુ કડક. ઘરે ભણાવતા છોકરાંએ શાળામાં કોઈ છોકરી સાથે ભણાવા સંબંધી કઈ વાત કરી હોય તો એના પર એવા ધખે, એવા ધખે કે વાત ન પૂછો ! સાવ રૂના ઈટાળા જેવાં. પ્રેમ પણ છોકરાંવને એવો જ કરે. દસમા કે બારમાની પરીક્ષા હોય ત્યારે મૂકવા જાય, ત્રણ કલાક રોકાય પછી એક્ટિવા પર ઘરે લઈને આવે. છોકરાંવને પરીક્ષા હોય ત્યારે માસ્તરના ઘરે જ રોકાવાનું હોય. ખવડાવે-પીવડાવે, આખી રાત છોકરાંવને વંચાવે. ઘડીઘડી જગળીને જોવે કે છોકરું ઊંઘતું તો નથીને ? ઊંઘતું હોય તો એને પણી લઈને આંખ ધોવાનું કહે. છોકરાંવ પાસ થાય એટલે માસ્તર હુલ્યા ન સમાય હોય !

મોટી ડિશ્રી હોય તો ભણાવી ન શકે એમ.એ, પીએચ.ડી.ની ડિશ્રી હોય તો
પરબ ફેઅમિલ, 2021

વિદ્યાર્થીની સાથે જાય. વિદ્યાર્થીને એવી ટેવ પરી ગઈ હોય કે માસ્તર આવે તો ‘હા’ નહીંતર’. ના... માસ્તર વિદ્યાર્થી પહેલા તૈયાર થઈ જાય અને એકિટવા પર બેસી જાય. પછી બેય સાથે જાય. ઓફિસમાં માસ્તર એટલી વિનપ્રતાથી વિવેકથી અને શિષ્ટાચારથી વાત કરે કે કોઈ પણ માણસ અભિભૂત થઈ જાય. પીએચ.ડી.ની લેખિત પરીક્ષા હોય ત્યારે મૂકવા જાય, જાડના છાંયે બેસી રહે, સનગ્લાસ પહેરીને પરસેવે રેબજેબ થયા હોય માસ્તર. લેખિત પરીક્ષામાં શું પૂછાયું હતું એ વિદ્યાર્થીને આવે ત્યારે પૂછે. વિદ્યાર્થીને કોઈ પ્રશ્નનો જવાબ ન આવેચો હોય તો એને સમજાવે આનો જવાબ આમ હોય. વિદ્યાર્થી એના ગાઈડને પૂછે તો માસ્તરે જે જવાબ કહ્યો હોય એ જ નીકળે. આ રીતે વિદ્યાર્થીઓ જ એમનું સર્વસ્વ. વિદ્યાર્થીઓ એમનો દરબાર અને વિદ્યાર્થીઓ જ એમનો ઘરબાર.

મહેમાન આવે તો માસ્તરનું ઘર જોવે તીંચા ઓટલા-વાળા ઘરમાં એ રહે પછી ઓસરી આવે પછી ઓરડામાં જવાય એમણે ઓસરીને રસોંનું બનાવી દીધેલું. તીભું પ્લેટફોર્મ પણ નહીં. લોખંડનો ગેસ નીચે મૂકી દીધેલો. ટીનના ગ્રાન્ચ-ચાર ડબ્લા, પાંચ-છ તપેલા માસ્તરને ચા પીવાનો ખૂબ શોખ ! પછી આખા દૂધની વધારે ગળી પીવે. એટલે તપેલા તો જોઈએ જ. એટલા જ થાળી વાટકા અને પ્યાલા. કારણ વિદ્યાર્થીઓ રહેતા. વાસણો જુદા જુદા આકારના હોય. પાંચ વર્ષ આટલા વાસણો ખરીદા હોય પછી જુદા જુદા આકારના જ હોય. એક સાથે વાસણ લેવાના પૈસા ક્યાંથી લાવે ? ઘંટીએથી લોટ લાવે મહિનાનો. ઘઉં માસ્તરના ઘરમાં ન મળે. એક-એક મહિનાનું મરચું-હળદર, ધાણાજુદુ, રઠ, હીંગ લઈ આવે એમના વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ ઘરનું બધું કામ કરે, કચરાપોતું કરે, શાક લેવા જાય, રસોઈ બનાવે, વાસણ ઘસે. માસ્તરનું ઘર વિદ્યાર્થી માટે સાંદીપનિ ઋષિનો આશ્રમ જ જોઈ લ્યો !

હવે મહેમાન ઓરડામાં જાય. ઓરડામાં તો ગણ્યોગાંઠચો સામાન. માસ્તર લોખંડના પલંગ પર બેસે પલંગ પર બે-ત્રાણ ગોદડા-ગાદલા પડ્યા હોય એના પર જૂની ચાદર સરસ રીતે પાથરેલી હોય. એના પર માસ્તર બેસે. અદાય એટલી નજીક બાબાઆદમના વખતની ટીપોઈ ઉપરના ખાનામાં સંભાઈકા મધ્યાં હોય એના પર માસ્તરની દવા, એમને શાસનું દઈ હતું. નીચેનું ખાનું જાળીવાણું હોય એ પુસ્તકોથી હક્કેછ ભરેલું હોય. હાલ જે વાંચતાં હોય એ પુસ્તક ઉપરના ખાનામાં પેદલું હોય. માસ્તરના પલંગની ડાબી બાજુ પ્રમુખસ્વામી મહિદારજનો મોટો ફોટો. એની ફરતે રોશની મૂકેલી હોય એ રેજ સાંજે થાય. એની બાજુમાં ઘરમંદિર. માસ્તરના પલંગની સામે મહેમાનને બેસવાનું સોઝા કે પલંગ જેવું કંઈક. ઉપરની અભેરાઈ પર જૂનો સામાન પડ્યો રહે. એ માસ્તરનું માળિયું. એમાં મોટી લાકડાની પેટી એમાં એ પહેલા રાંધેલું ખાવાનું રાખતાં અત્યારે એ પુસ્તકોથી હસોઠસ ભરેલી હતી. એની બાજુમાં પતરાની પેટી. શિયાળા-ઉનાળાના કપડાં રાખતા. ગરમ કપડાં પણ બે જ. ઉનાળાના કપડાં ખાસ હોય નહીં. એક ધોતિયું અને ચોમાસાનો એક રેઇનકોટ રાખતાં. માસ્તર ગરીબ હતા પણ એમને પૈસાની જરૂર નહોતી. જે ગરીબ હોય એને પૈસાની જરૂર ન હોય એ કેટલા સુખી માણસ કહેવાય. હવે બોલો કેટલા સુખી જીવ હતા એ ?

મા-બાપ પોતાના બાળકોને વર્ષોના વર્ષો સુધી માસ્તરના ઘરે રાખે. પહેલા ઘોરણથી તે છેક એમ. એ. સુધી. એટલો વિશ્વાસ કે માસ્તર મારા છોકરાને સંસ્કારશે, ભાણાવશે. આપણે જેમ બેંકમાં પૈસા મૂડી રાખીએ, એફ. ડી. મૂડી રાખીએ એમ મા-બાપ છોકરાને મૂડી રાખે માનવતાનું વ્યાજ મેળવવા, માસ્તરમાં માનવતાનો મહેરામણ છલકે એક છાલક જો છોકરા પર આવી જાય તો પણ એનું જીવન માનવતાથી મધમદે.

માસ્તરે બે છોકરાંવને નોકરીએ લગાડ્યા એકનું સગપણ કર્યું. એકને પરણાવ્યો. ખાતરી કરીને કે છોકરી ઘર માંડવા ઈચ્છે છે કે નહીં? માસ્તર દૂધનાં દાઢેલા ખરા ને! માસ્તરે ૨૩ વર્ષે ઘર માંડેલું. એમને એક વર્ષમાં દીકરો થયો. એમની પત્નીને એમની સાથે ગોઈનું નહીં. દીકરો જન્મ્યો કે તરત એમના પત્ની દીકરાને લઈને પિયર ગયેલા પછી પાછા આવ્યા જ નહીં અત્યાર સુધી. છેક માસ્તર ગયા... પત્નીએ બીજું ઘર ન કર્યું એ સાંદું કહેવાય પાછા ન આવ્યા તે ન જ આવ્યા. માસ્તરે રેતીમાંથી તેલ કાઢવાનાં ઘણા પ્રયત્નો કર્યા પણ વ્યર્થ. બધા સગાવહાલાંઓએ માસ્તરને બીજાં લગ્ન માટે સમજાવ્યા પણ માસ્તરની ના એટલે ના જ. ત્યાં તો માસ્તર...

માસ્તર પહેલા ખાનગી શાળામાં નોકરી કરતા હતા. તેરસો રૂપરડી પગાર હતો. માસ્તરે નોકરી છોડી દીધી એમણે ઘરે છોકરાંવ ભાણાવવાનાં શરૂ કર્યાં. એમને નર્મદ જેવું થયું હશે, નર્મદ કલમના ખોળે માથું મૂક્યું હતું માસ્તરે વિદ્યાના ખોળે.

સાભાર સ્વીકાર

બાળ સહિત્ય

ખુશખુશાલ પરી : શ્રદ્ધા ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, હ+૭૪, રૂ. ૮૦. ભાગ માગતી ચાંદ પરી : ગિરા પિનાઈન લાટ, ૨૦૧૮, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, હ+૧૦૬, રૂ. ૧૨૫. ટારઝન : (જંગલ સમાટ), નવનીત સેવક, ૨૦૧૮, રનાએ પ્રકાશન, અમદાવાદ, હ+૬૪, રૂ. ૭૦.

નવલિકા

ડમરી : આરતીબા ગોહિલ, ૨૦૧૮, લેખક પોતે, પૃ. ૮૦, રૂ. ૧૦૦. દેવહૂત : પલ્લવી ભિસ્થી, ૨૦૧૮, હર્ષ પ્રકાશન, અમદાવાદ, હ+૧૩૬, રૂ. ૧૮૦. ઓ હેત્રીનો વાર્તા વૈભવ : રૂપાંતર હરિત પંડ્યા, ૨૦૧૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૦+૧૧૮, રૂ. ૧૫૦.

સુભાષિત સ-રસ-વતી ધારા દેવાસુરસંગ્રામની પુરાકથાની કવિતા

વિજય પંડ્યા

વપુર્દલનસંભ્રમાત્સ્વનસ્વરં પ્રવિષ્ટે રિયૌ
કૃયાત ઇતિ વિસ્મયાત્મહિતલોચનઃ સર્વતઃ ।
વૃથેતિ કરતાઽનાન્રપતિતં પુરો દાનવं
નિરીક્ષ્ય ભુવિ રેણુબજ્જયતિ જાતહાસો હરિઃ ॥

(સુભાષિતરલભાઙ્ગારમાંથી હનુમત્રને નામે)

સમજૂતી સાથેનો અનુવાદ : પોતાનું શરીર ચીરાઈ જશે એવી દહેશતમાં જ્યારે શત્રુ હિરણ્યકશિપુ ભગવાન નૃસિંહના નખના છિદ્રમાં ઘૂસી ગયો ત્યારે ‘તે ક્યાં ગયો?’ એમ વિસ્મયથી પોતાની દિષ્ટિ ચારે તરફ ફેરવે છે. પણ તે ક્યાંય દેખાતો નથી. એટલે, ભગવાનને ક્ષણભર તો એવું લાગ્યું કે ‘મેં આટલી માથાકૂટ કરી, આ દાનવ હિરણ્યકશિપુ માટે મેં સ્વતંત્ર અવતાર ધારણ કર્યો અને આ દુષ્ટ છટકી ગયો.’ એમ ભગવાનને પોતાની નિષ્ફળતા પર ચીઢ ચઢી અને તેથી અકળામશમાં પોતાનો હાથ ઝાટક્યો અને લો, રાક્ષસ નખના છિદ્રમાંથી પોતાની સામે રજકણની જેમ પડેલો હતો. તે જોઈને ભગવાનને હસવું પણ આવી ગયું. આવા હસી પડેલા નૃસિંહ ભગવાન જ્ય પામે છે.

ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના આ એક નૃસિંહ અવતારમાં હિરણ્યકશિપુને હણવાના અવતારકૃત્યનું વર્ણન કરતું આ પદ્ય અનેક પરિમાણી છે.

સંસ્કૃત કવિતાનો ઘણો મોટો ભાગ ‘મીથ’ પુરાકથા પર રચાએલો છે. પુરાકથાને લઈને સૃજનશીલ કવિઓએ સંસ્કૃત ભાષામાં અસાધારણ કામ કર્યું છે.

ભારતીય સંસ્કૃતની મૂળભૂત પાચાની મીથ દેવાસુરસંગ્રામ છે અને તેમાંથી અનેક પરિમાણો અને પરિણામો નીપણ્યાં છે. અહીં પ્રસ્તુત કવિતા જેવાં અસંખ્ય સુભાષિતો સંસ્કૃત સાહિત્યમાં રચાયાં છે.

નૃસિંહ ભગવાનનું ભયાવહ વિરાટ સ્વરૂપ એ રીતે વંજિત થાય છે કે, હિરણ્યકશિપુ ભગવાનથી ભયભીત થઈ ગયો છે અને તે ડરીને પોતાને બચાવવા ધૂપાઈ જવા ઈચ્છે છે. આવા બૂહદ આકાર ધરાવતા નરસિંહથી ક્યાં ધૂપાઈ શકે? તો તે દાનવ ભગવાનના નખની અંદરના અવકાશમાં સંતાઈ જ્ય છે. હિરણ્યકશિપુ પોતે પણ મોટો દેત્ય છે અને છતાં ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહરૂપનું સ્વરૂપ કેટલું વિરાટ હશે તેનો જાણો કે, કવિ આપણને માપદંડ (સ્કેલ) પૂરો પાડે છે. આ દેત્ય ભગવાનના નખના અવકાશમાં

લપાઈ જઈ શકે છે. આગળ ચાલીએ.

તો નૃસિંહ ભગવાનને તો એ ક્યાંય દેખાયો નહીં. તેમને આશ્રય થયું. હજુ એક ક્ષણ પહેલાં તો અહીં હતો. ભગવાને ચારે તરફ દણિ ફેલાવી. પણ દૈત્ય તો ક્યાંય નજરે ન પડ્યો. કવિની સર્જનશીલતાની સીમા તો હવે આવે છે. નૃસિંહ ભગવાનને પહેલાં તો આશ્રય થયું કે દાનવ પોતાના પંજામાંથી છટકી શક્યો. (વાસ્તવમાં દૈત્ય ભગવાનના પંજામાં-નાખમાં જ છે!) પછી ભગવાન નિરાશ થયા. એમને થયું, આ સર્વ બંજિત છે, આટલી બધી મહેનત કરી, આ રાક્ષસ માટે અવતાર ધારણ કર્યો, પૃથ્વી પરનો ભાર ઉત્તારવા માટે આટલો બધો શ્રમ લીધો. અને જે કાર્ય માટે અવતાર લીધો હતો તે કાર્ય પાર ન પડ્યું. એટલે, તેઓ નિરાશ થયા, ચિઢાયા. સર્વશક્તિમાનું, સર્વજ્ઞ પ્રભુ ચિઢાઈ પણ શકે છે, નિરાશ પણ થઈ શકે છે, સર્વની આશા પૂરી કરનાર પોતે હતાશ પણ થઈ શકે છે. વાહ! કવિ, અદ્ભુત!

એટલે નિરાશામાં, અકળામણથી નરસિંહ ભગવાને પોતાનો હાથ જોરથી ઝાટક્યો અને ઝાટક્યાની સાથે નખ અને આંગળીના અવકાશની વચ્ચે ભરાઈ ગયેલો હિરણ્યકશિપુ બહાર ભગવાનની સામે પટકાયો.

અને એક તરફ વિરાટમ ત્રિભુવનને આવરી લેતું ભગવાનનું વિરાટ સ્વરૂપ અને બીજી તરફ વિરાટ આકૃતિની સામે કુદ્રાતિક્ષુદ્ર રાક્ષસ. અને આમ બહાર પડેલા રાક્ષસને જોઈ, કોધ, વિસ્મય, હતાશા વગેરે ભાવોમાંથી પસાર થઈ રહેલા નરસિંહ ભગવાનને હસવું પણ આવે આયું. એ દશ્ય જ એટલું Incoherent-અસંગત હતું કે સ્વયં ભગવાનને હસવું આવી ગયું. સંદાર કરવા પ્રવૃત્ત થએલા ભગવાન પણ હસી શકે છે; તેમને હસવું આવી જાય છે; તેઓ હસી પડે છે; તે જાતહાસો બને છે; તેમનામાં હાસ્ય જન્મે છે. ભગવાનને નિરાશ આદેખીને કવિએ જે સીમાંકન કર્યું હતું તે ભગવાનને હસતા બતાવીને સીમોલ્લંઘન પણ કર્યું છે. ભગવાનના આ હાસ્યને આપણે black humour - કાણું હાસ્ય પણ કહી શકીએ કારણ કે, થોડીક કાણોમાં જ નરસિંહ આ દાનવને રહેસી નાખવાના છે, ચીરી નાખવાના છે. સુભાષિતમાં બરુદ્દલન શર્ષ પણ પ્રયોજનો છે. પણ વિરાટ નરસિંહ રોષ, નિરાશા, વિસ્મય અને હાસ્ય જેવા ભાવોમાંથી પસાર થાય છે. કવિએ તેમને પસાર થતા દર્શાવ્યા છે. અને એથી પણ આગળ તેમના હાસ્યને કરુણાંનો પુટ પણ ચઢેલો છે એટું અર્થધટન કરી શકાય. છેવટે તો, પ્રભુના હાથે આ દાનવનો મોક્ષ થવાનો છે. તો આ કવિતા ઉચ્ચ પ્રકારની સર્જકતાથી મંજિત છે. આવી સર્જકતા પ્રકારવનાર કવિ (નિરણ્યસાગર પ્રેસના સુભાષિતરત્નભાજાગારમાં આ સુભાષિત હનુમત્ર કવિના નામે મળે છે. પણ હનુમનાટકમાં તો આ પદ પ્રાપ્ત થતું નથી.) ને - તે અજ્ઞાત કવિને પ્રણામ.

*

નવી આબોહવા | મહેન્દ્રસિંહ પરમાર

‘નિબંધ લખવા જેવી-તેવી વાત નથી’ - એવું પૂર્વસૂરિએ કહ્યું તે અનુઝોને કઈ રીતે સમજાયું હશે? વિજય સોનીને પૂછશો તો કહેશે, હા. નિબંધ લખવા જેવી-તેવી વાત નથી પણ જેવી છે તેવી વાત, વાતાની સરહદને અહું-અહું કરતી નિબંધનાં રૂપને સાકાર કરે તો કેવી રીતે કરે? વાતાનાં સ્વરૂપમાં કામ કરનારે ‘નિબંધ’નો ચાળો કરાય? એની વાતર્કાળા એમાં અણપાય ખરી? બાળકનીમાં બેઠાં-બેઠાં જગતને તાકી રહેતો ‘વાતર્કાર’ ચોકમાં આવે ને નિબંધના પતરાં પર વાર્તા અને ચરિત્રની જુગલબંદીસમી અવનવી મીનાકારી ગધમાં કરવા ચાહે તો કેવી રીતે થાય? ‘પરબ’ જાન્યુઆરી-૨૦૨૧માં પ્રગત થયેલો નિબંધ વાંચો : માણેકચોકનાં મીની રતનો...

નિબંધની કીડાભૂમિ છે માણેકચોક. અમદાવાદનું ઉજ્જીવન. અમદાવાદની નાભિ કહો તો એમ-અમદાવાદની રંગે બુરજ બનાવવા બાદશાહના કારીગરો મથે ને રાત્રે માણેકનાથ બાવાની સાંથેલી ગોઠડીના ટાંકા ઉક્કે ને બુરજ ધરાશાયી થાય એ પ્રચલિત કથાના સહારે નિબંધ ઉઘે છે ને નિબંધકાર આ લીલાભૂમિની લીલી સૂકીનું ચિત્ર આંકે છે. ‘શતરંજની રમતમાં એક મહોરાંને પાડીને બીજું મહોરું ગોઠવાઈ જાય એમ - દિવસે ચોકસીઓ અને રાત્રે એ જ જગ્યાએ ખાણીપીણીવાળા ગોઠવાઈ જાય, ‘કરોરોના વેપાર’ અને ‘ભૂખબજાર’ અને ‘શેરબજાર’ની સહોપસ્થિત વર્ણવી નિબંધકાર માણેકચોકમાં વચ્ચોવચ્ચ ઊભેલો થાંભલો ચીંધી, કહે છે : ‘હમણાં ઊગ્યો છે’, હમણાં ‘ઊગેલા’ થાંભલેથી કેમેરા તમને વેરી જાય છે સાંકડીશેરીનાં અજગાર જેવાં મોઢાંમાંથી સુંદર.. સોનાના દાગીના બનાવનાર લેંધો-સદરો પહેલેલા, હવે. આઉટ ઓફ ડેટ કારીગરોના કળા-કૌશલના કિસ્સાઓને સાંકડીશેરીમાંથી માણેકનાથ બાવાની મઢી સુધી પહોંચતા ‘બતાડે’ છે ને જાણે મેદાન

વર્ણનાં સ્તરે ચાલતું ગદ્ય, કથનના સૂરમાં બીજા પરિચ્છેદથી ઊપે છે ને નિબંધકાર ‘વાત’ કરે છે રમણની. સોનાના દાગીના પર નકશીકામનો કારીગર રમણ, કેવો દેખાય છે? : ‘સોડાબોટલના તળિયા જેવા કાચનાં ચેષ્ટમાં. બેઠેલા લાંફિંગ બુદ્ધ જેવું શરીર. માથામાં વચ્ચોવચ્ચ સપાટ રસ્તો (પ્રથમ પરિચયમાં, ચોકમાં વચ્ચોવચ્ચ ઊગેલો થાંભલો યાદ કરતો) અને આજુબાજુ જાળાં-જાખરાં જેવું આણુંપાતળું જંગલ ઊગી નીકળેલું. વાળ ક્યારેય ઓળતો નહીં. બોલે ત્યારે નાકમાંથી બોલે એટલે ખાનગીમાં બધા એને ‘રમણ ગુંગણો’ કહેતા.

...આવો રમણ, નકશીકામમાં ઊડતાં પંખી પાડે એવો : ‘સોનાના પતરાં પર નકશી કરતાં એ અવનવી ઢીંગલીઓની, પતંગિયાઓની ભાત ઉપસાવી આપે. તમને એ જોઈને એવું જ લાગે કે હમણાં આ ઢીંગલીઓ-પંખીઓ-પતંગિયાં બધાં ભેગાં મળીને ઊડશે અને વાદળોની સોડમાં ભરાઈને બ્લૂ આકાશ ભરી દેશે, નકશી કર્યા પછી રમણ તમારી સામે એવી રીતે જુએ જાણે વિશ્વરૂપ દર્શન કરાવ્યા બાદ શ્રીકૃષ્ણ અર્જુન સામે જોઈ રહ્યા હોય!

આવી મીનાકારીનો માહેર રમણ સાંજે ‘વનવગડામાં ભૂલા પડેલા જીથરાભાભા’

જેવો આખા દિવસની કમાડી પોપટ સટોરિયાને ત્યાં પાનું લખાવતો અને મટકી રમવાને આજે ચડતો દેખાય એનાં પતનનાં એક પછી એક ચિત્રો આવતાં જાય અને આવો એક 'કલાકાર' મૂહિલિસીની ફૂટપાથ પર બટકતો બિખારી કઈ રીતે થઈ ગયો એની કથા કમશા: કહેવાતી જાય.

ધરમાંથી કાઢી મૂકાયેલો, ધંધાવિહોણો રમણ 'ચંપલચોર'ના ઈલ્કાબ સાથે રમરોટીમાં લૂસલૂસ ખાતો, અથળ માર ખાતો, બેવડ વળી જતો, તૂટેલા પગે ટસડાતો, ભીખ માગતો રમણ હવે નિબંધકારની સામે છે અને લેખકને કહેવાનું મન થાય છે કે, 'તું આમ સોનાનો કારીગર થઈને હાથ લાંબો કરીને ભીખ કઈ રીતે માંગી શકે? દવાખાનામાં જઈને પગ સરખો કરવી લે અને નાનકડો બાંકડો લઈને બેસી જા પાછો નકશી કરવા.. પતંગિયાંની-હૂલોની-દોડતારમતાં રાજારાઝીની!' પડા 'ઉતાવળ' અને રમણ દ્વારા મોટા રૂપિયાની માંગણીની બીકે લેખક નથી કહી શક્યા એ પછી રમણ નથી અને વરસાદ પછી ધોવાયેલા-ઉજળા માણેકચોકમાં, દુના પોટલાં જેવાં વાદળો થીજુને' ઉભાં રહી ગયાં છે ને માણેકચોક પર જણુંબતી ઉદાસ સાંજના વાતાવરણમાં ઉડતાં પતંગિયાંમાંનું એક... 'જાણો રમણના હાથની નકશીથી સજીવન થઈને માણેકચોકમાં' લહેશાતું નિબંધકાર જોઈ રહે છે ને વાચક ને 'દેખાડી' આપે છે!

સ્થળવિશેષ - માણેકચોક - અને પાત્રવિશેષ - રમણ ને અભિવ્યક્તિવિશેષથી, સંણગ ગુંધાતાં આવતાં ગાધીથી, પાત્રનાં અને પરિવેશનાં જીણાં મીનાકારી જેવાં નકશીકામથી કોરતાં જઈને વિજયે એનું સોનીકામ સિદ્ધ કર્યું છે. વાતિમાં ખપ લાગેલી એના વ્યવસાયની બારીકીઓ અહીં ચરિત્રને ઉથલાવતી, લેખકનાં સંગત-નિજ સંવેદન મફયાં ઉપસંહારને કારણે નિબંધના તટે સ્થિર થઈ છે. માણેકનાથની ગોદડીના નિર્દેશથી આરંભાતો નિબંધ રમણની જીવનગોદીના વિખરાવ સાથે સંકેલાય છે ને આખું વર્તુણ પૂરું કરે છે ત્યારે બુરજ ઠગલો થઈને પડ્યો કે માણસ-એની ઉદાસ અવફવ અનુભવાય છે. રમણનાં જીવનરકસનું કારણ એનો કુટેવ તો છે જ, 'હાથનકશીની જગ્યાએ હેન્ડમશીન આવાં, પેન જેવું વંત્ર હુકુરુકુ કરતું ઉપે અને દાગીનો જોતજોતામાં મોહું દેખાય એવો ચ્યમકવા લાગે'... ત્યારે મધ્યમવર્ગાય અર્થશાસ્ત્ર પણ સાંકડીશેરીથી લંબાઈને માણેકનાથ બાવાની મઢી સુધી પહોંચી જતું અનુભવાય. ને એક 'મીનીરતન'ને આમ 'મેજર અપસેટ' બની જતો જોઈ રહેવાય!

વાતાંગધી ગદ્ય અંગતતાના સ્પર્શથી નિબંધનું ગદ્ય બન્યું છે. સહદ્ય ભાવકોને ઉમાંશકરનું નાટક 'માણેચોક' યાદ આવે, 'નિબંધ'માં રહીને 'વાતાં'નો અનુભવ કરાવનારો ડિશનસિંહ ચાવડા, દિગીશ મહેતા, અનિરુદ્ધ બ્રહ્મભહુ અને જનક ત્રિવેદી પણ યાદ આવશે. 'ઈશ્વરને તલાક' નિબંધનો પોપટ આ રમણને જરા જુદી રીતે મળવા આવે એવો છે. વ્યાવસાયિક અનુભવને બળો, અભિવ્યક્તિનાં વિશીષ ક્રોશલ્યોને ખપમાં લઈને ઉભેલો આ નિબંધ ઘડા સમય સુધી 'સ્થિર' રહે તેવો બન્યો છે. 'માણેકચોકના મીનીરતન'-એવું શીર્ષક કરીને લેખક હજી બીજાં રત્નો 'બતાડવા'નો સંકેત પણ કરતા લાગે છે!



શતાબ્દીવંદના

અજસ્ટ સર્જકતાનો વૈભવ : સુરેશ જોધીના નિબંધો

રમણ સોની

બુદ્ધદેવ બસુએ ‘ટાગોર : પોટ્રોટ ઓફ એ પોએટ’માં લખેલું – ‘કિશોરકાળમાં એમના પુસ્તક પછી પુસ્તકમાંથી પસાર થતી વેળા મેં રોમાંચ અનુભવેલો [...] એ કાળને સંભારતાં કહી શકું કે અમારી પેઢીનું ટાગોરક્રાંતા કથી શકાય એથી વિશેષ છે. જરા થોભીને શ્યામ વાદળના કે સૂર્યસિતના સૌંદર્યને નિરખવાનું અમને એમણે જ શીખયું, સુખ અને સંતાપની અમારી અનુભૂતિને સંવેદન-સંપન્ન એમણે જ બનાવી.’^૧ ૨૦મી સદીના છંદા-સાતમા દાયકાની ગુજરાતી ડિશોર-યુવા પેઢીના રસિક વાચકો-સર્જકોએ, સુરેશ જોધીના નિબંધો વાંચીને આવો રોમાંચ અનુભવેલો? એ પ્રશ્નને હમણાં એમ જ રાખીને આગળ ચાલીએ.

સર્જક તરીકે સુરેશ જોધીનું કવિત્વ એમની કવિતામાં નહીં એટલું એમના નિબંધમાં મહોરેલું છે. એમની વાતરીએ આધુનિક વાતરીનો એક આગવો ચહેરો બતાવ્યો; સર્જનાત્મક પ્રયોગશીલતાનું વિશેષ રૂપ પ્રગટાયું. એનો મહિમા ગુજરાતી ટૂંકીવાતરીની પરંપરામાં એક ઐતિહાસિક મૂલ્ય તરીકે વિશેષ અંકિત થયો. પરંતુ જેણે સ્પૃહશીય સર્જકપ્રભાવ પાડ્યો ને જેની તાજગી સમય જતાં પણ એવી જ રહી એ તો એમના નિબંધો જ. પંચેન્દ્રિય-પ્લાવિત સંવેદનનું એમાં જે લલિત ગાદરૂપ રચાયું એ ઘણી રીતે અ-પૂર્વ રહ્યું.

એ અપૂર્વતાની વધુ વાત કરતાં પહેલાં, તુલના લેખે, એમના બે પૂર્વસૂરિઓમાંથી કેટલાક અંશો જોઈએ.

ગુજરાતીમાં લલિત નિબંધ પહેલવહેલો ગાંધીવિચારના અગ્રાહી અનુયાયી અને જીવનમૂલ્યોની ઉપાસના કરનાર શિક્ષક કાકાસાહેબ કાલેલકર પાસેથી મળ્યો એ એક સુખદ આશ્રય - એણે, સર્જક કાલેલકરની વિસમયશીલતાનું એક તૃપ્તિકર ગાદરૂપ આપણી સામે ધર્યું. વાંચીએ :

- એક વિરલપર્ણ તાલવૃક્ષનાં પાંડાના આરાઓ જે નાભિમાં ભેગા થતા હતા, તાં જ બરાબર ચંદ હતો. તાડની પાંચ ડાળીઓથી એ ચંદબિંબના પાંચ વિભાગ થતા હતા, જાણે ભૂસંપકની પાંચ પાંડીઓ. તાડનું મોટું પણચ્યક મોઢા આગળ પકડીને ચંદ હસતો હતો [...] એક નાળિયેરોએ પોતાનાં પાંડાના (ઉજરડા ચંદના ગાલ પર બેંચી બતાવ્યા એની મજા પડી! (તાડ પાછળનો ચંદ, ‘જીવનનો આનંદ’, ૧૯૩૬)

- શું ટેકરીઓ કોઈ જોતું ન હોય ત્યારે મધરાતે કપડા ઉતારીને સરોવરમાં નાહવા પડતી હશે? આજે તો નહિ જ જીતરે, કેમ કે દુર્વિનીત ચંત્રમા મધરાત સુધી

૧. ગુજરાતી અનુવાદ જ્યંત મેધાણી-અનુવાદિત-સંપાદિત ‘રવીન્દ્રસાન્નિધ્યે’-માંથી

એકીટશે સરોવરમાં જોતો હશે.

(સંધ્યારસ, ‘રખડવાનો આનંદ’, ૧૮૫૩)

પ્રકૃતિદર્શનનો આનંદ અહીં રૂપલીલા સર્જવાની સાથે જ કંઈક પ્રગલ્ભ મનુષ્ય-સંવેદન-લીલાનો પણ સંકેત કરે છે એમાં અલંકરણ વધુ પ્રકૃતિલિત બની રહે છે. સુરેશ જોખીના નિબંધોમાં વધુ ઉત્કૃત્ત્વ બનતી સંવેદન-રૂપ-લીલાની જ્ઞાણો કે આ નાન્દી છે.

અવાજના રૂપનો વૈભવ, જરાક જુદી રીતે, સુરેશ જોખી પૂર્વ જ્યંતિ દલાલમાં પ્રગટેલો. એ પણ સાંભળી લઈએ - સંદર્ભ છે શહેરની શેરીનું બપોર પછીનું સંચરણા.

નાનકરી વામ્ફુક્ષી કરી ફરી પાછો શેરીનો અવાજ એના અનન્ય રૂપે ધૂઘવાટ કરે છે.

ફરી પાછા જલદેવતાના ઊંચાનીચા અવાજ, ચીજાબાવ પર દોસ્તદાવે વળગેલી ધૂળના વિજોગસૂર, નાનાં બાળકોનાં ખંખોળિયાં, તાર-કસબવાળા ભુંફા વહેરાજીનો વર્ખોથી એક જ નીકે વહેયે જતો અવાજ [...] સાંજ ઢણતી આવે છે. જ્ઞાનની પોટલી દક્ષતરમાં ધાલી, હળવા થઈ શાળાએથી પાછા ફરતા નિશાળીયા ભૂખનો રાગ આલાપતા આવે છે ને શેરી નફિકરાઓનું કીડાંગણ બની રહે છે. દેશીવિદેશી રમતોના અનેકવિધ અવાજ, વિરોધના સૂર, મનામણાં, માર્ઝી અને ઉદ્ઘતાઈના ભાતીગળ શબ્દો, એક ખૂણે અન્યાયે આણેલાં આંસુ સાથે ભળી જાય છે.

(‘શહેરની શેરી’, ૧૮૪૮)

અહીં વીસમી સદી-અધવચના અમદાવાદનો એક જીવનખંડ કંડારાયો છે એ તો ખરું, પણ દશ્યોના આણુઅણુમાંથી પ્રગટો આ ધ્યન્યાલોક સર્જકસંવેદનનાનું પણ એક અદ્ભુત ગદ્યરૂપ રચે છે. અલબત્ત, જ્યંતિ દલાલમાં અવાજનાં રૂપો નક્કર શિલ્પાકૃતિઓ રચે છે, સુરેશ જોખીમાં – હવે પછી જોઈશું એમ - અવાજનાં રૂપો સંગીતની તરલતા નીપજાવે છે.

*

૧૮૫૫-૫૬ આસપાસ સુરેશ જોખીના આ નિબંધ પ્રગટ થતા ગયા ને એનું એક વિશેષ રૂપ બંધાતું ગયું એમ સ્પષ્ટ થયું કે એણે પ્રસન્ન આભાવાળો એક આગવો સૌંદર્યલોક સરક્યો છે. કાકસાહેબમાં તરલ કલ્પનાશીલતાવાળો જે ‘અલંકારવૈભવ’ હતો^૨ એમાં દર્શનની ઇન્દ્રિયથી જિલાતાં સૌંદર્યરૂપોનો વિસ્તાર હતો, સુરેશભાઈમાં દર્શન કરતાં પણ સ્પર્શ, ગંધ અને સ્વાદની ઇન્દ્રિયો દ્વારા જિલાતાં સૌંદર્યરૂપોની પ્રકૃત્વતા અને નિબિડતા વિશેષ હતાં. ગુજરાતી સર્જક-નિબંધની કાલેલકરે અંકેલી રેખા સુરેશ જોખીમાં કેવળ આગળ લંબાવાને બદલે એક નવા ઉક્યનને અંકિત કરે છે.

આ ઉક્યન અલબત્ત, રવીન્દ્રનાથની નિબંધસૂચિમાંથી પસાર થઈને વિશેષ વેગ મેળવતું રહ્યું છે. રવીન્દ્રપ્રભાવને સુરેશભાઈએ બહુ લાક્ષણિક રીતે સ્વીકાર્યો છે. ‘જનાનિકે’ (૧૮૬૫)ના એક નિબંધમાં એમણે લખ્યું કે, ‘ફૂલની શોભાથી ચકિત થઈને બે લીટી લખવા જઈએ કે તરત સાંભળવા મળે – ‘ધોડો આવા ટાગોરવેડા!’ પરંતુ ‘એકધારાપણું, એકસૂરીલાપણું ટાળનું હોય તો કોઈકે ગાળ ખાઈ લઈને, હડ્ધૂત થઈને પણ ‘ટાગોરવેડા’

૨. સુરેશ જોખીએ કાલેલકરના નિબંધોની વાત કરતાં એને ‘કાકસાહેબનો અલંકારવૈભવ’ કહેલો. જુઓ : ‘કાલેલકર અધ્યયનગ્રંથ’માં એમનો લેખ.

કરવાનું માથે લેવું જોઈએ’ ને પછી જરા મર્મપૂર્વક કહે છે, ‘ટાગોરે ‘કાલિદાસવેડા’ નથી કર્યા? ને કાલિદાસે ‘વાભીકિવેડા’ નથી કર્યા?’

અહીં જ, રવીન્દ્રનાથના નિબંધોમાંથી બે'ક નાના અંશો ઉતારવાનું મન થાય છે. એ બંને નિબંધોના ગુજરાતી અનુવાદ સુરેશ જોખીના છે.

- પવનની લહરીઓ એકબીજા સાથે જ્યારે સુંદર કીડા કરે છે ત્યારે તેમનાં એ આશ્રયકારી મિલન અને સૌંદર્યને આપણી આંખ જોઈ શકતી નથી, આપણા કાન દ્વારા જ અને લીલા ગીતરૂપે પ્રકટ થાય છે. વળી આકાશમાં જ્યારે પ્રકાશના તરંગો ધારાએ ધારાએ અનેક તાલે નૃત્ય કરી રહે છે ત્યારે તેમની એ નિરતિશય સુંદર લીલાની કશી ખબર આપણા કાનને પડતી નથી, આંખને જ એ રૂપનાં દર્શન થાય છે.

(કાલે રાતે અગાશીમાં, ‘રવીન્દ્રપર્વ’, અનુ. સુરેશ જોખી)

- અંધકારને જો કોઈ અને બંધબેસતી ભાષામાં બોલાવી શકે એમ હોય તો એ શ્રાવણની વૃદ્ધિયારાનો ધ્વનિ. અંધકારની નિઃશબ્દતા પર એ ઝડુઝડુઝ કલશબ્દ જાણે એક પણી અંધકારની ઘેંચતો જાય છે, એ રીતે અને વધારે ગંભીર ને ગાઢ કરી મુકે છે, એ આખાય જગતની નિજાને પણ નિબિડ કરી દે છે. વૃદ્ધિ પડવાનો આ અવિરામ શબ્દ, એ જાણે શબ્દનો અંધકાર.’

(શ્રાવણસંધ્યા, ‘રવીન્દ્રપર્વ’)

રવીન્દ્રનાથમાં સર્વ-સ્વીકારની પ્રસન્નતા, મોકણાશ અને અનુદ્ધ્વન્નતા છે એટલે એમનામાં સૌંદર્યબોધની સાથે પ્રકૃત્વ વિનોદ પણ છે – રવીન્દ્રનાથ કટાક્ષનો પણ વિનોદમાં અંતભાવ કરી લે છે. (એક જગાએ એ કહે છે – ‘ધરમાં ફૂત્રિમ ફૂલ શોભા માટે રાખ્યું હોય તેના ઉપરથી દરરોજ ધૂળ જાપટવી પડે છે. પરંતુ અરણ્યનાં ફૂલ ઉપરથી ધૂળ જાપટવા કાંઈ માણસ રાખવામાં આવતા નથી. તે ઉધારું પડી રહે છે, તેને ધૂળ પણ લાગે છે, છતાં તે પોતાની સુંદર નિર્મલતા સહજ રીતે જ સાચવી રહે છે.’³ સુરેશ જોખીમાં પ્રકૃતિના અનુરાગની પ્રસન્નતા સાથે ક્યારેક એક વ્યાકુળતા પણ દેખાય છે – વર્તમાન નગરજીવનની યાંત્રિકતા ને મનુષ્યની બર્બરતા એમને ઉદ્ધિગ્ન બનાવી દે છે. એટલે એમનામાં ક્યારેક તિર્યક્રતા અને કટાક્ષની પણ યેચાયેલી જોવા મળે છે, રવીન્દ્ર જેવી અનાફુલ હળવાશ એમનામાં સાચંત નથી. અલબત્ત, રવીન્દ્રપ્રમભાવ સુરેશભાઈ માટે કેવળ પુષ્ટિ-પેય ને પ્રેરક બનેલો છે; રવીન્દ્રસૂચિમાં સુરેશ જોખીની નિબંધસૂચિ વિલીન થઈ નથી કેમકે સુરેશભાઈનું પોતાનું એવું, લગતભગ તુલ્યબળ, સર્જકકાહું છે; આગવું સંવેદનજગત ને આગવી કલ્યનસૂચિ છે; તથા એમની વિદ્યાધતા બહુશુતતાથી સમૃદ્ધ થયેલી છે.

અનુભવના મૂળ તંતુને બરડ ન બનવા દે એવું, સૂચિ પ્રત્યેનું નિતાન્ત વિસ્મય એ તો સર્જકમાત્રાનું સંચારી બળ હોય છે પણ એમાંથી બાળ-કિશોરવયની સ્મૃતિઓમાં સચ્ચવાયેલું અનાદ્રાત વિસ્મય વધુ આકર્ષક હોય છે. ‘મનીષા’ સામયિકમાં પ્રગટ થવા લાગેલા સુરેશ જોખીના નિબંધોનું પ્રારંભબંદું આ પ્રથમ વિસ્મયરેખાઓવાળું છે. એ કહે છે –

3. ટાગોરના નિબંધો-પત્રો, સંપાદક અને અનુવાદક નગીનદાસ પારેખ.

‘બાલ્યવયમાં ઈન્ડિયોનાં દ્વાર આગળ બાધજગત એવી તો ભીડ કરીને ઉભું રહેતું કે ન પૂછો વાત ! [...] આપણા ‘બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગન્ધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિઓ છે. મનથી સ્વતંત્રપણે શરીરને પણ એનું આગણું સ્મરણ હોય છે.’ (‘જનાન્તિકે’).

વિવિધ ઈન્ડિય-અનુભવોનો આ વિહાર જે એક ભાતીગળ કલ્યન-સૃષ્ટિ રચે છે એ સુરેશ જોખીના નિબંધોની સમૃદ્ધિ છે. આ સમૃદ્ધિ ‘જનાન્તિકે’થી આરંભાઈને ‘પશ્યન્તી’ સુધીના આઠેક સંગ્રહોમાં ને કેટલાક મરણોત્તરગ્રંથસ્થ નિબંધોમાં સંચિત થયેલી છે.

મુખ્યત્વે કલ્યનકેન્દ્રી રહેલા સુરેશભાઈના નિબંધોમાં સંવેદ અનુભવોનું વર્ણન-અલંકરણ-રૂપ પણ જોવા મળે છે, પણ અલંકારોને એમણે બને એટલા તરલ બનાવ્યા છે. ‘બપોરની અલસમન્થર વેળા સાપે ઉતારી નાખેલી કંચળીની જેમ પરી રહી છે’ (‘જનાન્તિકે’), એ પ્રકારનું દશયાલેખન તો કાલેલકરમાં પણ જરે, પરંતુ ‘સમુદ્ર પાસેથી લગામ ધોડાવીને પવનના અશ્વો દોડી નીકળ્યા છે’ (‘જનાન્તિકે’) — એવી પ્રચ્છણ ઉત્પ્રેક્ષા પર તો નરી સુરેશ-મુદ્રા છે. ઉત્પ્રેક્ષાનું એક સ્પષ્ટ ને સુરેખ ચિત્ર પેલી બાલ્યકાળની અનુભવસૃષ્ટિમાંથી ઉપસ્થું છે એ બહુ આખાદક છે : ‘કોઈ ચાંદની રાતે જાગી ઊરીને બહાર નજર જતી તો ચંદ જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધુણાવીને હોકારો પૂરું હોય એવું લાગતું’ (‘જનાન્તિકે’).

કલ્યનશ્રેષ્ઠી દ્વારા અમૂર્ત તત્ત્વોને રૂપ આપવાની રીતિ અને એમની જાણીની થયેલી, છતાં આજેય આસ્વાદ રહી શકેલી વિશેષતા છે. એમણે અવાજ, અંધકાર, સમય, પવન, સૂર્ય, એમ કેટકેટલાં તત્ત્વોને આમ રૂપાયિત કરેલાં છે! સમય વિશેના નિબંધમાં આવી કલ્યનલીલા વધુ પ્રસરેલી છે. એનો એક અંશ જોઈએ -

કવિ કાવ્યની પંક્તિને છેઠે પ્રાસાં સમયને ગુંથી લે છે. નર્તકીના પાયલમાં સમય રણકી ઊઠે છે, હીંયકાના ઝૂલામાં સમયને ઝૂલતો જોઈ શકાય છે, પ્રેમવિદ્ધવળ લજાશીલ કન્યાના ચટુલ કટાક્ષોમાં સમયનાં મનોહર આવર્તનો દેખાય છે, છાણ પંડેરમાં હંઙ્કતો બેઠેલો વૃદ્ધ સમય, હેશીમાના દનટીલીન મુખની બખોલમાં બેઠેલો સમય, મહાદેવના મંદિરના ગર્ભગૃહમાં સાપની જેમ કોકું વળીને બેઠેલો શીતળ સમય [...], હેમન્તના તડકાના સોનેરી પાત્રમાં ભરેલો આસવ જેવો સમય ગરટાવવાનું ગમે છે પણ બે સ્ટેશન વચ્ચે દોડતી ગાડી સાથે બેંગાતો સમય હેંશાં સહ્ય બનતો નથી. (‘ઇદમ્ય સર્વમ्’)

અનેક નિબંધોમાં એમણે આવાં કેટકેટલાં કલ્યનો અથાકપણે ઉડાડ્યાં છે! - આ અજબ્દતા નહાનાલાલની કવિતામાં કલ્યનાની જે અજબ્દતા છે એની યાદ આપે છે. બંને સર્જકોમાં આખું સ્પૃહધીય ઉડાઉપણું પ્રચુર માત્રામાં છે ને એથી જ, લોભાઈને એનું અનુકરણ કરનારા, ઓછી શક્તિવાળા, બન્નેના અનુકાલીન સર્જકો ભોંઢા પડેલા છે.

પ્રકૃતિનાં રૂપોમાં કલ્યનોથી ઉદ્ઘણતી પ્રસન્નતાથી ઘણા નિબંધો છલકાઈ ઊઠેલા છે પરંતુ, એ સાથે જ, ક્યારેક વિષાદ-યોગમાં એ કલ્યનોનું રૂપ પલટાઈ જાય છે. એવી મનસ્થિતિને આલેખતા ‘ચીથરા જેવા પવનને ઓઢીને મ્લાન મુખે આજે સવારે દિવસ મારી ઊભો છે’-થી આરંભાતા એક નિબંધમાં કલ્યનોનું વિલક્ષણ રૂપ જોવું છે :

‘કોઈક વાર દિવસ એવો હીજરો લાગે છે કે એમાં રાત્રિના બીજને ઉઠેરવાનું ભૂંડાક્ષ જ હોતું નથી [...] આંગણામાં થોડો ચોળાયેલો, વારી લાગતો, તડકો પડ્યો છે. [...] સહજ જ વધારે વજન જીલવાનું આવતાં શબ્દો વળી જાય છે, બાંગી જાય છે. એની વિચારતી રજ મારી દાણને ધૂંધળી કરી નાખે છે. શબ્દોને સાચવી રાખવાની જરૂરી માયા રહી નથી. છતાં એમની આવી હુર્દશા જોઈ રહેવાતી નથી. [...] સ્મૃતિના મસોતાથી હદ્યદપણી ચોખ્યું કરીને, જાંખી જાંખી છબીઓ જોઈને હું ધરાઈ ગયો છું. સમયનું જ અર્ધપારદર્શક અબરાખિયું પડ પરોક્ષતા લાવી દે છે. (રમ્યાણી વીક્ષ્ય)

વિખાદની આવી મનસ્થિતિ ઉપરાંત, મનુષ્યજગતને માનવસંબંધો અંગેનાં પ્રતિભાવ-સંવેદનો આવેખતા નિબંધોમાં નિરશાની, વિદ્રોહની ને પરિણામે કટાક્ષને કહુતાની રેખાઓ પણ પ્રગટી છે. દાંભિકતા સામેનો એમનો રોખ વિલક્ષણ સાદૃશ્યોથી આવેખાયો છે - ‘કોમિયમ પ્લેટેડ સૌજન્યનો ચળકાટ નથી સહેવાતો. એવા સજજોના શબ્દે શબ્દે એન્ટીસેપ્ટિકની ડિસેઇન્ફેક્ટની ગન્ય આવે છે [...] એમના સ્મિતમાં ઈથરની શીતળતા હોય છે.’ (‘જનાન્તિકે’). અન્યત્ર લાખે છે, ‘કેટલાક જેમ હાથમોજાં પહેરી રાખે અને હાથને કશાનો સીધો સ્પર્શ નહીં થવા દે એમ આ લોકો ઔપચારિક ભાષાને મોજાંની જેમ સદા પહેરી રાખે છે.’ (‘ઈદમુસર્વમ્ભુ’)

દંબી અને ભીરુ ‘બુદ્ધિવાઈઓ’ તથા અલ્ય શક્તિવાળા તેળવાતું સર્જકો પરની એમની અકળામાણ તો કલ્પનો સાદૃશ્યોને પણ બાજુએ ખસેરી દઈને સીધા રોખની ભાષામાં વ્યક્ત થઈ છે. પ્રતિભાશૂન્ય સર્જકો માટે સુરેશભાઈ કહે છે - ‘[એ] નાનાં નાનાં છમકલાં કરનારા, એમનો વ્યાપ નાનો, એમની શક્તિ ઓછી ને છતાં પ્રતિષ્ઠા માટેની ભૂખ ઓછી નહીં. એમને માટે સમાજ ચન્દ્રકો ને ઈનામોની વ્યવસ્થા કરે, એમને આગલી હરોળમાં બેસાડે, એમને સંસ્કૃતિના ઘડવૈયા કહીને બિરદાવે ને આ સર્જકો સંસ્કૃતિનો જ ઉપહાસ કરતા હોય’ (‘ઈદમુસર્વમ્ભુ’) અહીં કમશઃ ઊંચો થતો જતો અવાજ સાંભળી શકાય છે; તો અન્યત્ર ઠાવકા સાદૃશ્યથી કરેલા કટાક્ષનો વિલક્ષણ કાઢું સંભળાય છે : ‘હમજાં ‘પ્રતીક’ શબ્દની આવી દશા થતી જાય છે. સાપ મરી જાય પછી તો કીરીઓ પણ એને બેંચી લઈ જાય, તેમ આ મરવા પડેલા પ્રતીકને ઘણા બેંચી લઈ જઈ રહ્યા છે, પ્રતીકની આ હુર્દશા એક કરુણ પરિસ્થિતિ છે. પણ કોઈવાર કીરીઓનેય પરાકમ કર્યાનું આશાસન તો પ્રાપ્ત થવું જોઈએ ને!’ (‘જનાન્તિકે’)

સુરેશ જોધીના નિબંધોમાં મહંદશે એક ઉમિસૂર - લિરિકલ નાદ સંભળાય છે, એટલે ક્યારેક કોઈ ગદ્ય-ખંડને પંક્તિ-વિચ્છેદ કરીને લખવામાં આવે તો એ સહજ રીતે કાબ્ય-કૂતિનો આભાસ આપી શકે. જેમકે-

આજે રાતે જો સૂર્ય ઊરે તો?
તારાઓ પંખી થઈને ઉડે
ને ટહુંકી ઉઠે,
આરમ્ભાયેલા સ્વભની
અર્ધા ભુંસાયેલી રેખા
આંખમાં રહી જાય...

- ને એમ આગળ. આશ્ર્યની વાત એ છે કે સુરેશભાઈની અખજાહેરી કવિશક્તિ એમનાં પોતાનાં કાચ્ચો કરતાંય વધુ આ નિબંધોમાં ઊતરી છે. કાવ્યકાર સુરેશ જોખી કરતાં નિબંધકાર સુરેશ જોખી વધુ પ્રભાવક ને આકર્ષક લાગે છે.

કેટલાક નિબંધો તો કવિતા, વાર્તા ને નિબંધનું સંયોજિત રૂપ સરજે છે. મધુમાલતી વિશેનો ('જનાન્તિકે'માંનો) નિબંધ એનું એક આલ્ફાદક દણ્ઠાંત છે. 'મધુમાલતીની ગભરુ કળીને દુઃખ્યન આવ્યુ' - એમ વાતરીનિથી એનો આરંભ થાય છે. પછી કળી, પવન, શેખનાગ, દેડકો, સૂરજ... એવાં બાળવાતાનાં પાત્રો વચ્ચેના સંવાદોથી આ કાવ્યસંદર્ભ વાર્તા આગળ વધતી રહે છે ને એક નોખું નિબંધરૂપ સરજે છે, ને સર્જનાત્મક ગદનું એક આસ્વાધ રૂપ બંધાય છે.

કૃતિનો આસ્વાદ કે પરિચય-સમીક્ષા નિબંધના સૂરમાં કેવી રીતે પલટાય એનું એક સરસ દણ્ઠાંત એરિકા-રિલ્કે વચ્ચેના પદ્ય-પત્રોનો આસ્વાદ કરાવતો - પચીસેક પાનામાં વિસ્તરતો નિબંધ છે. 'હમણાં પ્રેમપત્રો વાંચું છું - લોકોની નજરથી બચાવીને. વિદ્યધતાનું ગૌરવ ઉપાડવા જેટલું ભારજલું માસું કાહું જ નથી' ('જનાન્તિકે') - એવો કુતૂહલ-જનક આરંભ વાચકને અંદર બેચી લે છે ને પછી આ પ્રવાહી સમીક્ષા અનેક ઉદ્ઘરણો ને સંદર્ભોમાંથી પસાર કરીને વાચકને તૃપ્ત કરે છે. રવીન્દ્રનાથે 'શાકુન્તલ' વિશે લખેલો આવો જ સમીક્ષારૂપ આસ્વાધ નિબંધ આપણાને યાદ આવી જાય છે.

રવીન્દ્રનાથની જેમ જ સુરેશ જોખીએ આપણાને આ નિબંધોમાં, વિસ્મયપોષક એવા નવા શર્ધો ને નવાં શબ્દસંયોજનો આપ્યાં છે. 'આતપસેવાનની ઝતુ', 'નિઃઉષ્ણ સૂર્ય', 'ખંધું મરણ', 'પવનનો પ્લવંગમ લય', 'કોમિયમ લેટેડ સૌજન્ય', વગેરે. આ રીતે બંધાતી સુરેશભાઈની સર્જકશીલી પણ એક વિશેષ સ્વાદ આપે છે.

સર્જકોની કેટલીક કાવ્યપણીઓ કે નિબંધો/વાતાઓથી કેટલીક ઉક્તિઓ, સ્મૃતિમાં જડાઈ જાય એવી અવતરણક્ષમતા ધરાવતી હોય છે. એમાંની કેટલીક શાણપણા-સૂત્રો જેવી પણ હોઈ શકે ને કેટલીક મમળાવવાનું મન થાય એવી સ્વાધ પણ હોઈ શકે. સુરેશ જોખીના નિબંધોમાં કેટલીક અવતરણ-ક્ષમ ઉક્તિઓ ઊપરી આવે છે એ બહુ લાક્ષણિક રીતે સ્મરણીય બને એવી છે :

- સૂર્યચંદ્રને અસ્તોદય છે, પણ આંખ કદી અસ્ત પામતી નથી. બહારથી બિડાય છે તો અંદરથી ખૂલે છે. (અહો બત કિમાશ્રયમ્)

- માનવી આનંદ શ્વસીને જીવતો નથી, ભય શ્વસીને જીવે છે. (ઇદમ્ સર્વમ્)

- ઊપરી આવેલી પુષ્ટાની ધૂષ્ટા શું દણિનો વિષય છે? (જનાન્તિકે)

- જગત સાથે અનુસ્યૂત થઈને જીવી નહીં શરૂ તો જગન્નાથ કોણ છે તેની મને ખબર જ શી રીતે પડે? (ઇદમ્ સર્વમ્)

સુરેશ જોખીના નિબંધોનો કલ્યાણ-ખચિત ગદઘરવાહ વેગ અને તેજનો અનુભવ કરાવે છે, એની સાથે એ અનાયાસ-લીલયા-પ્રગટ થયેલો પણ અનુભવાય છે. અલબત્ત, ક્યાંક સર્જકક્રમની કારીગરી(કાફટ) પણ દેખાય. પ્રારંભના નિબંધોમાં જે લવચિકતા છે તે પાછળના નિબંધોમાં ક્યારેક બરડ થયેલી પણ જણાય છે. કલ્યાણાશક્તિ એમની એવી

પ્રબળ છે કે એમને કાયમ નવાં કલ્યાણો મળ્યાં છે પણ એમની શૈલીએ જાણે કે કિનારા આંકી લીધા છે - એની વચ્ચેનો જે જળપ્રવાહ સહજ હતો એ વખત જતાં, જાણે ઉપરવાસથી છોડેલા પાણીના કૃત્રિમ પ્રવાહ જેવો ધક્કેલાયેલો પણ લાગે છે. સુરેશભાઈના નિબંધો જુદેજુદે સમયે અનેકવાર વાંચનાર વાચકને પણ ક્યારેક એકવિધતાનો અનુભવ કરાવે છે. એ એકવિધતા સૂરની એકવિધતા છે. એમની સર્જકતાનો મંત્ર લય પણ જાણે કે એકસૂરિયો થઈ જાય છે. સુરેશભાઈએ જ એક નિબંધમાં કહ્યું છે કે, ‘હવે બધી વસ્તુઓ પર વાપરના ડાખ પડી ગયા છે’ (અહો બત કિમાશ્વર્યમ્ભ) - એમ એમનામાં પણ - બીજા ઘણા લેખકોને એમણે સ્વાનુકરણનો ઠપકો આપ્યો છે એવી - નિયોવાઈ ગયેલી એકવિધતા આવી ગઈ છે.

અને એટલે જ, સુરેશ જોખી પદ્ધીના જે અનુ-સર્જકોએ સુરેશ-શૈલી અપનાવી એમનું લેખન કૃપણ પુરવાર થયું છે. (જે આ શૈલીમાંથી નીકળી ગયા કે જેમની પોતાની અલગ મુદ્રા ઊપરસી એમણે જ ગુજરાતી નિબંધને, સુરેશ જોખી પદ્ધી પણ, એક ડગલું આગળ વધારવાનું કર્યું છે). સુરેશભાઈનો કલ્યાણ-છલકતો પ્રકૃતિરાગ અનુકરણ કરનારાઓમાં પ્રકૃતિરાગડા રૂપે સંભળાય છે. ઉત્તમ સર્જકના પેંગડામાં પગ ઘાલવા માટે પણ કંઈક તુલ્યબળ સર્જકશક્તિ જોઈએ. સુરેશ જોખી જેવા સર્જકને જ ક્યારેક ‘ટાગોરવેડા’ કરવાનું પાલવે; નબળા સર્જકોએ કરેલા ‘સુરેશવેડા’એ કાલિદાસે ‘રધુવંશ’માં કહ્યું છે એમ ‘મન્દ: કવિયશ:માર્થા ગમિષ્યામિ ઉપહાસ્યતામ્ભ’ જેવી સ્થિતિ સરજી છે.

પરંતુ આ બાબત એક વાત તો સિદ્ધ કરે જ છે કે, સુરેશ જોખીના સર્જકનિબંધોનું તત્કાળે તો એક અમોદ કહેવાય એવું આકર્ષણ હતું. એ નિબંધોએ અનેક સમકાળીન અને અનુકાળીન રસિકો ને સર્જકીની રૂચિને પોખી છે ને પ્રહુલિત કરી છે. એમણે આપણને કલ્યાણ કરતાં ને કલ્યાણને માણસાં શીખયું. એટલે બને કે, બુદ્ધદેવ બસુની પેઢીના કિશોર-યુવા વાચકો-સર્જકો રવીન્દ્રનાથે ‘સંવેદન-સંપન્ન’ બનાવ્યા એવું સુરેશ જોખીના વાચકો અંગે પણ જરૂર કહી શકાય.*

દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી (સુરત)ના ગુજરાતી વિભાગે યોજેલા ‘સુરેશ જોખી શતાબ્દી મહોત્સવ’માં ૧૬મી માર્ચ, ૨૦૨૧એ કરેલું વક્તવ્ય.



સાભાર સ્વીકાર

વિવેચન

અનુબંધ : દક્ષા વ્યાસ, ૨૦૧૮, કોટ વ્યારા, પૃ. ૧૮૨, રૂ. ૨૫૦. **અનુશાસ :** પ્રવીણ દરજ, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૧૯૬૮, રૂ. ૧૫૫. **સાહિત્ય સમ્પર્ક :** રાધેશ્યામ શર્મા, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ.

વक्तव्य

भारतीय शास्त्रीय नृत्योना परिप्रेक्ष्यमां नृत्यांगना चंद्रलेखानु समकालीन नृत्यमां योगदान

सुनील कोहारी

(गतांकथी चालू)

ઉद्यशंकर पट्टीना वर्षोमां भारतीय नृत्योनो चितार

‘संगीत नाटक अकादमी’नी स्थापना पट्टी अने रुक्मिणीटीवीना कलाक्षेत्र, कवि वर्जनतोणना ‘केरળ कलामंडळम्’, कथक केन्द्र, आंध्रना कुचीपुरी गामे ‘सिद्धेन्द्र कलाक्षेत्र’, ओडीशामां ओडीस्सी नृत्यना शिक्षण माटे ‘उत्कल संगीत महाविद्यालय’, ऐम अनेक संस्थाओमां नृत्य शिक्षण व्यवस्थित रीते आपवानी जोगवाई करवामां आवी.

भरतनाट्यम् भीजा तेजस्वी कणाकारोमां बालासरस्वती, रुक्मिणीटीवीना समकालीन अनुग्रामी कणाकारोमां शांता राव, रामगोपाल, चंद्रलेखा, मृणालिनी साराभाई, ईद्राणी रहमान, कलानिधि नारायण, वैजयंतिमाला, कमला लक्ष्मण, यामिनी कृष्णमूर्ति, सी. वी. चंद्रशेखर, अंजलि मेढ, धनन्‌जयन वगेरे कलाकारो ए पोतपोतानी संस्थाओ स्थापी भरतनाट्यम् नृत्यनु शिक्षण आपवुं शड कर्युः मद्रासमां परंपरागत गुरुओमां रामेया पील्हे, ऐस. डे. राजरत्नम् पील्हे, मुंबईमां कुप्पीआ पील्हे तेमना पुत्रो महालिंगम् पील्हे, कल्याण सुंदरम् पील्हे, जमाई गोविंदराज पील्हे, पार्वतीकुमार वगेरे गुरुओ ए पोतानी संस्थाओमां गुरु शिष्य परंपरा अनुसार नृत्य शिक्षण आपवुं शड कर्यु. अने एक आधीय नवी पेढी नृत्यकारोनी उल्ली थर्थ.

कथकमां अमदावादमां कुमुटिनी लाखीयाए, पूनामां रोहिणी भाटे अने तेमनी शिष्याओ ए, मुंबईमां सिताराटेवी, लक्ष्मी महाराज, गौरीशंकर आदि नृत्यकार अने गुरुओ ए पोतानी संस्थाओ स्थापी. मणिपुरीमां पश अन्य गुरुओ ए तेमना वर्गो शड कर्यु. गुरु बिपीनसीध अने जवेरीबेनो ए मुंबई, कलकत्ता तथा ईम्फालमां शास्त्रीय अंशो पर भार दृष्टि भिष्णुपुरी शीखववानुं शड कर्यु.

समस्त भारतमां ’६०, ’७०, ’८०ना दायकाओमां शास्त्रीय नृत्यो अत्यंत लोकप्रिय थया. अनेक प्रतिभासंपन्न कणाकारोना कार्यकमो मोटा शहेरोमां नियमित योजवा लाग्या.

आ बहुं ज्यारे विकास पामतुं हठतुं त्यारे ऐनी समांतर दिशामां केटलाक कणाकारो शास्त्रीय शैलीमां पारंगत थया पट्टी समसामयिक प्रसंगो, घटनाओ नृत्यमां २४२ करवा, नवी दिशा शोधवा मथामण करी रक्षा ठता. तेमां ग्रमुख ठता मृणालिनी

સારાભાઈ, કુમુદિની લાખીયા, ચંદ્રલેખા, કોલકતામાં મંજુશ્રી ચાડી સરકાર, મુંબઈમાં આસ્તાદ ટેબુ અને ઉત્તરા આશા કુર્લાવાલા.

બે મહાત્માની ઘટના લક્ષમાં લેવી જરૂરી છે. શાસ્ત્રીય નૃત્યોમાં નાટ્યશાસ્ત્ર અનુસાર રસસિદ્ધાંતની જે વાત જોવા મળે છે તેને આઠેય શાસ્ત્રીય શૈલીઓ અનુસરે છે. શાસ્ત્રીય નૃત્યોની કથાવસ્તુઓના મૂળ ધર્મમાં જોવા મળે છે. પૌરાણિક કથાવસ્તુઓ, રામાયણ, મહાભારતમાંથી પ્રસંગોને આધારે નૃત્ય સંયોજનો અને પ્રાદેશિક શાસ્ત્રીય સંગીતને અનુરૂપ નૃત્યો રજૂ થાય છે. તમીણ, તેલુગુ, મલયાલમ, સંસ્કૃત, આસામી, ઓଡિયા, મૈતેઈ ભાષાના સાહિત્યના કાવ્યો અને રચનાઓને આધારે નૃત્યો રજૂ થાય છે.

શાસ્ત્રીય નૃત્યોનો આનંદ લેવા, માણવા દર્શકોના પક્ષે કેટલીક સજ્જતા અપેક્ષિત હોય છે. ટેક્નિકની સમજ, ભાષાની સમજ, સંગીતની રૂચિ અને તે - તે પ્રદેશની કથાઓ, તેના રૂપાંતરો વગેરેની અભિજ્ઞાતા હોવી જરૂરી છે. જોકે વર્તમાન સમયમાં નૃત્યકારો નૃત્ય રજૂ કરતા પૂર્વે કથાવસ્તુને અંગ્રેજીમાં સંક્ષિપ્ત રીતે સમજાવે છે અને સપ્રયોગ રજૂ કરે છે, જેથી દર્શકો તે રજૂ થનાર આઈટમ સમજી શકે. તેમ છતાં શાસ્ત્રીય નૃત્યો સામાન્ય પ્રેક્ષકો માટે દુર્ભોધ રહે છે. તેમાંથી જેને સંચારીભાવ કહેવામાં આવે છે તેનો વિનિયોગ કથાવસ્તુના વિસ્તાર માટે નર્તક કરે છે ત્યારે જો હસ્તમુક્રા, મુખજીબિન્ય દ્વારા તે ન સમજાય તો દર્શક મુંગાય છે. વિદુષી ડો. કપિલા વાત્સયાયને ટૂંકમાં આ વાત આ મુજબ રજૂ કરી છે :

સૌંદર્યાદ્યમક આનંદ શાસ્ત્રીય નૃત્યો જોતાં પ્રેક્ષક માણે તે માટે એક પ્રકારની સજ્જતાની અપેક્ષા રહે છે. નૃત્યકાર અને દર્શક બન્નેની સજ્જતામાં મોટો ફરક અને અંતર જોવા મળે છે. શાસ્ત્રીય નૃત્યના સૌંદર્યાદ્યમક પક્ષની સમજ નર્તકને હોય છે તેટલી દર્શકને નથી હોતી. એકાદ્યક અપવાદરૂપે કોઈ દર્શકમાં તેવી સજ્જતા હોઈ શકે. નૃત્યમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ નર્તક કરે છે. સંગીત, તાલ, લય, છંદને આધારે નૃત્યમાં પ્રવેશ કરવો રહે. તે પરંપરાગત રીતે પ્રાપ્ત થાય છે. મોટા ભાગના પ્રેક્ષકોને તે પ્રાપ્ત કરવાની સુવિધા હોતી નથી. સંગીત દ્વારા સમયમાં અને અવકાશમાં શિલ્પસંદર્ભ નૃત્યનું સર્જન થાય છે. અને કળાકાર તે અવકાશમાં પાત્રનું સર્જન કરે છે પરંતુ દર્શક તે પાત્ર સાથે પોતાને સરખાવી કે ઓળખી શકતો નથી. એટલે આ અંતરને કારણે શાસ્ત્રીય નૃત્યો દુર્ભોધ બને છે.

બીજું એક કારણ એ છે કે જે વર્ગ વર્તમાન સમયમાં નૃત્ય શીખે છે તે વર્ગ પરંપરાગત નર્તકોના વર્ગથી ભિન્ન છે. બન્ને વચ્ચે સામાજિક, રાજકીય, અભ્યાસ વગેરેની દિલ્લિએ મોટું અંતર છે. આ પેઢીએ વિદ્વાન ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું શરૂ કર્યું છે, કારણ એ ટેક્નિકને ગુમાવવી પાલવે તેમ નથી. એટલે ટેક્નિકને તો સિદ્ધાંત કરવી રહી જ. પરંતુ સમસામયિક સંવેદનાને કારણે ઘણા કળાકારો નૃત્યમાં જે પ્રકારે નાયિકાનું નિરૂપણ થાય છે તેનો સ્વીકાર કરી શક્યા નથી. શાસ્ત્રમાં જે રીતે પૌરાણિક કથાવસ્તુની નાયિકાની રજૂઆત થાય છે તે નાયિકા જોકે પોતાને આ પેઢીની સજીવા નર્તકીઓ સરખાવી શકતી નથી અને તેવા નિરૂપણમાં તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. એક પ્રકારની સભાનતા

તો જરૂર કેળવાઈ છે કે આ કળા ઘણી મૂલ્યવાન છે, પરંતુ તેની બૌદ્ધિક ભૂમિકાએ પણ ચર્ચા થવી જોઈએ તેવો આગ્રહ નવી પેઢીએ સેવો છે.

ભરતનાટ્યમું નૃત્ય પ્રકારનો દાખલો લઈએ તો નૃત્યની કથાવસ્તુમાં નાયિકા નાયકની રાહ જોયા કરે, વિરહમાં તે કૂશ થાય, ખાવામાં રૂચિ રહે નહિ, ચંદ્રના ડિરણો તેને બાળે, કામદેવના પાંચ પુષ્પ શરો તેને વિધે અને તેને કશું ગમે નહિ, અને નાયકની રાહ જોવામાં તે વેદનાને વ્યક્ત કરે તેવું નિરૂપણ કેટલીક નૃત્યાંગનાઓને રૂચ્યું નહિ. અલબજ્ઞ જે નિસર્ગદિત મહાન ભરતનાટ્યમું કળાકાર હોય છે તે ભક્તિ અને આધ્યાત્મિક સંદર્શો ભાવપૂર્વક નૃત્ય દ્વારા રજૂ કરી શકે છે. પરંતુ આ સાથે વિચારવંત કળાકારો વિષયવસ્તુમાં ફેરફર રહ્યા છે. વાસ્તવમાં ભરતનાટ્યમું નૃત્યની અત્યધિક લોકપ્રિયતાથી અસંખ્ય સાધારણ વ્યક્તિઓ આ નૃત્ય શીખે છે અને તેને કારણે તેનું ધોરણ નીચું થયું છે. સમસામયિક સંવેદના ધરાવતી નર્તકીઓ વિષયવસ્તુમાં ફરક લાવવા મંદે છે.

આપણી નૃત્યપરંપરાઓમાં જેને આપણે અમૂર્ત abstract કહીએ છીએ તેવા વિષયવસ્તુને પણ રજૂ કરી શકાય છે. નાયક-નાયિકાના કથા વસ્તુને સ્થાને અમૂર્ત વિષયવસ્તુને રજૂ કરી નવી દિશા શોધવાનો પ્રયત્ન કેટલીક નૃત્યાંગનાએ કર્યો છે.

એ દિશામાં મૃષાલિની સારાભાઈએ ભરતનાટ્યમું શૈલીમાં દહેજના સામાજિક દૂષણના પ્રશ્નને વણી લીધો છે, સાચુ સસરા અને નંણાં વગેરે, નવી પરણેતરના માંબાપ દહેજ ન આપી શક્યા હોવાથી તેને પીડા આપે છે, અને અંતે નવી પરણેતર ગ્રાસીને આપધાત કરે છે. આવી સામાજિક અન્યાયની વાત તેમણે ભરતનાટ્યમું નૃત્યમાં રજૂ કરી છે. આજે તો ‘ફેમિનિસ્ટ’ શબ્દ પ્રચલિત બન્યો છે અને તે માન્યતાને લક્ષમાં રાખી સ્વી પ્રતિ થતા અન્યાય અવહેલનાનું નૃત્યમાં નિરૂપણ જોવા મળે છે. મૃષાલિનીના પુની ભાવિકા સારાભાઈએ દહેજપ્રથાને કારણે કેરળમાં ચાર યુવાન કન્યાઓએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો હતો તે ઘટના નૃત્યમાં રજૂ કરી છે.

૧૯૮૮ની ઐતિહાસિક ઈસ્ટ વેસ્ટ ડાન્સ એન્કાઉન્ટર East-West-Dance Encounter conference.

ઉપર ઉત્ખેખ કર્યો છે તે દહેજ વિષયની મૃષાલિની સારાભાઈએ નૃત્ય સંયોજના ઈસ્ટ વેસ્ટ ડાન્સ એન્કાઉન્ટરમાં રજૂ કરી હતી. મેક્સામ્યુલર ભવનના જર્મન ડાયરેક્ટર ગીઓર્ગ લેકનરે મુંબઈમાં NCPAના સંયુક્ત તત્ત્વાવધાનમાં ‘સંગીતનાટક અકાદમી’ની સહાયથી આ કોન્ફરન્સ યોજી હતી. તેમનો ઉદ્દેશ ભારતીય નૃત્યોમાં આધુનિક નૃત્યો અને તેમાં સમસામયિક વિષયોને શા માટે રજૂ કરવામાં નથી આવતા તે પ્રત્યે ધ્યાન દોરવાનો હતો. જર્મનીથી સુઝાન લેંગર નામે જાણીતા નર્તકી, બીજા નર્તક ગેરહાર્ડ બોનર, ન્યુયોર્કથી કારમેન દલાવાદ, લંડનના ફિસ્ટિવલ ઓફ બેલેના સ્ટેફાન લોંગ, કેનેડાના એન મારી ગાસ્ટોન, રશ્યાન સંગીતકાર ઠિગોર વાખેવીય, ફાન્સના એન્ટ્રીએન બેલ, ઈટલીના પેટ્રીઝિયા સેરોની વગેરે કળાકારોને નિમંત્રવામાં આવ્યા હતા.

જ્યારે ભારતથી મૃષાલિની સારાભાઈ, કુમુદિની લાખીયા, ચંદ્રલેખા, યામિની પરબ ફેઅમિલ, 2021

કૃષ્ણમૂર્તિ, સોનલ માનસીધ, લંડનથી ચિત્રા સુંદરમ્ભ, શિકાગોથી અવન્તી મેહુરી, ઓડીશાથી ઈટાલીયન નર્તકી ઈલીયાના ચીટારીસ્તી, દિલહીથી અમેરિકન શેરન લોવેન (બન્ને ભારતમાં સ્થાઈ થઈ ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસે ઓડીસ્સી શીખતી હતી), મુંબઈથી રીતાદેવી, ઉત્તરા આશાકુલાવાલા અને આસ્તાદ દેબુ, પૂનાથી સુચેતા ભીડી ચાપેકર, દિલહીથી યામિની સાથે નરેન્દ્ર શર્માનો યુવાન પુત્ર ભરત શર્મા, વિવેચકોમાં સુનીલ કોઠારી, શાંતા સર્બજીત સિંહ, ચિત્રકારોમાં દશરથ પેટેલ, ફોટોગ્રાફર અને પ્રકાશ સંયોજક ચંદ્રલેખાના સહાયક સદાનંદ મેનન, યુવાન નર્તકોમાં મુંબઈના રોહિંટન કામા અને સ્થાનિક નૃત્યરસિકો, કલાકારોમાં સત્યવતી, શિરીન વર્જીફિદાર, લંડનથી મુંબઈ પ્રવાસે આવેલ દંતકથાના પાત્ર જેવી ક્રિતિ રણનાર રામગોપાલ વગેરે આ કોન્ફરન્સમાં ઉપસ્થિત હતા.

NCPAના ડાયરેક્ટર અને ટ્રસ્ટી જમશેદ ભાભાએ અને સંગીત નાટક અકાદમીના ચેરમેન ડૉ. નારાયણ મેનને ચર્ચામાં ભાગ લીધો હતો. કેટલાક કલાકારોએ સપ્રયોગ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાત્રે ફેસ્ટિવલમાં મૃષાલિની સારાભાઈ, કુમુદિની લાખીયા, યામિની કૃષ્ણમૂર્તિ, ચંદ્રલેખા, સુઝાન લેંગર, ગેરહાર્ડ બોનર, ઈલિયાના ચીટારીસ્તી, આસ્તાદ દેબુ, ઉત્તરા આશા કુલાવાલા, સોનલ માનસીધ, ચિત્રા સુંદરમ્ભ, સુચેતા ભીડી ચાપેકર વગેરેએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. આ કોન્ફરન્સમાં મૃષાલિની સારાભાઈનું memory દહેજ કથાનકવાળું, કુમુદિનીનું અતહકીમી?, આંગ્રીકા નામે ચંદ્રલેખાનું નૃત્યન સર્જનાત્મક કામ, આસ્તાદ દેબુનું એક કારકુનના જીવનની જલકવાળું, ઈલિયાના ચીટારીસ્તીનું Narcissus and Echo મયૂરબંજ શૈલીમાં અને ઉત્તરા આશા કુલાવાલાનું ઈગોર વાખેવીચના સંગીતવાળું Winds of Shiva દ્વારા આ કળાકારો કરી નવી દિશામાં રચનાઓ કરે છે તે પરત્વે સૌનું ધ્યાન દોર્યું હતું.

ડૉ. લેકનરે ભીજા વિશ્વયુદ્ધ પછી સમસ્ત વિશ્વમાં આવેલી યુદ્ધ વિશ્યક વિનાશની જાગૃકતા અને તેના વિશેની સજ્ગનતા પદ્ધિમના કળાકારોના નૃત્યમાં અનેક રૂપે પ્રગટ થતી જણાય છે, તેની વાત કરી હતી. અને ભારતમાં શાસ્ત્રીય નૃત્યપરંપરાઓમાં કશી સમસામયિક આવી ઘટનાના અભાવ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ડૉ. મેનને ભારતીય નૃત્ય અને સંગીત પરંપરામાં form અને content વિશે વાત કરી એવું જણાવેલું કે એ બન્નેનો બેદ પદ્ધિમની વિચાર ધારણામાંથી આવેલો છે. ડૉ. લેકનરે જણાયું કે ભરતનાટ્યમ્ભુત્માં દહેજ અને આપણાતનું કથાનક લેવામાં આવેલું તે આપણે મૃષાલિની સારાભાઈનો નૃત્યસંયોજનામાં જોયું. તે પરંપરાગત રાધાકૃષ્ણના વિષયવસ્તુથી અલગ છે અને સમસામયિક પ્રશ્નને નૃત્ય દ્વારા વણી લે છે. તો તેમાં ભરતનાટ્યમ્ભ શું form તોડીને નવું કાર્ય કરીએ છીએ તેવું કહી શકાય?

ચંદ્રલેખાએ જણાયું કે આપણી પરંપરામાં કેટલાક મૂળભૂત શબ્દો keywords છે, જે આપણા નૃત્યના અવકાશ અને સંભાવનાઓને વ્યક્ત કરે છે. આપણે મંડલા જેવા keywordsને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જે સમસ્ત વિશ્વ, ફિલસ્ફોઝી, આર્કિટેક્ચર, ચિત્રકણા, શિલ્પકણા, નૃત્ય અને શરીરના સંદર્ભ જોઈ શકાય છે. આપણે રસની વાત

કરીએ છીએ. આપણે નૃત્ય આપણને સ્પર્શ્યુ તે વિશે વાત કરીએ છીએ. માત્ર તે excellent છે તેવું નથી કહેતા. જમશેદ ભાભાએ સમર્થનમાં જણાવ્યું કે પ્રત્યેક કળા આપણી સંવિનિને વિકસાવે અને આપણા નવા અનુભવો દ્વારા પ્રગટીકરણ પામે તે આવકાર્ય છે. સંગીતનો અનુવાદ સંગીત જ હોઈ શકે. તેમ નૃત્યને આપણે શબ્દબદ્ધ ન કરી શકીએ પણ નવતર પ્રયોગોને પામી શકીએ.

ચંદ્રલેખા અને તેની નૃત્ય રચનાઓ (choreographic works)

East West Dance Encounterમાં ભાગ લેવા ચંદ્રલેખા આવી તારપૂર્વે તે બારેક વર્ષથી નૃત્યક્ષેત્રથી દૂર રહી હતી. પરંપરાગત શાસ્કીય ભરતનાટ્યમૂં નૃત્યનું શિક્ષણ તેણે મદ્રાસમાં કંઞ્ચિતરમ્ના વિષ્યાત ગુરુ એલાપ્પા પીલ્વૈ પાસે લીધું હતું. તેઓ બાલાસરસ્વતીને નૃત્યમાં સંગીત આપતા. તેમનું નહૃવાંગમૂં, નૃત્યમાં સંગત કરવાની પદ્ધતિ, નૃત્યોને ઉઠાવ આપતી. ચંદ્રલેખા અને બાલાસરસ્વતી પરિણામે એલાપ્પા પીલ્વૈને કારણે ગાઢ મિત્રો બન્યા હતા.

પરંતુ ચંદ્રાની મથામજા ભરતનાટ્યમ્ના ‘માર્ગમૂ’ પ્રકારથી બિન્ન નવી દિશાઓની શોધ માટે હતી. ભરતનાટ્યમ્ના માર્ગમ્ભૂમાં કમાનુસારી અલારીપ્પુ, જતીસ્વરમૂ, શબ્દમૂ, વંશમૂ, અભિનય પદ્દો, તીલ્વાના અને શ્લોકમ્ભૂની રજૂઆત થાય છે. અનેક વર્ષ લગ્ની સાધના કર્યા પછી ભરતનાટ્યમ્ના કથાવસ્તુ નાયક-નાયિકાના નિરૂપણની એકવિધાતાથી તે કંઈક નવું અલગ કરવા મથ્યતી હતી. અને જ્યારે તેની કારકિર્દિમાં તે અન્ય સમવયી નૃત્યાંગનાઓની તુલનામાં ટોચ પર હતી, તારે તેણે નૃત્ય કરવું બંધ કર્યું અને મન અન્ય વિષયોમાં પરોવ્યું.

નડિયાદમાં ડો. પ્રભુદાસ પટેલને ત્યાં હઢી ડિસેમ્બર ૧૯૨૫માં તેનો જન્મ થયો હતો. બે બહેનો અને ત્રણ ભાઈ મળીને છ સંતાનોમાં તે સૌથી નાની હતી. પ્રભુદાસની અને ગંગામાની તે લાડકી પુરી હતી. પિતા તેને પુત્ર સમોવડી ગણતા. પ્રભુદાસ વ્યવસાયે ડોક્ટર હતા એટલે તેમની વારંવાર અનેક શહેરોમાં બદલી થતી. પ્રભુદાસ સાહિત્યના શોખીન હતા અને રાધ્રશાયર ઝેરચંદ મેધાણી અને અમૃતલાલ શેઠ જોડે તેમને સારો સંબંધ હતો. ચંદ્રા બારેક વર્ષની ઉભરે પિતાના પુસ્તક સંગ્રહમાંથી અનેક પુસ્તકો વાંચતી. આમ તેની સાહિત્યપ્રીતિ કેળવાઈ હતી. આ ઉપરાંત તેને ચિત્રકળાનો શોખ લાગ્યો. ચૌદેક વર્ષની વયે તે અંગ્રેજ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સાયકલ સવારી કરતી, ત્યારે સમવયી યુવકોને નવાઈ લાગતી. શાળાના અર્ધવાર્ષિક સામયિકની સંપાદિકા બની અને તેનો યુવકોએ વિરોધ કર્યો. પણ તે અવગાડી સંપાદન કામ પૂરું પાડેલું. આમ સાહિત્ય, ચિત્ર અને નૃત્ય ત્રણેય કળાઓમાં તે પારંગત થવા માગતી હતી.

૧૯૪૧માં તે નડિયાદની સરકારી હાઇસ્ક્યુલમાંથી મેટ્રિકમાં ઉત્તીર્ણ થઈ અને ૧૯૪૨માં વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરવા જોડાઈ. ૧૯૪૩માં કલાભવનમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો. ૧૯૪૪માં અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કોલેજમાં જોડાઈ. ત્યારે કોલેજના વાર્ષિકોત્સવમાં પ્રેમાભાઈ હોલમાં આશા-નિરાશા નામે નૃત્ય રજૂ કરેલું.

વરીલોએ લગ્ન માટે ગોઈવણ કરી ત્યારે તેણે ના પાડી. પરિણામે ઘરમાં કલેશ થયો. આ દરમિયાન પદ્ધતિસર નૃત્ય શીખવા તે આતુર હતી. અમદાવાદ છોડી તે મુંબઈ આવી અને લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા જોડાઈ. મુંબઈમાં નૃત્યની તાલીમની યોગ્ય વ્યવસ્થા ન થતાં કાયદાનો અભ્યાસ પડતો મૂકી તે મદ્રાસ આવી. ત્યાં તેનો પરમ મિત્ર દશરથ પટેલ અમદાવાદથી મદ્રાસમાં ચિત્રકણાનો અભ્યાસ કરવા આવ્યો હતો. વિષ્યાત કવિ હરીન્દ્રનાથ ચંદ્રોપાઠ્યાય, દશરથ અને ચંદ્રા સાથે રહેવા લાગ્યા. હરીન્દ્રનાથને સૌ બાબા નામે સંબોધતા. હરીન્દ્રનાથ કવિતાઓ રચે અને ચંદ્રાને સંભળાવે તે ચંદ્રા લખી લેતી. ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા પર તેણે સારું પ્રભુત્વ મેળવેલું. એણે અંગ્રેજી નાટકોના ગુજરાતી અનુવાદો કરવા શરૂ કરેલા. પરંતુ મુખ્યવે ચંદ્રા તેના પિતા સાથે સવારે ફરવા જતી અને વાંચેલા પુસ્તકોમાંથી ઉદ્ભબેલા સવાલોનો જવાબ માગતી ત્યારે પિતા તેને સમજાવતા. તે વિચાર સ્વાતંત્ર્ય ચંદ્રાના સ્વભાવનું અંગ બની ગયું હતું. તેણે ‘મનુસ્મૃતિ’ વાંચેલું અને તેમાં નારીની દશાનું જે નિરૂપણ તેણે જોયું હતું તે જોડે તે સંમત નહોતી થઈ. પછીના વર્ષોમાં નારીના સ્વાતંત્ર્યને ડામવાના મનુસ્મૃતિના કેટલાક અંશોનો ચંદ્રાએ વિરોધ કર્યો હતો. Patriarchy વિશેના તેના ખયાલો ઢંડ થયા હતા અને Patriarchy સ્ત્રીઓના સ્વાતંત્ર્યને હણે છે તે વિશે તેને કોઈ શંકા નહોતી.

હરીન્દ્રનાથ શાસ્ત્રીય સંગીત શીખેલા. પોતે ગાતા, જીતો રચતા, બંગાળી, હિંદી, ગુજરાતી, તેલુગુ અને અંગ્રેજી ભાષા પર તેમનું પ્રભુત્વ જાણીયું હતું. તેમના કટાક્ષપૂર્ણ કાલ્યો દ્વારા તેમણે અંધશ્રદ્ધાની ઢેકડી ઉડાવી છે. વિચારસ્વાતંત્રના હિમાયતી આ કવિના સંસ્કરણમાં ચંદ્રાનો બૌદ્ધિક વિકાસ થયો. હરીન્દ્રનાથ સાથે તે અનેક મીટિંગો, મેળાવડામાં જતી. મોટા કવિઓ, વિચારકોને મળતી અને તે લોકોના વાતર્લાપો દ્વારા ધંજું શીખતી. તે પોતે પણ કાલ્યો રચતી. ધર્મ, આસ્થા ઈત્યાદિ વિશે મૂળભૂત પાચાની ચર્ચાઓ થતી. હરીન્દ્રનાથનું વય પ૧ વર્ષનું હતું. જ્યારે ચંદ્રાનું ૧૭ વર્ષનું. બન્નેના અને દશરથ સાથે રહેવાને કારણે લોકોમાં તત્કાલીન રૂઢિયુસ્ત દક્ષિણ ભારતના સમાજમાં ગુસ્પાસ અને નિંદા થતી. લોકો એ સંબંધોને સ્વીકારી શક્યા નહોતા. પરંતુ હરીન્દ્રનાથ, ચંદ્રા કે દશરથ તેવી ટીકાઓની પરવા કર્યા વિના વિનાસંકોચે સાથે રહેતા હતા.

ચંદ્રાને હરીન્દ્રનાથ સાથે દેશવિદેશમાં સાથે પ્રવાસ કરવાની અનેક તકો મળી હતી. યુરોપ, રષીયા, ચીન વગેરેના પ્રવાસો દ્વારા તેણે વિશ્વની અન્ય સંસ્કૃતિઓ વિશે માનન્ભરી સમજૂતી કેળવી હતી.

ભરતનાટ્યમું નૃત્યમાં તાલીમ પૂરી થયા પછી રંગમંચ પ્રવેશના કાર્યક્રમને અરંગેત્રમું કહે છે. ચંદ્રાના અરંગેત્રમુનો કાર્યક્રમ રાયલસીમાના દુષ્કાળ માટે નાણા ઉઘરાવવાના કાર્યક્રમ સાથે જોડાયો હતો. તે પ્રસંગની વાત કરતા ચંદ્રા કહે છે : ‘એ અનુભવે નૃત્ય પરત્વેના મારા વલણને ધર્યું છે. એ કાર્યક્રમ રાયલસીમાના દુષ્કાળ માટે નાણા ઉઘરાવવા માટે યોજાયો હતો અને નૃત્ય કરતાં કરતાં હું ‘મથુરા નગરી લો’ પદ રજૂ કરતી હતી. યમુના નદીમાં સ્નાન કરતાં સખીઓ સાથે હું જળકિયામાં યમુના નદીના વિશાળ વારિનું વર્ણન કરતી હતી અને આકસ્મિક જ હું સંભિત થઈ ગઈ. હું દુકાળના પરિપ્રેક્ષયમાં આ

જળવિહારનું વર્ણન કરતી હતી અને મારી નજર સમક્ષ વર્તમાનપત્રોમાં છપાયેલા રાયલસીમા હુકાળ દરમિયાન હાથમાં પતરાના ઉભાઓ લઈ લાંબી કતારમાં પાણી લેવા ઊભેલા લોકોના ફોટા તરવરવા લાગ્યા. ગુરુ એલખ્યા મધુર કંઠે મથુરા નગરી લો ગાઈ રહ્યા હતા. તે પણે કણા અને જીવનનો વિરોધાભાસ જોઈ, એ પણે હું બે વ્યક્તિઓમાં વહેંચાઈ ગઈ. ક્યાં પાણીનો વૈભવ અને ક્યાં હુકાળની કારમી વાસ્તવિકતા.'

ત્યાર પછી વર્ષો લગી આ અનુભવ મારી સાથે સતત રહ્યો છે. એ વિરોધાભાસનો હું નિકાલ લાવી શકી નથી. ખરેખર એ વિરોધાભાસ આપણી સામાજિક પરિસ્થિતિનો છે. એક પક્ષે કથા પરત્વેની મારી સંવેદનાઓને હું ત્યજી દેવા માગતી નથી તો બીજે પક્ષે આવી કઠોર વાસ્તવિકતામાં કંઈ રીતે જીવંત રહેવું અને આવા કઠોર તત્વોમાં સકારાત્મક ઊર્જાને સંચિત કરી વિરોધાભાસને દૂર કરી જીવનમાં સામંજસ્ય કેમ લાવવું તે માટે હું સતત પ્રયત્નશીલ રહી છું.

ચંદ્ર માને છે કે નૃત્યક્ષેત્રે અન્ય કલા વિધાઓ સાથે નર્તકીઓએ સંવાદ કરવો જરૂરી છે. આપણે જો નૃત્યને સમસામયિક સમસ્યાનો હલ કરવા ઉઘત થવા માગતા હોઈએ તો આપણા સાંસ્કૃતિક કલાસ્વરૂપો આપણી શારીરિક અને માનસિક જડતાને દૂર કરે તેવા ગ્રયત્નો આપણે કરવા જોઈએ. નૃત્ય એ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

નૃત્યનો ઉદ્ગામ દૈવીકણા તરીકે થયો છે તેવું હું માનતી નથી. તેનો ઉત્તરોત્તર વિકાસ સંદીકોથી થતો આવ્યો છે. જીવનમાં નૃત્ય કંઈ રીતે સંવાદિતા સાથી શકે તે વિચારવું જોઈએ. કેટલાક નકારાત્મક અંશો હું જોઉં છું તે આપણે દૂર કરીએ તો નૃત્ય જીવનમાં ઊર્જા લાવી શકે. નૃત્યમાં અર્થહીન દેખાડો, જૂની સામાજિક માન્યતાઓ, કૂત્રિમ ધાર્મિક ભાવનાઓ, એક પ્રકારની ઋગ્વે લાગણીશીલતા, સાહિત્ય પર આધાર, વ્યવસાયિક બળો, અને અર્થહીન એકલનર્તન અને સ્પર્ધા. આ નકારાત્મક તત્ત્વોનો સામનો નૃત્યે કરવો રહ્યો.

સ્વાભાવિક છે કે નર્તકીને પ્રશ્નો પૂછવામાં આવે છે કે જગતમાં ઐતિહાસિક વૈજ્ઞાનિક, સામાજિક ઊથલાપાથલો થઈ રહી છે તે વિશે નૃત્ય કેમ કશો પ્રતિભાવ દર્શાવતું નથી? છેલ્લા પાંચ દાયકામાં વિશ્વમાં જે પરિવર્તનો થયા છે તે વિશે નૃત્યકારો કેમ વિચારતા નથી?

ડોઈ પણ વિચારવંત નર્તકીઓને આવા પ્રશ્નોનો સામનો કરવો પડે. તે વિચારતી કે દર્શક વર્ગ તેના નૃત્યને જુએ છે કે તેના દેખાવને? તે સમજ શકી હતી કે તેઓ તેને એક ચંચળ અને દેખાવડી સ્વી તરીકે જોતા હતા. તેમની નૃત્ય માણવાની પદ્ધતિ વિશે તેણે પ્રશ્નો ઉઠાવ્યા. દર્શક વર્ગમાં પુરુષોને શું જોવું ગમે છે? આ પ્રશ્નો દ્વારા પોતાની નૃત્યની કારકિર્દીને તે પડકારતી હતી. તે ભરતનાટ્યમું પ્રતિ વધુ ટીકાત્મક વલણ અપનાવી તેના સ્વરૂપને જોતી હતી. અલબત્ત બાલાસરસ્વતીની પરંપરાવાણું નૃત્ય તે શીખી હતી, પરંતુ તેમાં રહેલા સંપૂર્ણ ધાર્મિક તત્ત્વને તે સ્વીકારી શકતી નહોતી. કારણ તેની જીવનશૈલી બિન્ન પ્રકારની હતી. હિંદુ ધર્મની કેટલીક રૂઢિઓ જેમ કે લગ્ન અને પ્રજોત્પત્તિ, તેમાં તે પરબુ ફેઅમિલ, 2021

માનતી નહોતી. અને લગ્ન વિના સ્વતંત્રપણે તે જીવતી હતી. તેનો વૈશ્વિક સંસ્કૃતિ સાથેનો પરિચય સધન હતો. અજંતાના બિત્તિ ચિત્રો અને પિકાસોના ચિત્રો તેણે જોયા અને માઝા હતા. માર્કસની ડિલસુફી અને પંજાલિના યોગસૂત્ર, ઈજાડોરા ઉંકન અને બાલાસરસ્વતીના નૃત્યો, એમ તેની સજજતાનો વ્યાપ વિશાળ હતો. પરિણામે બાલાસરસ્વતી, પરંપરામાં જે રીતે સંકળાયેલી હતી, તે રીતે, ચંદ્રા સંકળાઈ નહોતી. તેની જીવનપદ્ધતિ આપણે જેને મોર્ડન કહીએ છીએ તેવી હતી.

પરિણામે ભારતીય પરંપરાના બે માર્ગો, વર્ષનાત્મક અને અમૃત - narrative અને abstract, તેમાં તે અમૃત તરફ વળી હતી. જો તે વર્ષનાત્મક માર્ગ તરફ જોતી તો તેના નિરૂપણમાં તે પુરુષોની male gazeની ટીકા કરતી, અથવા વિષયવસ્તુ પસંદગીમાં ભાસ્કરાચાર્યની લીલાવતીને તેના પિતા જે ગાણિતિક પ્રશ્નો પૂછતા તેને નૃત્યમાં રજૂ કરવા તે ઉદ્યુક્ત થતી.

તે સ્પષ્ટ આજાતી હતી કે નૃત્યમાં શું ના કરવું જોઈએ. 'પ૦ના ગાળાના છેલ્લા વર્ષોમાં ચંદ્રા એવા કથાનકની શોધમાં હતી જ્યાં ધર્મને secular thoughtમાં જોઈ શકાય, નહિ કે નૃત્યના મૂળ પાયા તરીકે.

૧૯૮૮માં ચંદ્રાએ તેની પહેલી નૃત્ય સંયોજના 'દેવદાસી' નામના કથાનકમાં પોજી. તેની રચનામાં તે ભરતનાટ્યમૂની ઉત્પત્તિ દેવી નથી તેવી ટીકા કરવા માગતી હતી. તે માનતી કે નૃત્ય ન તો મંદિરમાં, ન તો રાજકોરબારમાં કે ન તો એક ચોક્કસ દેશકાળમાં વસે છે. ભરતનાટ્યમનો નર્તકીના શરીર જોડે ગાઢ સંબંધ છે. દેવદાસી નૃત્ય રચનામાં ચંદ્રાએ પૌરાણિક કથાવસ્તુને બદલે ભરતનાટ્યમૂના વિકાસની વાત વર્ણી લીધી હતી. શરૂમાં મંદિરમાં તે રજૂ થતું તે માટે પુષ્પાંજલિની રજૂઆત કરેલી. પછી તાંજોરના રાજાની સુતિ અને પ્રસંગા માટે શુંગારમય વર્ણભૂ રજૂ કરેલું. પછી નર્તકીના સામાજિક દરજાની પડતી, સામાજિક બહિર્ભૂતિ, દેવદાસીના નૃત્ય વિષેનું Abolition Bill, અને વળી ભરતનાટ્યમૂની પુનઃ સ્થાપનાના ઊઠાના વર્ષોના પ્રયત્નો, એવી પટકથા વર્ણી તેની રજૂઆત કરેલી. અને જેમ ફિલ્મમાં flashbackનો ઉપયોગ થાય છે તેમ ચંદ્રાએ અમ્ભાપાલી અને સીલપદીકારમૂની નાયિકા માધવીના નૃત્યો રજૂ કરેલા. અંતે તીલ્લાના રજૂ કરેલું. તીલ્લાના દ્વારા શરીરમાં શક્તિનો જે સંચાર થાય છે તે આનંદની પળો સાથે રજૂ કરેલું. તેમાં ચંદ્રાની નિજની કોરીઓગ્રાફી જોવા મળે છે. ૧૯૮૪માં તે વીસેક વર્ષ પછી ફરી ચંદ્રાએ રજૂ કરેલું. જેમાં તેની કલ્યાણશક્તિ જોવા મળે છે. હવે તે you tube પર પણ ઉપલબ્ધ છે.

નવગ્રહા

ચંદ્રાનું મન એકલનર્તન પરથી સાવ ઊઠી ગયું હતું. '૭૧ના અરસામાં લંડનથી કામદેવ નામે ભરતનાટ્યમૂની નર્તક વધુ અભ્યાસ માટે મદ્રાસ આવ્યો હતો. તેણે ચંદ્રાનો સંપર્ક સાધ્યો હતો. ચંદ્રાએ એ અરસામાં યોગાસનમાંથી પ્રેરણા લઈ 'સુર્યમૂર્તે નમોસ્તુતે' નામની નાનકડી સર્જનાત્મક રચના કરી હતી. કામદેવ જોડે મળી તેણે એક duet તરીકે મુથુસ્વામી દીક્કિતારની નવગ્રહ સુતિની ભરતનાટ્યમૂના રચના કરી. પરંતુ તે સુતિના

ધાર્મિક પક્ષથી તદ્દન ભિન્ન હતી અને તે ઉપરાંત ભરતનાટ્યમુની ટેક્નિકમાં સાહિત્યને અનુરૂપ હસ્તાભિનયનો શબ્દશ: વિનિયોગ થાપ છે તેનાથી પણ તેનો અભિનય ભિન્ન હતો. માત્ર શ્લોક ગવાતો જાય છે અને ચંદ્રા અને કામદેવ નર્તન કરે છે. પુરુષ અને સ્ત્રી સન્મુખ રહી નૃત્ય કરે છે. તે બને વચ્ચેના પરસ્પરના દેહમાં રહેલા અંતરમાં રહેલ તણાવને તેમાં પ્રાધાન્ય આપવામાં આવેલું. શબ્દશ: ‘જપાકુસુમ સંકાશમુ’નું વર્ણન તેમાં અભિપ્રેત નહોતું.

વર્ષો પછી ૧૯૮૪ના અરસામાં બીજા આઠ કલાકારોને લઈને ચંદ્રાએ નવગ્રહાની પુનર્રચના કરી હતી. દક્ષિણ ભારતના મંહિરોમાં પ્રવેશ કર્યા પછી એક સ્થળે નવગ્રહોની પ્રતિજ્ઞા જોવા મળે છે. તે ચોરસ બાજુ જેવા આકારના ઓટલા પર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક, શનિ, રાહુ અને કેતુની મૂર્તિઓ વિવિધ દિશામાં ગોઠવેલી જેવા મળે છે. ચંદ્રાએ તેમાંથી પ્રેરણા લઈ નૃત્યસંગેજન કરેલું અને યોગાસન તથા ભરતનાટ્યમુની ટેક્નિકનો નવતર ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત નવગ્રહો વિશે વિશાદ અભ્યાસ કરી ચંદ્રાએ એર ઈન્ઝિયા માટે નવગ્રહાના રંગીન ક્લેન્ડરની રચના design કરેલી જેમાં vertical lineમાં સૂર્ય પછી કમવાર અન્ય ગ્રહોના ભૌમિક આકારના ચિત્રો મૂક્યા હતા. દરેક ગ્રહના રંગો, તેને લગતા વાર સોમ મંગળ કમ અનુસાર અને ગ્રહો વિશે સંલગ્ન રત્નો વિષે માહિતી મૂકી હતી. આમ નવગ્રહ multidisciplinary કાર્ય બન્યું હતું.

૧૯૬૦થી બીજા બાર વર્ષ ચંદ્રાએ માત્ર નવગ્રહાના એક show વિના નૃત્ય કરવાનું મૂકી અન્ય ક્ષેત્રમાં પોતાની સર્જનાત્મક શક્તિઓના વિકાસ માટે જંપલાયું હતું. એ દરમિયાન તેણે Haikus જાપાની કવિતા જેવા, કાવ્યો લખ્યા હતા. કમલા નામે મોટું ગવ કાબ્ય લખેલું. અનેક લેખો, વિવેચનો લખ્યા હતા. તેણે posters પણ design કર્યા હતા. દક્ષિણ ભારતમાં ધરના આંગણે દોરવામાં આવતી રંગોળી જેવી kolam તરીકે ઓળખાતી રચનાઓના અનેક ગાણિતિક રૂપોનો અભ્યાસ કર્યો અને રેખાંકનો કર્યા હતા. આ ઉપરાંત પ્રવાસો બેચ્યા અને જેને alternative sector કહે છે તે ક્ષેત્રમાં અનેક કળાકારોને મળી કામ કરવું શરૂ કર્યું. ઈજિપ્તમાં કેરો Cairo Museumની મુલાકાત લેતાં ત્યાં કોઈ કળાકાર પ્રદર્શન યોજતો હતો તેની સાથે મદદ કરવા જોડાઈ. આમ અનેક અજાણ્યા કળાકારોને મળતી જે પાછળથી તેના ઘનિષ્ઠ ભિત્રો બન્યા. અમેરિકા ગઈ તો ત્યાં વિખ્યાત કોરીઓગ્રાફર મર્સ કન્નિગહામના કાર્યક્રમ પ્રત્યે તેના સહાયક ડેવિડ કુપરને મળી, જેને ચંદ્રા તે નેશનલ ડિજાઇન ઇન્સ્ટિટ્યુટમાં અમદાવાદ આવ્યા ત્યારે મળી હતી. તેમણે સંગીતકાર John Cage જણોન કેર્જ જોડે પારિચય કરાવ્યો. ત્યારે Experiment in Art and Technology (EAT) શુપના કળાકારોને તે મળી. તેમણે ચંદ્રાના હસ્ત પર પોસ્ટર બનાવ્યા અને એક ફિલ્મ પણ બનાવી. નૃત્યને અન્ય માધ્યમોમાં કઈ રીતે કલાત્મક રીતે લઈ શકાય તે માટે ફિલ્મ દિણદર્શક કુમાર સહાની અને કેમેરામેન મહાજન સાથે ‘માયાર્પણ’ ફિલ્મમાં મધ્યરંભ છાઉના નૃત્યકારોના નૃત્યનું સંયોજન ચંદ્રાએ કર્યું હતું. આ દરમિયાન સદાનંદ મેનન નામે યુવાન જનરલિસ્ટ,

ફોટોગ્રાફર દશરથ અને ચંદ્રા જોડે જોડાયો અને તેમણે સૌઅએ skills નામે સંસ્થા સ્થાપી. ચંદ્રાના લખાણો ‘ધી ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’માં સદાનંદે વાંચેલા હતા. ચંદ્રા, દશરથ અને સદાનંદની વિચારધારાઓમાં ઘણું સાભ્ય હતું. પરિણામે સદાનંદ પણ તેમની સાથે રહેવા લાગ્યો. આ વર્ષોમાં ચંદ્રા અને સદાનંદ અનેક Marxist groups ને મળતા અને સરકારની અનેક નીતિઓનો વિરોધ કરતા. આ પ્રકારની political અભિજ્ઞા ચંદ્રાએ કેળવેલી. ૧૯૭૫માં જ્યારે emergency લાદવામાં આવી હતી. ત્યારે તેના વિરોધમાં ચંદ્રા પણ સામેલ થઈ હતી. Skillsના આશ્રયે લોકોને કઈ રીતે સરકારની બ્યૂરોકેટિક પદ્ધતિને બદલે --- સૃજનાત્મક કાર્યક્રમો દ્વારા મદદ કરી શકાય તેવી પ્રવૃત્તિમાં સદાનંદ, ચંદ્રા અને દશરથ વ્યસ્ત હતા.

આ દરમિયાન ઈમરજન્સી દૂર થઈ ત્યારે તમીણનાડું સરકારે Skillsની પ્રવૃત્તિઓ સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે તેવો આરોપ કરી સદાનંદ અને ચંદ્રાને આરોપી ઠરાવ્યા. અને ૧૯૮૮ના ઓગસ્ટમાં Skillsની પ્રવૃત્તિઓ દેશદોહી છે તે ૧૨૪A sectionના અન્વયે તેમના નિવાસસ્થાને ધાડ પાડી. તેમને પ્રત્યેક પખવાડીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો. પરંતુ અનેક ધારાશાખી ભિત્રોએ મદદ આવી બન્નેને નિર્દ્દિષ્ટ સાબિત કર્યા. આ તબક્કો ચંદ્રા માટે ઘણો અસ્ત્રી અને નિરાશાજનક હતો.

આ દશામાંથી ઉગરવા ચંદ્રાએ પુનઃ ભરતનાટ્યમું નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરી. સદાનંદ પત્રકાર તરીકે રાજકીય લોખો લખવા શરૂ કર્યા. ચંદ્રાએ નૃત્યની કાર્યશાળાઓ શરૂ કરી. Skills ઉપરાંત ૧૯૭૯માં ચંદ્રાએ સ્થાપેલ Cultural Centreના આશ્રયે તેના નવા નૃત્ય સંયોજન ‘ાંગિકા’નું સર્જન કર્યું. અને નૃત્યક્ષેત્રે તેણે પુનઃ પુનઃ પ્રવેશ કર્યો.

અન્ય સમવધી અને તત્કાલીન નૃત્યાંગનાઓના સંદર્ભમાં ચંદ્રાની કારકિર્દી ઘણી જુદી છે. ઉપરોક્ત અનુભવો પછી જ્યારે તેણે નૃત્યમાં નવસર્જનો કર્યા ત્યારે રૂઢિચુસ્ત પરંપરાવાદી વર્ગની ભભરો ઊંચે ચઢી ગઈ. ચંદ્રાએ નિર્મિક રીતે તેની નૃત્યસંયોજનાઓ કેટલીક યુવાન નર્તકીઓ સાથે આરંભી, યોગ ઉપરાંત કેરળની martiaal arts કલારીપાયહુનો તેણે અભ્યાસ કર્યો. નૃત્યમાં આ બન્ને પ્રકારની ઉજ્જ્ઞાનો સમન્વય કરી તેણે જે સર્જનો કર્યા તે લક્ષમાં લઈ મોડર્ન ડાન્સની પ્રણોતા તરીકે ચંદ્રાની ગણના થવા લાગી.

૧૯૮૪માં એલિયટ બીચ રોડ પર ચંદ્રાએ મંડલા નામે નાનુથી એટર બંધાવ્યું હતું, જે તેના ઘરના કભ્યાઉન્ડમાં હોવાથી ત્યાં નવા સર્જનો માટે રિહર્સલ કરી શકાય. દશરથ અને સદાનંદ મળીને તેના કલાત્મક પરંતુ functional બાંધકામની કાળજી રાખી હતી. કેરળના C.V.N. Kalari Sengaના કલારીપાયહુના કળાકારો અને નંદકુમાર નામે યોગમાં પ્રવીણ કળાકાર ઉપરાંત નગીન, શેખર, કલારીપાયહું કળાકારો મળી તે નૃત્યનું દળ ઊભું કર્યું. કલાક્ષેત્રમાંથી સુભિત્રા ત્યાં ગ્રેજ્યુઅશેન પૂરું કરી ચંદ્રા સાથે જોડાઈ. તેની સાથે બીજી ભરતનાટ્યમું નર્તકી સુજ્ઞતા જોડાઈ. પોંડીચેરીથી રઘુનાથ માને, અને કલાક્ષેત્રમાં અભ્યાસ કરતો શીખ કલાકાર નવતેજસીંહ જોહર પણ જોડાયા. ચંદ્રાની પડોશમાં જ રહેતી નાટ્યકાર ભાગીરથી નારાયણ અને બીજા કલાકારો ચંદ્રા જોડે મળી વિવિધ રૂપોની

ચર્ચા કરતા હતા.

આમ છ મહિના લગી સૌએ કાર્યશાળા તथા રિયાજ કર્યા પછી આંગિકાની ચંદ્રાએ સંયોજના કરી. આંગિકાની વિશિષ્ટતા તેમાં પ્રયોજેલા યોગાસનોના નૃત્યમાં જે રીત નિરૂપણ થાય છે તેમાં રહી હતી. આસનો માત્ર આસનો ન રહેતા શક્તિનો કેવી રીતે સંચાર શરીરમાં થાય છે તેના ઘોટક હતા. કેટલાક mythનો ઉપયોગ ગડુડાસન અને વૃક્ષાસન દ્વારા કરવામાં આવ્યો હતો. વચ્ચમાં કેન્દ્ર સ્થાને ચંદ્ર ‘નરવાહન’ની ભૂમિકામાં, જેમ દેવી દેવતાઓ સિંહ, વાધુ ઈત્યાદિ પશુઓનો આસન તરીકે ઉપયોગ કરે છે, તેમ પુરુષનો વાહન તરીકે ઉપયોગ કરી તેના પર સવાર થઈ હસ્તમુદ્રાઓનું નિરૂપણ કરે છે. એ ભૂમિકાવાળું ચિત્ર ચંદ્રની કલ્પનોથ શક્તિનું સુંદર ઉદાહરણ છે. નારીનું ઓજુસ અને પુરુષથી પણ ઊચેરી શક્તિ તરીકે એક વીરાંગના તરીકે તેની સ્થાપના તેમાં ઈંગિત હતી. જેમ ‘દેવદાસી’માં ઉત્તરોત્તર પુરુષના મનોરંજનનું સાધન બની, સીની જે અવદશ અંતે વેશયા તરીકે થાય છે, નર્તકીઓ વર્જામની રજૂઆત ચાજાઓના મનોરંજન માટે કરે છે, તે દ્વારા દર્શાવીને રજૂ કરેલું. પરંતુ અંતમાં પુરુષ નર્તકો અને નર્તકીઓની સામૂહિક શક્તિનું આનંદમય નર્તન તીલ્વાનામાં પરિણામે છે. તેમાં કલરીપાયહુના કેટલાક અંશો ભરતનાટ્યમ્ય નૃત્યના અંશો જોડે રજૂ કરી એક શક્તિમંત નૃત્ય સંયોજન રજૂ કરી. જ્યારે તે East West Dance Encounterમાં રજૂ થયું હતું, ત્યારે પ્રેક્ષકો દગ થઈ ગયા હતા. આ પૂર્વે અન્ય કોઈ કળાકારે ભરતનાટ્યમ્ય, યોગ અને કલરીપાયહુના આવા સુભેણથી કોઈ કૃતિ રજૂ કરી નહોતી. ચંદ્રની સમકાલીન મોહર્ન શૈલીના અંશો આ રચના દ્વારા પ્રારંભાયા હતા. તેની રજૂઆત ભારત વર્ષ ઉપરાંત યુરોપમાં અને વિશેષતઃ જર્મનીમાં ૧૯૮૨ના નૃત્યોત્સવમાં રજૂ થયા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નૃત્યજગતમાં આંગિકાએ ધ્યાન દોર્યું હતું. ભરતનાટ્યમ્યના મૂળ martial artsમાં રહ્યા છે. તેવું તેમાં સૂચન હતું અને તેના દેવી ઉદ્ગમને બદલે એક secular art-form તરીકે તેના ઉદ્ગમની હિમાયત કરતું હતું. નૃત્ય સમાલોચકોએ તેને સમકાલીન નૃત્યોમાંના એક મહત્વના સીમાચિહ્ન તરીકે બિરદાયું હતું.

ચંદ્રાની innovative નૃત્ય સર્જનો કરનાર choreographer તરીકે ખ્યાતિ પ્રસરવા માંડી હતી. જ્યારે રચિયામાં ભારત ઉત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે મણિપુર અને કેરળના નૃત્ય વૈભવને રચિયામાં રજૂ કરવા રતનથીયમ્ય અને કાવાલમ નારાયણ પણ્ણિનર બન્ને પ્રમુખ થીએટર ડાયરેક્ટરોને, ઉત્સવના સ્વરૂપ ઘડવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તે સ્વરૂપના નિર્માણમાં ચંદ્રલેખાને પણ દશરથ પટેલે નિમંત્રી હતી. ભારતની અનેકવિધ નૃત્યશૈલીઓની સંકલના, સંયોજના કરવાની તક ચંદ્રાએ જડ્યી લીધી હતી. ફિસ્ટેવલના ઉદ્ઘાટન માટે ચંદ્રાએ નમસ્કાર નામે નૃત્ય રચના કરી જેમાં કલરીપાયહુના નમસ્કાર પદ્ધતિનો ભરતનાટ્યમ્ય શૈલીમાં વિનિયોગ કરી ધરતી, આકાશ અને વિશ્વને નમસ્કાર કરવાનો ચંદ્રાએ સંકેત કર્યો. શરીરના ગૌરવને નમસ્કાર દ્વારા સ્થાપ્ય. ભારતના કે રચિયાના નેતાઓને પુષ્પહારથી વધાવવાને બદલે, નૃત્યની રચના દ્વારા રજૂ કરી ઉત્સવનું મહત્વ વધાર્યું.

રશિયાના ફેસ્ટિવલ પછી ચંદ્રો મહિનેનું નૃત્ય રચ્યું ભાસ્કરાચાર્યની લીલાવતીની રચનાને આધારે. માત્ર નાટક નાયિકાના શુંગારને સ્થાને ભરતનાટ્યમૂના કથાવસ્તુમાં તેજો નાવીન્ય આજ્ઞયું. લીલાવતી મોતી વયે એક પ્રમુખ ગણિતશાસી બની હતી. બાયવયમાં લીલાવતીને જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેની વરણી ચંદ્રાએ કરી અને તેમાં દશ્ય તત્ત્વ તરીકે ગણિત, ભૂમિતિના પ્રશ્નોને કેવી રીતે ભરતનાટ્યમૂની શૈલીમાં રજૂ કરી શકાય તેની નવીનતા નૃત્યસંયોજનામાં કરી.

પહેલો પ્રશ્ન : ‘અયે બાલે લીલાવતી! જો ૧/૩ કમળના પુષ્પો શિવને અર્પણ કરવાના હોય ૧/૫ વિષ્ણુને, ૧/૬ સૂર્યને અને ૧/૪ દેવીને, અને ગુરુને ચરણે બાકીના છ ધરવાના હોય તો, જરૂર જરૂર શીંગ કહે કે કુલ્લે કેટલા કમળપુષ્પો હશે?’

બીજો પ્રશ્ન પુષ્પો પર ઉડતા ભ્રમરો વિશે : ‘૧/૫ ભ્રમર કંદ્બ પર ૧/૩ શિલિંગ, બન્ને વચ્ચેની બાદબાકી નાણે ગુણીએ તો કુદુજ પુષ્પ પર, એક ભ્રમર એક પુષ્પથી બીજા પુષ્પ પર ઉડ્યા કરે છે, તો હે લીલાવતી કુલ્લે ભ્રમરની સંખ્યા કેટલી?’

ત્રીજો પ્રશ્ન હંસની સંખ્યા વિશે : ‘સંખ્યાના દસ ગણા જ્કવેર રૂટ હંસો માનસરોવર પર ઉડી ગયા હોય, ૧/૮ કમળ સરોવર તરફ, બાકીના બચ્ચા તે ત જોડી હંસો રતિકીડામાં મશગૂલ છે, તો કુલ્લે કેટલા હંસો હશે?’

ચોથો પ્રશ્ન : ‘ચક્કાંચ - અકલિત સલિલે...’ સરોવર જળમાં ઉડતા વારિના સ્પંદનો ચક્કવાક અને કૌંચ પક્ષીઓના વિહારથી ઉડે છે. સરોવરની મધ્યમાં પાણીના સ્તરથી અડધો કૂટ ઉપર વિકસે છે. પવનની લ્હેરખી પાણીમાં વિકસેલા કમળને બે ફૂટ દૂર નમાવે છે, તો પાણીની ઊંડાઈ કેટલી?’ ભૂમિતિના સિદ્ધાંત પર નિર્ભર આ પ્રશ્ન લીલાવતીને પૂછવામાં આવે છે.

પાંચમો પ્રશ્ન : ‘હારસ્ય તારસ્ય તાર્ઝાયે...’ રતિકીડાની ચરમ ટોચે પુરુષ અને સ્ત્રી યુગલ અરસપરસ એકબીજાને ભેટે છે ત્યારે સ્ત્રીના કંઠમાં જૂલતા મોતીના દાઢા ભૂમિ પર વિખરાઈ જાય છે. ૧/૩ જમીન પર. ૧/૫ શર્યા પર, ૧/૬ સુકેશી નામે સર્પી એકઠા કરે છે. ૧/૧૦ પુરુષ સાચવીને એકઠા કરે છે, જ્યારે છ મોતી સ્ત્રીના અંગ પર તૂટેલા ધાગા પર જોવા મળે છે. તો કુલ્લે મોતીના હારમાં કેટલા મોતીના દાઢા હશે?’

ચંદ્રાની અનેક નૃત્યરચનાઓમાં લીલાવતીએ ઘણી લોકપ્રિયતા હાંસલ કરીહતી. વિદ્ધજનો અને નાટ્યજગતના કલાકારોને સાહિત્ય ઉપરાંત રમતિયાળ રીતે થતા નર્તનમાં ધાંસુ રસ પડ્યો હતો. કણાટકમાં જ્યાં નીતાસમ નાટ્યસંસ્થાની સ્થાપના થઈ છે ત્યાં, મૈસૂર, ડેગપોડુ, ઉડુપી વગેરે સ્થળે લીલાવતી રજૂ થયું ત્યારે ત્યાંની સામાન્ય જનતાએ ભરતનાટ્યમૂની શાસ્ત્રીયતાથી જરાય વિચલિત થયા વિના આ નૃત્યમય પ્રશ્નો માણ્યા હતા. કુદરત, પુષ્પો, ભ્રમર હંસ વગેરેથી સમૃદ્ધ આ નૃત્યરચનાને ઈટલીના સીસીલીના પાલેરમો શહેરમાં ‘Gaia’ awards એનાયત થયો હતો. નૃત્યમાં કુદરતને આવી સુંદર રીતે વરણી લેવાથી ‘ecology of nature’ના પ્રશ્નને ચંદ્રાએ કલાત્મક રીતે રજૂ કર્યો હતો, તે બદલ તેને આ એવોડ એનાયત થયો હતો.

ચંદ્રાની અન્ય કૃતિઓમાં ‘પ્રાણ’ જેમાં શાસ્ત્રોશાસ પ્રાણવાયુ અને શરીરનો સંબંધ અનેક યોગાસનોની નૃત્યમય રચના દ્વારા રજૂ થયો હતો. આ ઉપરાંત નવગ્રહાની નૂતન નૃત્ય સંયોજનામાં કેન્દ્રમાં નંદકુમાર શીર્ષસિન કરે છે અને તેની આજુબાજુ નર્તકીઓ વિવિધ આસનો દર્શાવી પ્રત્યેક ગ્રહની ગતિ અને સ્થિતિ દર્શાવતા હતા.

નૃત્યરચના ‘ભિન્નપ્રવાહ’માં રધુવંશમાંથી કાલિદાસના જમુના અને ગંગાના પ્રવાહો કઈ રીતે મળે છે, ઇતાં પોતાની આગવી પ્રતિભા જાળવે છે તે નૃત્યમાં ઈટાલીયન નર્તકી ઈલિયાના ચીટારીસ્તીના મયૂરભંજ છાઉનો વિનિયોગ દ્વારા અને શ્રીલંકાની સંગીતા નમશિવાય નર્તકી દ્વારા રજૂ કરી હતી. અને સંગીત માટે કણ્ણાટકી સંગીતના વિદૂષી ગાયિકા અરૂણા સાઈરામ અને શાંતાલ નામે દક્ષિણ ફાન્સની ગાયિકાની મદદ લીધી હતી.

ચંદ્રાની અન્ય રચનાઓમાં મહાકાલ, ખી, રાગા, શ્લોકામાં ચંદ્રાએ અન્ય વિષયોને નૃત્યમાં વણી લીધા છે. મહાકાલમાં સમયને કઈ રીતે સમજવો? ડેવેન્ડરનો સમય, મહિના, દિવસો, ઘડી, પળ અથવા શિવના મહાકાલ સ્વરૂપને તાગવું. માનવ સંવેદનાઓ કઈ કઈ રીતે શાશ્વત રહે છે તે તેણે એક બાજુ યુદ્ધ થતું હોય છે ત્યારે માનવો ફૈન્ડાઈન્ય ચર્ચિયામાં વ્યત્ત રહે છે, રતિકીડા પણ કરે છે. કલરીપાયહુના બે કલાકારો યુદ્ધ કરે છે તેની છાયામાં એક યુગલ શૃંગાર સંવનનમાં રત છે તેવું સૂચયું હતું. અને મહાકાલના મહિમાને સમજવા પ્રયત્ન કર્યો હતો.

ઓળિકથી શરૂ કરી અને તેની છેલ્લી રચના ‘શરીર’ (Sharira) દરમિયાન તે દેહના રહસ્યો તે નૃત્ય દ્વારા તાગવા મથતી હતી. શરીરમાં sensuality, sexuality, spirituality વગેરે હોય છે. તેને કઈ રીતે તાગવા? શરીરમાં તે ભૂમિતિના ત્રિકોણને જૂએ છે. યોનિના ત્રિકોણની વાત કરે છે ત્રિકોણ પર ત્રિકોણના ચિત્રમાં ખીપુરુષનું અમૂર્ત એવું સ્વરૂપ જૂએ છે. શરીરની નૃત્યરચનામાં તેણે તીશાની દોશી નામની યોગમાં પ્રવીણ અને અંગેજમાં કવિતાઓ રચતી યુવાન કન્યાને અને કલરીપાયહુના કલાકાર સાજીને યોગ તથા કલરીપાહુની ટેક્નિક સાથે રજૂ કરેલા. ધ્રુપદના સંગીતકાર ગુંડેચા બંધુઓ સંગીત શરીર માટે યોજેલું. બાળકનો જન્મ માતાના ગર્ભાશયમાંથી થાય છે અને તે ધીરે ધીરે મોટો થતો જાય છે. તીશાનીની દેહભંગમાંથી તેના બે પગ નીચેથી સાજ પસાર થાય છે અને એક પગ પર ઊભો રહી ચારે દિશામાં ફરે છે. તીશાનીને ઉપાડે છે. સાજીના ગળે પગ ભેરવી નિશાની ભૂમિ તરફ મુખ ફરવે છે અને ત્યાં રજૂઆત પૂરી થાય છે.

આઈનલાલ નામની ફિલ્મમેકર કલાકારે ‘શરીરા’ નામે ફિલ્મ બનાવી છે તેમાં શરીરના અંશો બતાવ્યા છે. વિશેષત: તેમાં ચંદ્રાના નૃત્ય પરત્વેના અભિગમના સુંદર વક્તવ્યો છે. ચંદ્રા કહે છે : ‘જો હું નૃત્યકાર ન બની હોતે તો મારી vishai દાઢિ ઘણા સચેત હોવાથી હું ચિત્રકાર બની હોત.’ પોતે દક્ષિણ ભારતના ચોલા વંશના ધાતુ શિલ્પો જોયા છે, અને ભારતની કલાની અનેક વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે, એટલે તેનું કહેવું છે કે તેની નૃત્યરચના સમૃદ્ધ થઈ છે.

ચંદ્રાની નૃત્ય સંયોજના ‘સ્ત્રી’ ટોરેન્ટોમાં રજૂ થઈ હતી. ચંદ્રાએ patriarchy કઈ રીતે સ્ત્રીની કરોડરજજુ પર પ્રહાર કરી તેને અશક્ત બનાવે છે તે ઉપમાન લઈ સ્ત્રીઓને કરોડરજજુ spine મજબૂત કરવાનું નૃત્યમાં સૂચવ્યું છે. જમ્ભીન પર કચરો વાળતા અને અનેક ઘરકામો કરતા જે પરિશ્રમ સ્ત્રીઓ ઉઠાવે છે તે શ્રમ spine મજબૂત કરી હળવો કરી શકાય. મૂળે ચંદ્રા સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાનું સૂચવે છે. તેઓ પર થતા બળત્કારને, પુરુષોનો સામનો કરવા એકત્રિત થઈ સંગ્રહન યોજવાનું તેમાં દર્શાવ્યું છે. અને ભારતીય સંસ્કૃતિના myth અનુસાર તે દશભુજા શક્તિ છે તે નૃત્ય દ્વારા દર્શાવ્યું છે. ભરતનાટ્યમ્ભુતમાં નહુવાંગમ્ભુતમાં વપરાતા મંજુરાને બદલે બે નાના પત્થરના ટુકડાઓથી તાલ આપવાનો પ્રયોગ પણ કરેલો અને ભરતનાટ્યમ્ભુત નૃત્યની સંગીત પરાવલંબતાનો ઉકેલ શોધેલો. વાયોલીનની ચોક્કસ સુરાવલિ દ્વારા સ્ત્રીની અસહાય દશા વ્યક્ત કરેલી.

આમ ચંદ્રાના અનેક સર્જનો નવી ભાત પાડતા રહ્યા છે. તેનો વ્યાપ scope ભરતનાટ્યમ્ભુતમાં પ્રયોજાતા પૌરાણિક કથાનકો, નાયક-નાયિકાના શુંગાર પદોથી ભિન્ન અને નવી દિશાના પ્રયાણના સૂચક છે. એક વધુ નૃત્યસંયોજન ‘યંત્ર’ નામે કરેલું. જર્મનીથી પીનાબાઉસ તેની વિશાળ નૃત્ય મંજુણી સાથે carnations નામે નૃત્યસંયોજન લાવી હતી ત્યારે તેની સાથે ચંદ્રાની ‘યંત્ર’ નૃત્ય રચના રજૂ થતી હતી. ચંદ્રા આપણી ભારતની વાસ્તવિકતા મોટા spectacles વિના પણ ભારતની વિવિધ ભાતીગળ કલાવિધાને નૃત્યમાં સંયોજ શકાય તેવો નિર્દેશ કરતી હતી. આપણે ત્યાં યંત્ર વિશે ઘણું વિચારાયું અને લખાયું છે તંત્ર અને યંત્રને દર્શય કાબ્યમાં કઈ રીતે નિરૂપી શકાય તે તેણે ‘યંત્ર’ રચનામાં બતાયું હતું.

ચંદ્રા સંસ્થા સ્થાપવામાં માનતી નહોતી કે તેની પાસે નૃત્ય શીખી નૃત્યાંગનાઓનું દળ ઊભું કરવા માગતી નહોતી. તે કહેતી કે સંસ્થાઓ અંતે નભળી બને છે. તે કલાકારની નિજી કલ્યાણશક્તિ અને વૈયક્તિક original રચનાશક્તિમાં વિશ્વાસ ધરાવતી હતી. તેની જોડે કામ કરનાર નૃત્યાંગનાઓમાંથી પચ્ચિની ચેહુર, મીરા, કૃષ્ણ અને નિત્યાનંદ વગેરેએ સ્વતંત્રપણે સમકાલીન મોર્ડન શૈલીમાં નવતર પ્રયોગો કર્યા છે. પરંતુ તે ચંદ્રાથી ભિન્ન છે. તે રચના કરવામાં તેઓ ચંદ્રાનો આભાર માને છે.

ચંદ્રાનું ૨૮મી ડિસેમ્બર ૨૦૦૬માં મદ્રાસ ખાતે લાંબી બિમારી પછી અવસાન થયું. સદાનંદ મેનને તેના મોટાભાગના નૃત્યસંયોજનામાં પ્રકાશ યોજના કરી હતી અને પ્રત્યેક કાર્યમાં સહાય કરી હતી. આજે ૧, ઈલીયટ બીચ રોડ, બેસેનગર, ચૈન્નાઈમાં સમુદ્રની સામે ચંદ્રાના નિવાસસ્થાને ચંદ્રમંડલા રંગમંચ અને કલરી વિભાગમાં કલરીપાયહુની શિક્ષા આપાય છે. skills, સંસ્થાના ટ્રસ્ટી તરીકે સદાનંદ એની સંભાળ રાખે છે અને ત્યાં આકર્ષિત્વ માટે બીજી ત્રણ મકાનો બાંધવામાં આવ્યા છે, જ્યાં ચંદ્રાની નૃત્ય સંયોજનાના video recordings, ચંદ્રાની નૃત્ય રચનાઓના ફોટો, ચંદ્રાના લખાણો, તેની રચનાઓ વિશેની આલોચનાઓ ઈત્યાદિની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્કોલસને ચંદ્રા પર અભ્યાસ કરવો હોય તે ત્યાં રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમિત ચંદ્રમંડલા રંગમંચ પર નૃત્યોના કાર્યક્રમ કશી પણ ફી લીધા વિના રજૂ કરવાની

સુવિધા છે. ચિત્ર પ્રદર્શનો, વ્યાખ્યાનો, કવિતા પાઠ, નવતર પ્રયોગો, નૃત્યના રીહર્સલો વગેરે માટે ત્યાં કોઈ પ્રકારની ફી લીધા વિના તે તે સ્થળોનો ઉપયોગ કરવાની વ્યવસ્થા છે. ચંદ્રા માનતી હતી કે એ જગ્યાઓ કળાકારો માટે હોવી જોઈએ. spaces એવું નામ તેને આપવામાં આવ્યું છે. ચંદ્રા પર જ્ઞાનીતા નાટ્યકાર, વિદ્વાન રૂસ્તમ ભર્યાએ અંગેજમાં chandralekha Woman - Dance - Resistance પુસ્તક લખ્યું છે જેમાં ચંદ્રલેખાની બહુમુખી પ્રતિભાને રૂસ્તમે શબ્દબદ્ધ કરી છે. સમકાળીન આધુનિક નૃત્યકળામાં ચંદ્રલેખાનું સ્થાન બહુમાનપૂર્વક લેવામાં આવે છે.

સંદર્ભ ગ્રંથ સૂચિ

Sangeet Natak Vol. XL VII 1-4 2013, Vol. XLVIII 1-4 2014, Journal of sangeet Natak Akademi. It contains all papers presented at 1958 All India Dance seminar. Available from Sangeet Natak Akademi Rabindra Bhavan Phirozsha Road, New Delhi, 110001.

Khokar, Mohan : His Dance, His Life A portrait of Uday Shankar. Himalayan Book 17-L Cannaught Place, New Delhi 110001

Uday Shanker : Photo Biography by Sunil Kothari, RIMPA Publications, Varanasi.

Rukmini Devi : Photo biography by Sunil Kothari, Kalakshetra Foundation, Tiruvanmiyar, Chennai 600049

New directions in India Dance : edited by Sunil Kothari. MARG Publications, Army and Navy Building 140, M. G. Road, Mumbai 400001

Chandralekha : Woman, Dance, Resistance by Rustum Bharucha

Harper Collins Publishers, India Post Ltd. 7/16, Ansari Road New Delhi 110001, 1995

NCPA Quarterly Journal vol XIII, No. 2 June 1984, National Centre for the Performing Arts, Nariman Point, Mumbai 400001



અભ્યાસ

એક વાર્તાકાર, નોખો, અનોખો અને એની એક વાર્તા

હરિકૃષ્ણ પાઠક

જનક ત્રિવેદી જ્યારે ‘સરોજ’ ત્રિવેદીના નામે લખતા ત્યારથી થોડોધણો પરિચય હતો. તેમની એક લઘુકથાને ‘કિટિક્સ એવોઈ’ એનાયત થયો ત્યારે એ સમારંભમાં અમે સાથે હતા. એ લઘુકથા હૃદયસ્પર્શી હતી.

આ જણ ગદને ક્ષમતાથી બેડી શકે છે તેવો અંદાજ હતો. કવિશ્રી મનોહર ત્રિવેદી સાથે તેમણે લખેલી કથા ‘નથી’નાં થોડાં પ્રકરણો વાંચેલાં. એવામાં તેમની એક મનભર વાર્તા ‘સાંધાવાળા જેઠાલાલ ગોરથનની નોકરીનો છેલ્લો હિવસ ‘વાંચવામાં આવી ને આપણા રામ ખુશખુશાલ!

પત્ર લખ્યો ને ઉત્તર ત્વરિત મળ્યો, તેમાં જેટલો ઉમળકો એટલી જ તીખાશ, પણ જણ અંદરથી મીઠો; જગડવું ગમે એવો.

ક્યારેક ક્યારેક મળવાનું થાય ને એની મીઠી કાઠિયાવાડી જબાન સાંભળવી ગમે. આ લેખકનો વાર્તાસંગ્રહ પ્રગટ થવો જ જોઈએ એવું માનનારા-ને ધારે તો પાર પાડી આપે તેવા વાતપ્રેમીઓની સંખ્યા વધતી ચાલી. ને બાવળ વાવનાર વહાલા એચ.પી.ની વાર્તા કરનાર આ કલાકાર-સર્જક છેવટે સંગ્રહ લઈને આવ્યા :

અમરેલી માટે એ અવસર હતો જ્યારે આ વાર્તાસંગ્રહના સત્કાર-સ્વીકારનો સાદો પણ મનભર સમારંભ રચાયો. કવિતાની સરવાકીઓ તો ત્યાંની ભોમાં ફૂરતી રહી છે, પણ હવે એહીની ભોંયમાં વાતપિ મજાની પાકે છે એ વાતની નોંધ લેવાઈ.

એહીં જે વાર્તાની વાત કરવી છે તે વાર્તા છે ‘ચક્કર’. પણ તેની વાત કરું એ પહેલાં આ લેખકની એક-બે લાક્ષણિકતાઓની વાત કરું :

જ્યારે વાર્તાઓ કે અન્ય સર્જનાત્મક કૃતિઓ વાંચતો હોઉં ત્યારે એવા પ્રશ્ન થાય છે કે - આમાં કશું આગવાપણું છે? આની આ વાર્તા અન્ય ગમે તે લેખક લખી શક્યો હોત? આ નહીં તો આના જેવી બીજો કોઈ લખી શક્યો હોત; કે પછી જો આ વાર્તા આણે ન લખી હોત તો તે ક્યારેય ન જ લખાઈ હોત??!

મને કહેતાં આનંદ થાય છે કે એહી ઘણી વાર્તાઓ એવી મળી છે જે જનક ત્રિવેદીએ ન લખી હોત તો તે ક્યારેય લખાઈ ન જ હોત. આજે કે આવતી કાલે.

‘ચક્કર’ આવી વાર્તાઓમાંયલી એક વાર્તા છે.

એહીં આમ જુઓ તો બે જ પાત્રો છે. મૂળજી પટેલ ને કડવો કોળી.

એકબીજાની ગરજે બને વર્ષે એક ખટમીઠો વ્યવહાર ચાલતો રહે છે. મૂળજી

ઘરસંસારવાળો, થોડો પીઠ છે ને કડવો થોડો મુખ છે. વયમાં થોડો તફાવત છે, તે પણ આનું એક કારણ; ને કડવો પાછો કુંવારો છે. અહીં સમગ્ર નિરૂપણમાં કડવાને વધારે મોટો રોલ મળે છે, મૂળજ્ઞને ભાગે પ્રમાણમાં ઓછું, ને તે છતાં સંતુલન આબાદ જગતાઈ રહે છે. આ બંને પાત્રોની આસપાસની જે સૃષ્ટિ છે, દુનિયા છે તે ય ખપ પૂરતી આવતી રહે છે. ક્યાંય કશો પ્રસ્તાર નહીં કે કશું ટાંચું યે નહીં.

વાતાં કહેનારની - કથકની ભાષા જરૂર મુજબ સહેજ જુદી પડે ને જ્યાં સ્વાદો આવે ત્યાં ભાષા જે તે પાત્રના મૌનમાં અરદે એવી આબાદ પ્રયોજાઈ છે; ઉચ્ચારણ પણ ભૂલ વિનાના. કડવો મૂળજ્ઞ કહે છે ને, ‘લાઉસ’ કરવું હોય તો ‘આ બુટાન આમ હડવે... હડવે’ ફેરવવાનું એવું દમામન્દેર સમજાવે!

એકાદ ફકરામાં કે થોડી લીટીઓમાં લેખક પાત્રોનો જે પરિચય કરાવે છે તે તાદેશ ચિત્રો દોરી આપે છે (લેખક અચ્છા ચિત્રકાર પણ હતા) - એક લસરકામાં, એ ય આસ્વાધ અંશો છે આ વાતાંના.

મૂળજ્ઞ પાસે ભાડે આપવા રાખેલ લાઉડસ્પીકરનો સરંજામ ખરો, પણ એનો ઓપરેટર તો કડવો!

‘કડવો એક તળપદો કોળી જુવાન, પાંચ ચોપડી ભણેલો, એની થોડી મગજુરી પણ ખરી. ફિલ્મની વાતો કરી જાણે ગીંજામાં દાંતિયો ને બોલપેન રાખી ભણેલો દેખાવાનો એને શોખ. કોઈ ‘એવું’ માણસ દેખે તો છાંધું વાંચવાનો ડેળ પણ કરી લે... મજૂરી કરવી પણ પોતે બીજાથી નોખો પડે એવો ભણેલો મજૂર છે એવું કોઈક એના મનમાં. એટલે મજૂરી ઓછી મળે. મોટે ભાગે બેકાર રહ્યે...’

મૂળજ્ઞને લાઉડસ્પીકર આપવાનો ઓર્ડર મળે એટલે એને કડવાની ગરજ ઊભી થાય. કડવાની બેકારીને જાણે છતાં કડવાને ચાર મિનાર આપે ને અનુકૂળ થયેલ કડવાને પૂછે -

‘તે, કડવા નાંદરખી જોયું છ ક્યારેય?’

પૂછે એવું કે આપણ તો સંભળાય ‘તે કડવા, પેરિસ જોયું છ ક્યારેય?’ પણ કડવો તો બધું જોઈ વણ્ણો છે.

કડવો વરણાગી છે, પણ છેલબટાઉ કે ઉતાર નથી તેના વ્યક્તિત્વમાં ખાનદાનીનો અંશ પડેલો છે; એનો યે પરિચય લેખક તેનાં વાણીવર્તનથી પ્રતીત કરાવે છે. પણ આ વાતાંમાં સહૃથી આસ્વાધ અંશ છે તે તેમાંથી પ્રગટનું પ્રથ્યન્ન હાસ્ય, ને એ હાસ્યની તળે વહેતું ધબકંતું જીવન.

કણબીની છોડીયુંનાં લગનમાં ફિલ્મનાં ગીતો વગાડવા જવાનું, બે ‘સારાં માણાં’ જુએ એનો કડવાને ભારે પોરસ છે.

‘વરણાગીયો કડવો કણબીની જુવાન છોડીઓનાં મનનો ઊડો પારખું, સાચો સાચો પારેખ, પણ કટકી ‘સોનું’ ચોરવાનું કામ એનું નહીં. એનાં એકેએક કામમાં માભો

પહેલો. કયરા જેવી ઘસાઈ ચૂકેલી રેકોર્ડની વચ્ચે એક માત્ર નવી રેકર્ડ ચડાવી હે. ‘નાગિન’નું ગીત - મન તોલે મેરા તન તોલે, મેરે દિલ કા ગયા કરાર’ વાળું ગીત સાંભળી માંડવે ગીત ગાતી છોકરીઓ ગાતી થંભી જાય.. એલી એથ કાન્તુડી, મૂર્ખ હાંબર્ય તો.. મન તોલે, તન તોલે વાળું ગાણું... કડવો અચાનક રેકર્ડ ફેરવી નાખે, ને પોતાના આઈડિયાની અસરની રાહ જુઝે. બે’ક અલ્વડ છોકરીઓ ફરીથી પેલું ગાળું વગાડવાની રાવ લઈને આવે... ‘ઉંયથા કાં ટટળાવો એલા કડવા ભાય. લીયાવ્યા સો રોગી એક રેકડ... ઈયે નંઈ વગાડો હરખી તમેય બર્યું?! ને કડવો મદહોશ થઈ જાય.

કડવો અને મૂળજી બંનેને એક બીજાની ગરજ છે, અને વ્યવહાર એ ગરજ વત્તાને જ ચાલતો રહે છે. બંનેની આર્થિક સ્થિતિમાં જાઝો ફેર નથી. મૂળજીને ક્યારેક - તેના લેણાદારો સામે - કડવાનો પાઠ ભજવવો પડે છે, તો કડવાને મૂળજીનું મહોરું ચડાવવાનું મળે એ એના ભાગ્યની પરમ સુખની ક્ષણો હોય છે.

‘હારાં માણાં’ જોતાં હોય ત્યારે કડવો ઈલેક્ટ્રિસનનો જે પાઠ ભજવે છે તેમાં ને કડવા સામે ગલ લંબાવતા મૂળજીના ચિત્રણમાં યે લેખકનું જે ઝીણું નિરીક્ષણ ને નિરૂપણ જોવા મળે છે તે પરમ ટૂપ્ટિકર છે. આ વાર્તા એવી છે જેના વિશે વાત કરીએ તો પણ તેનો મૂળ આસ્વાદ પહોંચાડી ન શકાય. એ તો વારંવાર વાંચવી જ પડે.

વિનયક્ષણા અને વિલક્ષણ માનવીય સંબંધની આ કથામાં જેટલો કથારસ પ્રબળ છે એટલો જ અનો કલાધાર ચુસ્ત છે. વાર્તામાં એક ‘ચક્કર’ પૂરું થાય છે જ્યારે મૂળજી કડવાને પૂર્ણ છે -

‘દાળનો સબડકો ભરતાં મૂળજી આસ્તેથી પ્રસ્તાવ મૂકે... નવો ઓડર છે સખપરનો. જાણું કડવાભાઈ, તારે નવરાશ હોય તો?!’

સુમગ્રપણે આ વાર્તાકારની શક્તિ, સિદ્ધિનો અંદાજ આપતાં, વાતસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’ની પ્રસ્તાવનામાં શ્રી રધુવીર ચૌધરીએ યથાર્થ કહ્યું છે :

‘અનુભવી શક્તિ અને શાઢનું સૌંદર્ય’ - વિશે વાત કરીને મેં જે કૃતિ ઝંખી છે એનાં દણાંત જનક નિવેદી પાસેથી મળ્યાં છે. એમ મળતાં રહેશે. એમની સચ્ચાઈ આદર્શોના ભોગપણને આભારી નથી. સ્વાધ્યાય, તિતિક્ષા અને ચિકિત્સક બુદ્ધિને આભારી છે.’

અચાનક ઉઠી ગયેલ આ વાર્તાસર્જક તેમની હયાતિમાં કેટલુંક પોંખાયા તે આપણે જાણતા નથી. તેમની અગ્રંથસ્થ, અગ્રગટ વાતાઓનો સંગ્રહ મળવો જોઈએ.



કાલપાશ : કોરોનાકાળની કથા

સંધ્યા ભવુ

[‘કાલપાશ’ (નવલકથા) લે. મોહન પરમાર, પ્ર. રન્નાદે પ્રકાશન, ૫૮/૨, બીજે માળ. જેન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ, પ્ર. આ. જુલાઈ, ૨૦૨૦. મૂલ્ય ૧૪૦ રૂ.]

‘કાલપાશ’ એ મોહન પરમારની તેરમી નવલકથા છે. કલાના ધોરણે ખરી ઊતરે એ મ્રકારની ટૂંકી વાર્તા અને નવલકથા આપનારા મોહન પરમાર ગુજરાતી સહિત્યના અનુઆધુનિક ગાળાના મહત્વના સર્જક છે. સર્જનાત્મક પડકારો જીલવાનું તેમને હંમેશાં ગમ્યું છે. કોરોનાએ માનવજીતને એવી વિટંબજામાં મૂકી દીધી જેની તેણે કલ્પના પણ ન કરી હોય!! માણસની સ્વ-તંત્ર મ્રવૃત્તિઓ પર અચાનક રોક લગાવનાર પરિસ્થિતિનું નિર્માણ સમગ્ર વિશ્વમાં થયું. વસ્તીથી ઉભરાતા અને રોજનું રોજ રણી ખાનાર મોટો વર્ગ ધરાવતા આપણા દેશમાં પણ કોરોના અને લોકડાઉનની દ્ખીતી અને પ્રયજ્ઞન અસર વરતાઈ. સર્જકજીવ આવે ટાણે ચૂપ ન જ રહે. આ સંદર્ભે મોહન પરમાર ‘કાલપાશ’ નવલકથા લઈને ઉપરિષ્ઠ થયા છે.

મુખ્યત્વે આ કથા પારિવારિક વિષયવસ્તુ ધરાવે છે. પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રથી લખાયેલી આ નવલકથામાં અમદાવાદનું લોકાલ છે. મધ્યવયનો પુરુષ ઓફિસમાં અધિકારી છે અને તેની પત્ની ગૃહિણી છે. તેની બે કિશોર વધની પુત્રીઓ છે. બા-બાપુજી પણ સાથે જ રહે છે. સોસાયટીમાં રહેનાર આ કુટુંબ કોરોનાને કારણે અન્યંત સાવચેત થઈ ગયું છે. ઓફિસમાં ખાસ કામ આવી પડ્યું છે તેથી કથાનાયકને ઓફિસે જવું પડે છે ત્યારે બાપુજીની પૃથ્ઘનાનો સામનો કરવો પડે છે. ઓફિસમાં કામ પતાવ્યા પછી પોતાના વાહનમાં આસિસ્ટન્ટને એના ધરે છોડે છે જેની નજીક ઝૂપડપહીનો વિસ્તાર છે જ્યાં કુટુંબો ભૂખે મરે છે. પગારદાર કર્મચારી એ અંગેની વીતક વધુ સાંભળી પડા નથી શકતો!!

લેખકે અહીં મધ્યમવર્ગીય કુટુંબને કેન્દ્રમાં રાખ્યું છે. કોરોનાને કારણે મળેલી નવરાશમાં કુટુંબીજનોએ પરસ્પર સાથે વીતાવેલો સમય, નાના-મોટાં વર્ષણો, જનરેશન ગેપને કારણે ઊભી થતી પરિસ્થિતિ, સૌની હાજરી વચ્ચેથી ચોરીને માણેલી દામ્પત્યપ્રેમની શૂંગારરસખચિત ક્ષણો, પાણોશીઓ સાથેની બેઠક અને કોરોના વિષેની ચર્ચા, વગેરેને લેખક તાદેશ કરે છે. ટી.વી. પર આવતા સમાચારો, સગાં-જાલાંના ફોન, આજુબાજુના લોકોનું પોતપોતાના ધરોમાં કેદ થઈ જવું, ડોક્ટર સાથેની મુલાકાત-કેકેડાણે કોરોનાની અસર ઝડપાઈ છે. એ દિવસોમાં આપણે જે અનુભવ્યું તે અહીં કથારૂપે છે.

નવલક્યાની શરૂઆત થાય છે અમદાવાદ વર્ષનથી....

‘રાત પડ્યાં ફરી રહી છે ને દિવસ ચિત્કાર પાડી રહ્યો છે. મારી અમદાવાદનગરીનાં રૂપરંગ અદલબદ્ધ થયાં કરે છે. ફૂતરું મોટેથી ભસીને પછી ટૂટિયું વાળી બેસી જાય, તેમ અમદાવાદ શહેરનો ભભકો હોલવાઈ રહ્યો છે. અનેક મહામારી અને હાડમારીઓએ એની કેડ ભાંગી નાખી છે, છતાં વારંવાર એ બેહું થયું છે. પણ આવી બેહૂદી હાલત તો અમદાવાદની કયારેય થઈ નહોતી.’ (પૃ.૧) સજ્જવારો પણનું આલંબન લઈને અમદાવાદની ભયાનકતાનાં આ વર્ષની પછી ફરીથી કેમેરા કથાનાયકનાં કંઠુંબના જીવનનો close-up જીલવામાં પ્રવૃત્ત થાય છે. રોજબરોજની ડૈનિક ક્રિપાઓ અહીં નાનાં વક્ક્યોમાં જાણે કે ડાયરીમાં લખાતી હોય એમ નિરાંતે આલેખાઈ છે અને તે એ રીતે કે કથામાં કોઈ વિકાસ કે ગતિ ન અનુભવાય. પણ સર્જક આમ સહેતુક કરે છે. એ દિવસોની અલસ સ્થગિતતા દર્શાવવાનું સહૃક્ક ધાર્યું હોય એમ જગાય છે. પણ આમ છતાં આ લઘુનવલ એક પરિવારની કથા જ રહે એટલું સીમિત વિશ્વ પણ નથી. સ્વખની પ્રયુક્તિથી વ્યાપક સમુદ્દરયનો સમાવેશ અહીં થાય છે.

કથાનાયક ભગવાનની સાથે કેમેરા અને માઈક લઈને (પત્રકારોની જેમ જ સ્ટો) ‘મનુષ્યલીલા’ જોવા નીકળે છે. આ પારદર્શિ વિરિયો દ્વારા મકાનનાં બારી-બારણાં બંધ હોવા છતાં અંદરનાં દશ્યો દેખાય છે. ગરીબી અને સ્વી શોખણાની વરવી વાસ્તવિકતાનો ચિત્તાર મળે છે. સિનેમા અને હિરોઈન સાથેના દશ્યો, સમાજસેવક અને ચૂંટણી વચ્ચેનું કમણાણ, કિક્કેટરો અને પી.એલ.આઈ.ની મદાગાંઠ, સર્તા અનાજની દુકાને ઊભરાતું ક્રિડિયારું - આવી અનેક ગતિવિધિનાં ચિન્તો થોડાક લસરકે અંકાયાં છે. રાજકારણ-મંત્રીમંડળ-હાઈકમાન્ડ - અને ધર્મકારણ-મંહિર-આરતી સહિતની આ તમામ વાત અહીં ઉપહાસની રીતિએ સહેતક થઈ છે. કોરોના દરમિયાન બનેલા સામાજિક પ્રસંગો અને મૃત્યુના પ્રસંગોને જોગવવા માટેના વ્યવહાર અને વર્તણૂક આપણા સમાજની માનસિકતા બતાવે છે. સામાન્ય રીતે અહેવાલની રીતે તમામ દશ્યોનું ભયાન કરતાં કથક આશાસ્પદ કિક્કેટર એવા મામાના દીકરાની લાશ આવે છે ત્યારે દ્વારા ઊંઠે છે. લખાયું છે,

‘સુશાનના દરવાજી આગળ જેવી લાશ ઉતારી કે એને વાનમાંથી બહાર કાઢવા માટે બે-ત્રણ જણું આગળ વધ્યા. હું ય આગળ વધેલો. પણ આંખો સામે મારી બે બેબીઓ અને અંજલિ અલપણલપ થયાં અને હું પાછો પણ્યો... તે વખતે દૂર ઊભાં ઊભાં આંસુ સારતા દૂરના માણસો જોવા જ હું પોતાને દેખાયો...’ (પૃ.૮૭)

માણસોની મૂંગવણ, ગુંચવણ, વ્યથા, અસલામતી, અનિશ્ચિતતા, ચિંતા, ઉચ્ચાટ, ઉતેજના - આ અને આવાં મિશ્ર સંવેદનોને કથારૂપે અવતારવાનો લેખકે અહીં પ્રયત્ન કર્યો છે. કોરોનાના સમાચાર સંભળવા તે એક વાત છે અને બાજુની સોસાયટીમાં કોરોનાનું આવી જવાની ખબર પડે ત્યારે સૌ ધુજી જ્યા જ્યા છે. અને આ ભયની સમાંતરે પણ જીવન તો ચાલતું જ રહે છે. પાંશી સાથેના સંવાદો, પત્ની સાથેની રકજક, શ્રમિકોના પગપાળા ચાલી નીકળવાની વાત - કોરોનાની અસર અને બેઅસર એકસાથે ચાલે છે!

કોરોનાસમય દરમિયાન ઘરનાં વયસ્ક સભ્યોનું જીવન દોહરાલું બન્યું. આ

નવલકથામાં બાપુજીનું પાત્ર કથાનો મોટો ભાગ રોકે છે. શરૂઆતમાં સ્વસ્થ અને નાયક કરતાં પણ વધુ તંહુરસ્ત બાપુજી આગળ જતાં કોરોનાપરિસ્થિતિથી ત્રસ્ત જણાય છે. હવે તેઓ ટી.વી. પાસે બેસ્સિને જૂનાં પિકચરો લાંબો સમય સુધી જુએ છે. પૂર્વ લાંબો સમય સુધી પૂજા કરનાર બાપુજીએ હવે ઈશ્વર પરની આસ્થા ગુમાવી દીધી છે. કેટલીકવાર તેઓ અસામાચ્ય વર્તન કરે છે. ઘડીકમાં હોમ-આઈસોલેટેડ વ્યક્તિને મળીને જરૂરિયાત પૂરી પાડવાનો આગ્રહ કરે છે તો બીજી પણે કબાટમાંથી પૈસા કાઢી બિસ્સામાં મૂકી બહાર નીકળી જાય છે! વળી પાછા પોતે કરેલા પૈસાના વ્યવહારની નોંધ બતાવી હે છે જેથી પોતાને કાંઈ થાય તો પુત્રને આ નોંધ કામ લાગે...

અંતે શું બને છે તે જાણવા માટે તો કૂતી પાસે જવું રહ્યું. હા, પણ એક તબક્કે કથક યમરાજને પ્રશ્નો પૂછે છે. જીવન, બંધન અને મુક્તિ જેવી તાત્ત્વિક ચર્ચાને આત્મકથન દ્વારા મૂર્ત કરવાનો પ્રયાસ લેખકનું તાટસ્થય દર્શાવે છે. એક સર્જકમાં અપેક્ષિત તટસ્થતાપૂર્વકનું તાદાત્મ્ય ‘કાલપાશ’ શીર્ષકમાં પણ જોઈ શકાય છે જેને જાળવવાનો સંનિષ્ઠ પ્રયત્ન નવલકથામાં પણ થયો છે.



સાભાર સ્વીકાર

ચરિત્ર

વીર સાવરકર : પોપટલાલ મંડલી, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪+૪૩, રૂ. ૪૫. ધીરુભાઈ અંબાણી : પોપટલાલ મંડલી, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૩૮, રૂ. ૪૦. શ્રી હેમચંદ્રચાર્ય : પોપટલાલ મંડલી, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૪૦, રૂ. ૪૦. દીનબંધુ એન્ડ્ઝૂઝ : પોપટલાલ મંડલી, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૪+૩૬, રૂ. ૩૬. ડૉ. હોમી ભાભા : પોપટલાલ મંડલી, ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ, ૪+૪૪, રૂ. ૪૫.

પ્રક્રીણા

ગાંધી : સનાતન કાંતિકારી : હરેશ ધોળકિયા, ૨૦૧૮, ન્યૂમિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભૂજ-૩૭૦૦૦૧, પૃ. ૬૪, રૂ. ૧૦૦. **Super Food :** અનુ. ચિરંતના ભહ્ન, ૨૦૧૮, આર. આર. શેઠ ઓન્ડ કંપની પ્રા.લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૨૮, રૂ. ૧૫૦.

પરિષદવૃત્ત

સંકલન : કીર્તિદા શાહ

આજીવનસભ્યમિત્રો,

નમસ્તે,

સાહિત્ય પરિષદના ચી. મં. ગ્રંથાલયના સ્થાપના દિવસની ઉજવણી તા. ૧૭-૦૩-૨૦૨૧ના રોજ થઈ. ઉજવણીના ભાગડુપે ચીમનલાલ મંગળદાસનો ફોટો ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. પરિષદમુખ અને ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનોએ ફોટાની અનાવરણવિધિ કરી. આ પ્રસંગે શ્રીમતી માયાબહેન અને શ્રી વિપુલ આચાર્યએ કવિશ્રી જ્યંત પાઠક અને ઉશનસ્કુના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ કરી. કવિશ્રી જ્યંત પાઠક અને ઉશનસ્કુના કવિતા સંદર્ભ સતીશ વ્યાસ અને યોગેશ જોશીના મનનીય પ્રવચનો થયા.

જેમનું નામ ગ્રંથાલય સાથે જોડાયેલું છે તે ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં અને ગ્રંથાલયના દુર્લભ પુસ્તકોને ડિજિટાઇસ કરવા માટે રૂ. ૭.૫૦ લાખની સખાવત કરી. સખાવત કરનારા ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનો પ્રત્યે પરિષદ આભારની લાગણી વ્યક્ત કરે છે. ગ્રંથાલયમંત્રીશ્રીના ઉત્સાહ અને મહેનતથી કાર્યક્રમ દીપી ઊઠ્યો.

પરિષદના ઉપક્રમે વિકાસમંત્રીશ્રીએ તા. ૨૮-૩-૨૧ના રોજ ‘વાર્તા રે વાર્તા’ શીર્ષકથી ઓનલાઈન એક કાર્યક્રમનું આયોજન કર્યું. આ જૂમ કાર્યક્રમનું સરસ સંચાલન શ્રી નરેશ કાપડિયાએ કર્યું. વાર્તાકાર યોગેશ જોશી અને કુમાર જૈમિની શાક્ખીની વાતાઓનું કણ્ણપ્રિય પઠન શ્રી નરેશ કાપડિયાએ અને શ્રી યામિની વાસે કર્યું. પછી બંને સર્જકોએ પોતાની કેફિયત રજૂ કરી. ઘણાં રસિક મિત્રોએ આ જૂમ કાર્યક્રમનો લાભ લીધો.

વિકાસમંત્રીશ્રીના પ્રયત્નોથી પરિષદને બે વ્યાખ્યાનમાળાઓ માટે દાન મળ્યા. (૧) નાટ્યકાર દિલીપ મોદી સ્મૃતિ વ્યાખ્યાનમાળા માટે ૧,૫૦,૦૦૦નું દાન, (૨) નાટ્યકાર સ્વ. અનંગ મહેતા સ્મૃતિ વ્યાખ્યાનમાળા માટે ૨,૦૦,૦૦૦નું દાન. પરિષદને વ્યાખ્યાનમાળા માટે દાન આપનારા શ્રીમાન દિલીપ મોદી અને શ્રીમાન સ્વ. અનંત મહેતાના કુટુંબીજનો પ્રત્યે પરિષદ આભારની લાગણી વ્યક્ત કરે છે.

નવા આજીવન સભ્યપદ માટે પરિષદે ફી વધારો કરવાની તારીખ ૩૦ જૂન સુધી લંબાવી છે. ૩૦ જૂન સુધી આજીવન સભ્ય ફી રૂ. ૨૦૦૦/- અંકે રૂ. બે હજાર રહેશે. સંસ્થાસભ્ય ફી રૂ. ૫૦૦૦ રહેશે. ૩૦ જૂન પછી આજીવન સભ્યપદ માટે રૂ. ૩૦૦૦ થશે.

આજીવન સભ્યપદ માટેના સુધારણા ફોર્મમાં સભ્યો આધારકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરી શકશે.

પરદેશમાં વસતા આજીવન સભ્યોએ તેમની ઓળખ માટે પાસપોર્ટના પ્રથમ અને

અંતિમ પૂજની એરોક્ષ મોકલવાની રહેશે. આજીવન સભ્યપદ સુધારણાનું ફોર્મ મોકલવાની તારીખ ૩૦ જૂન કરવામાં આવી છે.

મિત્રો, સૌને સાદર વિનંતી છે કે આપ સૌ આપનું આજીવન સભ્યપદ સુધારણાનું ફોર્મ સત્તવે માંગ્યા પ્રમાણેની સથળી વિગત ભરીને મોકલશો.

આપ સૌ હાઈકોપીમાં ફોર્મ મોકલશો તો કામ કરવામાં સરળતા થશે. પરંતુ એ અનુકૂળ ન થાય તો આપ આપનું ફોર્મ ભરીને પરિષદ પર અહીં દર્શાવીલ આઈ.ડી. પર મેઈલ કરશો.

મેઈલ આઈ.ડી. - gspamd123@gmail.com, - parabgsp@gmail.com

અથવા

અહીં દર્શાવીલ મોબાઇલ નં. પર વોટ્સઅેપ કરશો.

ચન્દ્રકાંત ભાવસાર (મો. નં. ૮૭૭૩૨ ૨૨૪૨૫, ૮૫૩૭૯ ૭૧૦૭૩)

અભિનંદન વર્ષા

અમદાવાદ સ્થિત કાવ્યમુદ્રા સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૮નો વિનોદ ટેવાતિયા એવોઈ કવિશ્રી યજેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિશ્રી ભાવેશ ભંને શ્રી મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ ધામ તલગાજરડામાં આપવામાં આવ્યા હતા.

ડૉ. ચન્દ્રકાંત મહેતાને ભારત સરકાર દ્વારા ‘શિક્ષણ અને સાહિત્ય’ માટે પદ્મશ્રી એવોઈ અર્પણ કરવામાં આવ્યો.

કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પારિતોષિક

વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોઈ હરીશ મીનાશ્વના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને અર્પણ થયો છે.

સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષા માટેનો બાલસાહિત્ય પુરસ્કાર શ્રી નટવર પટેલના બાલવાર્તાસંગ્રહ ‘ભૂરીની અજાયબ સફર’ને આપવાનું જાહેર થયું છે.

‘જૂઈ મેળો’ પારિતોષિક ૨૦૨૧

શ્રીમતી હીરાબહેન પાઠક વિવેચન પારિતોષિક ડૉ. પારુલ કંદર્પ દેસાઈને મળે છે.

શ્રીમતી કોકલ-હીરા કાવ્યકલા પારિતોષિક શ્રીમતી પારુલ ખખ્ખરને મળે છે.

શ્રીમતી રિમતાબહેન કિરીટભાઈ શાહ નવલિકા પારિતોષિક શ્રીમતી પૂજા તત્ત્વસતને મળે છે.

‘વિદેશિની’ પના નાયક નવોદિત પારિતોષિક સુશ્રી રશ્મિ જાને મળે છે. સર્વને અભિનંદન.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને તેના ઘટકોનાં અંદાજપત્રોનું સમગ્ર ચિત્ર

ક્રમ	સંસ્થાનું નામ	અંદાજિત (૨૦૨૦-૨૧)	વાસ્તવિક ખર્ચ (૨૦૨૦-૨૧)	તરફાવાન (૨૦૨૦-૨૧)	ખર્ચનો અંદાજ (૨૦૨૧-૨૨)	આવક (૨૦૨૧-૨૨)	આવક સેંડલ્ફ (૨૦૨૧-૨૨)
૧	ગુજરાતી સાહિત્ય પરિષદ	૫૪,૨૬,૩૦૦	૩૫,૧૨,૩૩૮	-૧૮,૧૬,૬૬૧	૫૪,૪૨,૦૦૦	૩૭,૩૧,૭૪૬	-૧૭,૧૦,૨૫૪
૨	કૃ. લા. સ્વાધ્યાયમંદિર	૨૪,૧૧,૩૪૬	૧૮,૧૮,૦૮૭	-૪,૫૨,૨૪૮	૨૧,૬૪,૭૪૬	૨૦,૦૨,૦૦૦	-૧,૬૨,૭૪૬*
૩	શી. મ. ગ્રંથાલય	૭,૮૩,૬૩૦	૬,૮૮,૬૩૭	-૮૪,૮૮૩	૬,૩૧,૫૬૧	૫,૫૧,૦૦૦	-૮૦,૫૬૧
	કુલ રકમ.....	૮૬,૨૪,૨૭૬	૬૧,૨૦,૦૭૩	-૨૫,૦૪,૨૦૩	૮૨,૬૮,૩૦૭	૬૨,૮૪,૭૪૬	-૧૮,૮૩,૫૬૧

* ગ્રાન્ટપત્ર રકમ

ગુજરાતી સાહિત્ય પરિષદ - અધેર (૨૦૨૧-૨૨)

ક્રમ	ખર્ચની વિગત	અંદાજ	વાસ્તવિક ખર્ચ	અંદાજ કરતાં	અંદાજ
૧	મુનિસિપલ ટેક્સ	૨૦૨૦-૨૧	૨૦૨૦-૨૧	વધારો	વધારો
૨	વીમા ખર્ચ	૨,૧૫,૦૦૦	૧,૬૬,૫૧૩	૪૮,૪૮૭	૧,૬૦,૦૦૦
૩	ઓર્ડર ફી	૬,૦૦૦	૫,૬૬૪	૩૩૬	૬,૦૦૦
૪	બેંક કમિશન તથા એક બુક ચેકચેક	૭૦,૦૦૦	૫૪,૭૨૩	૧૫,૨૭૭	૬૦,૦૦૦
૫	બુગાર ખર્ચ (ક્રમાંકનો પગાર તથા અન્ય દાલોની જોગવાએ) સિક્યુરિટી પગાર (તથા અન્ય)	૧,૦૦૦	૮૫૬	૪૪	૧૦૦૦
૬	ટેલિફોન ખર્ચ	૧૦,૦૦,૦૦૦	૧૦,૪૩,૨૪૮	૫૩,૨૪૮	૨૦,૦૦,૦૦૦
૭	પારિતોપિક, વ્યાયાન્પુરકાર, નિકુંધિક પુરકાર, પ્રવાસખર્ચ (ક્ષાત્રકાર/અધિવેશન)	૧૫,૦૦૦	૧૧,૭૭૫	-	૩,૨૨૪
૮	મફન રિપેરિંગ તથા અન્ય ખર્ચ	૨,૨૫,૦૦૦	૨૫,૫૦૦	૧,૮૫,૫૦૦	૨,૨૫,૦૦૦
૯	'પરાજ'-પ્રકાશન, પોસ્ટેજ રવાનાએ, લૈફક પુરકાર તથા અન્ય	૧,૫૦,૦૦૦	૧,૪૮,૮૪૪	૧,૧૫૬	૧,૫૦,૦૦૦
૧૦	૬ સ્વાધ્યાપન અંગેનો ખર્ચ	૧૮,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	-	૧,૦૦,૦૦૦
૧૧	પ્રકટોક ઘસારા ખર્ચ	૨૨,૩૦૦	૨૨,૩૦૦	-	૨૦,૦૦૦

૧.૨	અન્ય ખરીઓ :- પોર્ટાઇજ, પ્રવાસ, ઇલેક્ટ્રિક બાર્નિંગ, ફન્ચર રિપેરિંગ ખર્ચ, ઓવરટાઇમ, કમ્પ્યુટર રિપેરિંગ ખર્ચ, અન્ય	૭,૦૦,૦૦૦	૩,૮૦,૭૩૬	૩,૮૦,૨૬૪	૫,૦૦,૦૦૦
૧.૩	પરિસ્થિતિક કાચઘરણ, શિબિર કાચઘરણ ચાંચાનામણી, મુદ્દા, નિમંત્રણકાર્ડ, અન્ય પ્રવૃત્તિઓ	૧,૦૦,૦૦૦	-	-	૧,૦૦,૦૦૦
૧.૪	પુસ્તક-પ્રકાશન (વિવિધ પ્રકાશનાંશેષ)	૭,૦૦,૦૦૦	૬૬,૮૬૩	૬,૩૩,૧૩૭	૫,૦૦,૦૦૦
૧.૫	એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્ર	૫૦,૦૦૦	-	-	૫૦,૦૦૦
૧.૬	માતૃભાષા સંવરણ કેન્દ્ર	૫૦,૦૦૦	-	-	૫૦,૦૦૦
૧.૭	મેટ્ટનાન્સ વાળ્ફિક ખર્ચ (રા. વિ. પાઠક)	૨,૦૦,૦૦૦	૮૮,૦૦૦	-	૧,૦૧,૦૦૦
૧.૮	શૈક્ષિક કાચઘરમ (અનુવાદ, માતૃભાષાકીશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમી)	૭૦,૦૦૦	-	-	૭૦,૦૦૦
૧.૯	રવીન્દ્ર ભવન	૩૦,૦૦૦	-	-	૩૦,૦૦૦
૨.૦	રાલીંકર રાવળ વ્યાપારનામણી	૨૫,૦૦૦	-	૨૫,૦૦૦	૨૫,૦૦૦
૨.૧	ચુંટશી ખર્ચ (૨૦૨૦-૨૦૨૧.)	૩,૦૦,૦૦૦	૪,૫૬,૭૧૮	૧,૫૬,૭૧૮	-
	કુટ.....	૪૪,૨૬,૩૦૦	૩૫,૧૨,૩૩૬	૨૧,૨૬,૬૬૭	૪૪,૪૨,૦૦૦

મનીહ આવકો (૨૦૨૦-૨૧)				મનીહ આવકો (૨૦૨૧-૨૨)			
ક્રમ	વિગત	આવક	ક્રમ	વિગત	આવક	ક્રમ	આવક
૧	'પ્રેરણ' લાગ્જામ	૫૬,૫૫૦	૧	'પ્રેરણ' લાગ્જામ	૫૦,૮૦૦	૧૪	ડાનાએક
૨	સામાન્ય સાલ્ફી	૧,૪૦૦	૨	સામાન્ય સાલ્ફી	૨,૪૦૦	૧૫	ડાનાએક
૩	સંસ્કૃતાંતરણ ક્રી	૨,૬૦૦	૩	સંસ્કૃતાંતરણ ક્રી	૨,૮૦૦	૧૬	ચાન્દી
૪	આજુવન સાલ્ફી	૫૬,૦૦૦	૪	આજુવન સાલ્ફી	૫૮,૦૦૦	૧૭	ચાન્દી
૫	મનીહ વપરાશ ક્રી (ગોવનિન સંમિંદર)	૨૫,૦૫૦	૫	મનીહ વપરાશ ક્રી (ગોવનિન સંમિંદર)	૨૮,૦૫૦	૧૮	ચાન્દી
૬	મનીહ વપરાશ ક્રી (૨૧. જી. પાઠક)	૫૬,૦૦૦	૬	મનીહ વપરાશ ક્રી (૨૧. જી. પાઠક)	૫૮,૦૦૦	૧૯	ચાન્દી
૭	ફર્મની	૫૮,૦૨૨	૭	ફર્મની	૫૯,૬૦૦	૨૦	ચાન્દી
૮	ફર્મની	૫૯,૬૦૦	૮	ફર્મની	૬૧,૨૦૦	૨૧	ચાન્દી
૯	અંગુલાંદી	૧૨,૭૭૭	૯	અંગુલાંદી	૧૩,૩૦૦	૨૨	ચાન્દી
૧૦	ફર્મની	૬૭,૦૦૦	૧૦	ફર્મની	૭૪૫	૨૩	ચાન્દી
૧૧	ફર્મની	૭૪૫	૧૧	ફર્મની	૧૦,૦૦૦	૨૪	ચાન્દી
૧૨	અંગુલાંદી	૧૦,૦૦૦	૧૨	અંગુલાંદી	૧૦,૦૦૦	૨૫	ચાન્દી
૧૩	ફર્મની	૫૦,૦૦૦	૧૩	ફર્મની	૫૦,૦૦૦	૨૬	ચાન્દી
૧૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૧૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૭	ચાન્દી
૧૫	ફર્મની	૫૦,૦૦૦	૧૫	ફર્મની	૫૦,૦૦૦	૨૮	ચાન્દી
૧૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૧૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૯	ચાન્દી
૧૭	ફર્મની	૫૦,૦૦૦	૧૭	ફર્મની	૫૦,૦૦૦	૩૦	ચાન્દી
૧૮	અંગુલાંદી	૫૦,૦૦૦	૧૮	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૧	ચાન્દી
૧૯	ફર્મની	૫૦,૦૦૦	૧૯	ફર્મની	૫૦,૦૦૦	૩૨	ચાન્દી
૨૦	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૦	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૩	ચાન્દી
૨૧	ફર્મની	૫૦,૦૦૦	૨૧	ફર્મની	૫૦,૦૦૦	૩૪	ચાન્દી
૨૨	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૨	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૫	ચાન્દી
૨૩	ફર્મની	૫૦,૦૦૦	૨૩	ફર્મની	૫૦,૦૦૦	૩૬	ચાન્દી
૨૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૭	ચાન્દી
૨૫	ફર્મની	૫૦,૦૦૦	૨૫	ફર્મની	૫૦,૦૦૦	૩૮	ચાન્દી
૨૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૯	ચાન્દી
૨૭	ફર્મની	૫૦,૦૦૦	૨૭	ફર્મની	૫૦,૦૦૦	૪૦	ચાન્દી
૨૮	અંગુલાંદી	૫૦,૦૦૦	૨૮	અંગુલાંદી	૫૦,૦૦૦	૪૧	ચાન્દી
૨૯	ફર્મની	૫૦,૦૦૦	૨૯	ફર્મની	૫૦,૦૦૦	૪૨	ચાન્દી
૩૦	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૦	અંગુલાંદી	૫૦,૦૦૦	૪૩	ચાન્દી
૩૧	ફર્મની	૫૦,૦૦૦	૩૧	ફર્મની	૫૦,૦૦૦	૪૪	ચાન્દી
૩૨	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૨	અંગુલાંદી	૫૦,૦૦૦	૪૫	ચાન્દી
૩૩	ફર્મની	૫૦,૦૦૦	૩૩	ફર્મની	૫૦,૦૦૦	૪૬	ચાન્દી
૩૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૪	અંગુલાંદી	૫૦,૦૦૦	૪૭	ચાન્દી
૩૫	ફર્મની	૫૦,૦૦૦	૩૫	ફર્મની	૫૦,૦૦૦	૪૮	ચાન્દી
૩૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૩૬	અંગુલાંદી	૫૦,૦૦૦	૪૯	ચાન્દી
૩૭	ફર્મની	૫૦,૦૦૦	૩૭	ફર્મની	૫૦,૦૦૦	૫૦	ચાન્દી

ગી. મં. ગ્રંથલય અંદરોળુ (૨૦૨૧-૨૨)

ક્રમ	ખર્ચની વિગત	અંદરોળ ૨૦૨૦-૨૧	વાર્ષિક ખર્ચ ૨૦૨૦-૨૧	અંદરોળ કરતાં ધરાયો	અંદરોળ ૨૦૨૧-૨૨
૧	પુનાર (મોંઘલારી, ધરામાડી, સ્થાનિક વળતર તથીની બજેટાંથી, પ્રી. ફંડની) પુરુષક ખર્ચીએ સામનિક ખર્ચીએ	૪,૧૫,૦૦૦	૩,૫૪,૪૨૪	—	૬૦,૫૭૬
૨	પુરુષક બાયન્નિએ ખર્ચ અપ્ટિટ તથા કન્સલિટિએ ફી જેટથનની તથા છપામણી ખર્ચ પ્રવાસ ખર્ચ	૨,૫૦,૦૦૦	૨,૧૪,૬૬૮	૩૪,૦૦૨	૨,૪૦,૦૦૦
૩	અપ્ટિટ બાયન્નિએ ખર્ચ	૫,૦૦૦	૫,૪૫૦	—	૧૦,૦૦૦
૪	જેટથનની તથા છપામણી ખર્ચ	૧૫,૦૦૦	૧૫,૫૭૩	—	૧૫,૦૦૦
૫	પ્રવાસ ખર્ચ	૧,૦૦૦	—	૧,૦૦૦	૫૦૦
૬	અનિસ્ક્રિપ્શન ટેક્સ	૪૪,૦૦૦	૧૪,૫૬૨	૩,૮૮૦	૨,૦૦૦
૭	પ્રેરણ સ્ટોર્ક ધસારા ખર્ચ	૬,૧૩૦	૬,૧૩૦	૪,૪૩૮	૧૮,૦૦૦
૮	ધંક ચાર્જિસ્ટ	૫૦૦	—	૫૦૦	૫૦૦
૯	કમાયટર ખર્ચ	૫,૦૦૦	૪૩,૫૭૯	૩૪,૫૭૯	—
૧૦	લાઇબ્રેરી ખર્ચ (ડાન એન્ટ્રી)	૫,૦૦૦	—	૫,૦૦૦	૫,૦૦૦
૧૧	સ્પેચિના ખર્ચ/ફન્સિયર	૨૫,૦૦૦	—	૨૫,૦૦૦	૨૭,૦૦૦
૧૨	પરચૂરણ ખર્ચ અને ચા-પાષણ	૨૦,૦૦૦	૬,૪૦૦	૧૩,૬૦૦	૨,૦૦૦
૧૩	કુલ.....	૭,૮૨,૬૩૭	૩૪,૫૭૯	૧,૨૫,૫૭૨	૬,૩૧,૫૬૧

* ઠ. ૦૮-૦૨-૨૦૨૧નાંથી અંદરોળની કચેરી ગાંધીનગર તંકથી વાખી ૨૦૨૦-૨૧ માટે રૂ. ૫,૦૦,૦૦૦/- છાન્ટ મળીથાયી આપાની. તી ૩૧-૩-૨૧ સુધીમાં ખર્ચ કરવાની જહેરો તેથી વાસ્તવિક ખર્ચ વધશે.

ચી. મં. ગ્રંથાલય
મળેલ આવકો (૨૦૨૦-૨૧)

ક્રમ	વિગત	રૂ.
૧	વાર્ષિક સભ્ય ફી	૨૫,૧૮૫
૨	અતિદેય ફી	૧,૦૬૩
૩	પસ્તી વેચાણ	—
૪	વ્યાજ આવક (સેવિંગ્સ)	૪,૦૫૦
૫	પરયૂરણ	૨૧૪
૬	ગુજરાત સરકાર તરફથી ગ્રાન્ટ	૫,૦૦,૦૦૦
૭	દાન આવક ફિક્સડ ડિપોઝિટ (વ્યાજ આવક)	—
	કુલ રકમ.....	૫,૩૦,૫૧૨

ચી. મં. ગ્રંથાલય
મળવાપાત્ર આવકનો અંદાજ (૨૦૨૧-૨૨)

ક્રમ	વિગત	રૂ.
૧	વાર્ષિક સભ્ય ફી	૩૫,૦૦૦
૨	અતિદેય ફી	૪,૦૦૦
૩	બુક લોસ્ટ	૧,૦૦૦
૪	વ્યાજ આવક (સેવિંગ્સ)	૫,૦૦૦
૫	પસ્તી વેચાણ (આવક)	૬,૦૦૦
૬	ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર ગ્રાન્ટ	૫,૦૦,૦૦૦
૭	વ્યાજ આવક (શ્યાયી ફંડ)	—
	કુલ રકમ.....	૫,૫૧,૦૦૦

શ્રી કસ્તુરમાઈ લાલમાઈ સ્વાધ્યાયમંડિર : અંદાજપત્ર (૨૦૨૧-૨૨)

ક્રમ	ખર્ચની વિગત	અંદાજ ૨૦૨૦-૨૧	વારસ્તવિક ખર્ચ ૨૦૨૦-૨૧	વધારો	અંદાજ કરતાં ઘટાડો	અંદાજ ૨૦૨૧-૨૦૨૨
૧	પુણાર : (મોંદવારી, ધરણાદિં, સ્થાનિક વળીતર, તબીબી ભથ્થાંઓ વગેરે) અન્ય ખર્ચાંઓ : સ્ટેશનારી, ટેલિફોન, વીજળી, પોસ્ટાજ, પ્રવાસ, પરયુદ્ધ, કંચ્ચયટર ચાર્જ, સાર્વિસ ચાર્જ, બેંક કમિશન, પુરાવળી યુનિફોમ ખર્ચ, પ્રિન્ટિંગ, ખર્ચ તથા અન્ય ખર્ચાંઓ શિલ્પિઓ તથા પરિસેવાદ ખર્ચ પુસ્તક-સમાધા (અંધગોળીના કાર્યક્રમો) ગ્રાન્યાલ્યુ-પુસ્તક ખર્ચીએ સામન્યિક ખર્ચીએ કબાર ખર્ચીએ મકાન વપરાશ ઔદ્યોગિક ખર્ચ પુસ્તક બાણિંગ ખર્ચ ઔદ્યોગ તથા કષ્ટલિયા ફી	૨૨,૦૦,૦૦૦	૧૮,૧૫,૮૮૬	-	૩,૮૪,૧૦૪	૨૦,૦૦,૦૦૦
૨	૭૫,૦૦૦	૪૦,૩૩૪	-	૩૪,૬૬૪	૬૦,૦૦૦	
૩	૩૦,૦૦૦	-	-	૩૦,૦૦૦	૩૦,૦૦૦	
૪	૧૨,૦૦૦	-	-	૧૨,૦૦૦	૧૨,૦૦૦	
૫	૨૫,૦૦૦	૨૫,૦૦૦	-	-	૨૫,૦૦૦*	
૬	૯,૮૦૦	૮,૮૦૦	-	૨,૧૦૦	૭,૦૦૦*	
૭	૨૨,૦૦૦	-	-	૨૨,૦૦૦	૨૨,૦૦૦*	
૮	૧૮,૭૪૬	-	-	-	૧૮,૭૪૬*	
૯	૩,૦૦૦	૧,૪૨૦	-	૧,૫૮૦	૨,૦૦૦*	
૧૦	૫,૦૦૦	૧,૪૦૦	-	૫,૦૦૦	૫,૦૦૦*	
૧૧	૧૨,૬૦૦	૧૧,૮૦૦	-	૮૦૦	૧૨,૦૦૦*	
	કુલ.....	૨૪,૧૧,૩૪૬	૧૮,૧૮,૦૮૭	-	૪,૮૨,૨૪૮	૨૧,૮૪,૭૪૬

* ગ્રાન્યાલ્યુ રૂક્મિ

**ક. લા. સ્વાધ્યાયમંદિર
મળેલ આવકો (૨૦૨૦-૨૧)**

ક્રમ	વિગત	રૂ.
૧	ગુજરાત સરકાર તરફથી ગ્રાન્ટ (પગાર)	૧૮,૧૫,૮૮૬
૨	માન્ય ખર્ચની મળેલ ગ્રાન્ટ (વર્ષ ૨૦૧૮-૧૯)	૫૦,૦૦૦
૩	સેવિંગ્સ ખાતા પર મળેલ વ્યાજ	૨,૨૦૦
	કુલ રકમ.....	૧૮,૬૮,૦૮૬

**ક. લા. સ્વાધ્યાયમંદિર
મળવાપાત્ર આવકનો અંદાજ (૨૦૨૧-૨૨)**

ક્રમ	વિગત	રૂ.
૧	ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર ગ્રાન્ટ (પગાર)	૨૦,૦૦,૦૦૦
૨	સેવિંગ્સ ખાતા પર મળવાપાત્ર વ્યાજ	૨,૦૦૦
	કુલ રકમ.....	૨૦,૦૨,૦૦૦

વિશેષ

ગુજરાતી કવિતાની તાસકમાં બનારસી પાનનું બીડું : બનારસ ડાયરી

અજયસિંહ ચૌહાણ

ગુજરાતના સાહિત્ય જગતમાં જે સમાચારની ઘણા વર્ષોથી રાહ જોવાતી હતી એ આખરે હમણાં મળ્યા. સાહિત્ય અકાદમી, હિલ્ટીનો બે હજાર વીશનો વાર્ષિક પુરસ્કાર આપણી ભાખાના વિશિષ્ટ કવિ હરીશ મીનાશ્રુના બનારસ ડાયરી (પ્ર.આ. ૨૦૧૬, પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ)ને જાહેર થયો. હરીશ મીનાશ્રુ અનુઆધુનિક સમયના મહત્વના કવિ તો છે સાથેસાથે ગુજરાતી કવિતા પ્રવાહના વિશિષ્ટ રમણીયતા આપનાર સંપ્રેષણ કવિ છે. તેમને ગુજરાતના મહત્વના પુરસ્કારો, જેવા કે નરસિંહ મહેતા એવોર્ડ, વલી ગુજરાતી ગજલ એવોર્ડ, નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ, ભારતીય કક્ષાએ મહત્વ ધરાવતું કુસુમાંજલિ સાહિત્ય સન્માન (ગુજરાતી) ઉપરાંત સાહિત્ય અકાદમીનું અનુવાદ પ્રાઇઝ જેવાં અનેક મહત્વનાં સન્માન પ્રાપ્ત થયાં છે. તા. ૦૩/૦૧/૧૯૫૪ના રોજ આંદ મુકામે જન્મેલા હરીશ કૃષ્ણારામ દવે એટલે કે હરીશ મીનાશ્રુ પાસેથી, ઈ.સ. ૧૯૮૮માં પ્રકટ થયેલા ‘શ્રિબાંગસુંદર એણીપેર ડેલ્યા’-થી શરૂ કરી ‘સુનો ભાઈ સાધો’, ‘તાંબુલ’, ‘તાંદુલ’, ‘પંજન્યસૂક્ત’, ‘પદપ્રાંજલિ’, ‘શબદમાં જિન્કું ખાસ ખબરાં પડી’, ‘પંખીપદારથ’, ‘નાચિકેતસૂત્ર’ અને ‘બનારસ ડાયરી’ એમ દસ્કાવ્યસંગ્રહો મળે છે. એ દસે કાવ્યસંગ્રહોમાં કવિ નોખી નોખી રીતેભાતે વ્યક્ત થાય છે. પ્રબળ કવિ પ્રતિભા વગર આવું રસનિષ્ઠ સાતત્ય જીગવતું શક્ય નથી. ગીત, ગજલ, અછાંદસ, ગઘકાય, છંદોબદ્ધ રચનાઓ એમ કવિતાનાં અનેક સ્વરૂપોમાં એક સમાન સામર્થ્યથી વિહરતા આ કવિનું પ્રદાન કાવ્યભાવકો અને કાવ્ય મર્મજો-ઉભયને પ્રસંગકર રહ્યું છે. હરીશ મીનાશ્રુ કાવ્યસર્જન ક્ષેત્રે પ્રવૃત્ત થાય છે એ સમય આધુનિકતાનો હતો. આધુનિક કવિઓની વિદ્રોહભરી ભાષા-અભિવ્યક્તિ રીતિઓની સર્વત્ર ચર્ચાઓ હતી. એ બધાની વચ્ચે ‘શ્રિબાંગ સુંદર...’થી એમણે પોતાની એક નોખી મુદ્રા અંકિત કરી અને પછી સતત નિજલીલાપૂર્વક એમનો શબ્દ વિલસતો ગયો. એમની કવિતામાંથી પસાર થતાં ત્રણ બાબતો તારવી શકાય.

૧. શરૂઆતની ‘શ્રિબાંગ સુંદર...’ જેવી રચનાઓમાં વ્યક્તિની અભ્યંતર રહેલા વિભાજિત વ્યક્તિત્વ અને સમકાલીન સાહિત્ય પરિવેશ સહિત સ્વયંનું વિંબન કરતી કવિતા.

૨. ‘સુનો ભાઈ સાધો’, ‘તાંદુલ’, ‘તાંબુલ’, ‘પદપ્રાંજલિ’, ‘શબદમાં જિન્કું ખાસ ખબરાં પડી’, ને ‘બનારસ ડાયરી’ જેવા સંચયોમાં સંતમત અને મધ્યપૂર્વના ફીરોની દાર્શનિકતા, કબીરની પ્રેમ લક્ષ્ણજાથી સભર જ્ઞાનમીમાંસા અને સાંસારિક અનુભવોથી ચૈતન્ય તરફની અંતરમુખ ગતિ આદિની કવિતા.

૩. પંખીપદારથમાં જીવન, જગત, ગાઈસ્થ્ય આહિની કલ્પનોથ અભિવ્યક્તિ સમાજનરચનાઓ ઉપરાંત સામાજિક સંદર્ભ, સામાજિક નિસબ્ધતને સંકેતતી કવિતા.

અભ્યાસની સરળતા માટે ભલે આપણે આ કવિતાઓનું આવું વગીકરણ કરીએ, પણ આ રચનાઓ એકબીજાથી પૃથક અને સ્વ-તંત્ર હોવાની સાથેસાથે પ્રચ્છન્ન પ્રકારનું દાર્શનિક અનુસંધાન પણ રચતી રહે છે એ નોંધવું રહ્યું.

સાહિત્ય અકાદમી પુરસ્કાર સર્જકના એક પુસ્તકને કેન્દ્રમાં રાખી આપવામાં આવે છે પણ એની પાછળનો આશય તો (જૂઝ અપવાદોને બાદ કરતાં) મહદેંશે પુસ્તકને નિમિત્ત બનાવીને સર્જકની સર્જનશીલતાને પોંખવાનો હોય છે. એ રીતે ‘બનારસ ડાયરી’ એ નિમિત્ત છે હરીશ મીનાશ્વુના સમગ્ર સર્જનને પોંખવાનું. ‘બનારસ ડાયરી’માં એ પ્રાચીન નગરીના સ્થળાક્ષી વિશેખની સાથે સ્થળાતીત બનારસનો ગૂઢ સંદર્ભ ગૂથાતો રહે છે, એની મિથીકલ પ્રાચીન પવિત્રતાની સાથેસાથે અર્વાચીનનાં સુંદર અસુંદર અંશો પણ વણપાતા જાય છે. ડાયરી શબ્દથી જાત સાથેના અંતર્સ્વાદનું ઈંગ્રિત પણ રચાય છે. સંગ્રહના પ્રથમ કાવ્ય ‘બનારસ ડાયરી-૧’માં રતિકીડા અને કાવ્યકીડાના સંકેતોના અપૂર્વ સાહયર્થી કવિ ‘સુબહે બનારસ’નું સંકુલ પણ વિસ્મયકારી ચિત્ર આપે છે.

‘કવિના ખરિયાની ગહેરાઈમાં ધૂસે છે અનંગ/એક કિત્તો તંગ/ ચિત્તની છીપોલીમાં જરામરણનાં ઝેરકોચલા જેવું વાંગમય/ લહીને લોહીનો લય/ બની જાય છે ટઠકણા સરીખું કઠણ/તથદધન/ જેવું કાસુક મન/ ઈશારા કરે છે મોઘમ, જાણો પફબભમ/ યરલવશ હણહણીને ઉછાળે છે/ આગળના બે પગ કામવશ’

‘બનારસ ડાયરી’ ગુચ્છની રચનાઓમાં કબીર એક પાત્ર લેખે પણ હાજરાહજૂર છે. ગુચ્છની ચોથી રચનાઓ જુઓ :

“એ દિવસે મારો જનમ દિન હતો/ એટલે મારા ચહેરા પર/ વિખાણી વંજનામાં પરિપક્વ બનેલો આનંદ હતો/ મને એટલી તો ખબર હતી કે/ એમનું જનમ વર્ષ ઈસવીસન તેરસો નવ્વાણુ/એટલે સમજોને, લગભગ છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને/કબીર ખાસ મને વધામણી ખાવા આવ્યા.”

હહી છસો વર્ષ પહેલાં થઈ ગયેલા કબીર આજની ક્ષણે પધારે છે તો એ છસો પ્રકાશવર્ષ કાપીને આવે છે. આ વિજ્ઞાનપરક શબ્દથી કવિ રાધાસ્વામી સંતમત નિર્દેશિત અંતરતમ ચૈતન્યદેશ કે જેમાં સત્તપુરુષનો વાસ છે, એની ગહનતાનો, એના ચૈતસિક અંતરનો સહજ સંકેત તો કરી જ આપે છે પણ વર્ષ સાથે પ્રકાશ શબ્દ સાંકળીને એને જ્યોતિર્મયતા સાથે પણ જોડી આપે છે. આ કાવ્યગુચ્છની અગ્નિયારમી રચનામાં મણિકર્ણિકા ધાટના સ્થળગુપ્તના વર્ણનની સમાંતરે જીવનમરણના પ્રતીકો સમેટતું મણિકર્ણિકાનું સૂક્ષ્મ રૂપ રચાતું જાય છે. આ લયાન્વિત રચનામાં કર્ણિકા શબ્દની એકાવિક અર્થચાયાઓનો કાવ્યાત્મક વિનિયોગ થયો છે. ‘બનારસ ડાયરી’નાં કાવ્યો જ નહીં, પણ કવિની સમગ્ર કવિતામાંથી પસાર થતાં જે પહેલું પાસું તરત નજરે પડે છે એ એની ભાષા. વાચકના ચિત્તમાં પહેલાં સ્પષ્ટિત થાય છે કવિની ભાષાની રમણીયતા. કેટલાક કવિઓની કવિતામાં પ્રથમ સંવેદન સ્પર્શતું હોય છે અથવા રચનાપ્રયુક્તિ પર પહેલી

નજર ઠરતી હોય છે. પણ હરીશ મીનાશ્વરીની કવિતામાં ભાષાકીડાનાં રહસ્યો ઉકેલ્યા બાદ સંવેદન અને વંજનાના તંતુઓ ખૂલતા હોય છે. એમની કવિતામાં ભાષાનાં એવાં વિબિન્ન સતરો એક કાવ્યમાં આવીને બેસી જતાં હોય છે, છતાં નહીં સાંધો નહીં રેણીની જેમ અભિલાઘનો અનુભવ કરાવે છે. એમના ‘તાંબુલ’ સંગ્રહની પંક્તિઓ જુઓ :

‘અમે ઉઘાડા તાસક જેવા મધ્ય તિકત તાંબુલ
જડપ બીજું અધિ બલમ પિંજરે મૈના અનિવ્યાકૃત’

અહીં શરૂઆતની અરધી પંક્તિમાં ગુજરાતી પદાવલી પછી સંસ્કૃત તત્ત્વમ શર્દું પ્રયોગો અને બીજી પંક્તિમાં વ્રજ-હિન્દી એમ ભાષાના વિવિધ સતરો હોવા છતાં ક્યાંય કોઈ પદ આગાંતુક લાગતું નથી. એજ રીતે બનારસ ગુરુના તેરમાં કાવ્યમાં ભાષા-લય, કાવ્ય સ્વરૂપોના અનેક સતરો છે ને બનારસના અનેક સંદર્ભો.

સંગ્રહના બીજાં બે કાવ્યગુચ્છો છે ‘ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ’ અને ‘કવિતા વિષે ચાટૂક્તિઓ’. ચન્દ્ર વિષે ચાટૂક્તિઓમાં પ્રતિપદાથી પૂનમના ચન્દ્રની વિવિધ કળાઓ સાથે જીવનનાં અનેક રૂપો છે. અહીં ‘કોઈ શિશુના કુમળા રુદ્ધનની ઓકળીઓ છે’ તો નરસિંહ અને બળવંતરાય ઠાકોર જેવા પૂર્વસૂરિઓની રચનાઓનાં અવનવાં આલંબનો પણ છે.

‘ન માગવાનું માગી બેસે છે/ક્યારેક કોઈ કવિ/ ભાષા પહેલાં તો મુંગાઈ મરે છે/ પછી તરત એને જરી આવે છે/ એ ચન્દ્રપઢુને પટાવવાનો એક મિથિકલ નુસારો/ જળ ભરેલી થાળીમાં ઊતરી આવે છે/ ચળકતું ચાંદરણું/ કવિ બની જાય છે પ્રસત્ત/ ને ભાષા ધર્મ’

બાળ રામની ચાંદો માગવાની જીદ અને એ પ્રસંગને વર્ણવતી પૂર્વસૂરિઓની રચનાઓના આલંબને અહીં કવિ અને ભાષાની વચ્ચે નિરંતર ચાલ્યા કરતી મથામણનો સંદર્ભ છે. એજ રીતે ‘બેઠી ખાટે/ ફરિ વળણ બધે/ (ઓહ થેન્ક ગોડ, અહીં નથી પાળવાના લધુ-ગુરુના કશાય મલાજા) મેરિયો ઓરડામાં/ ને છેલ્લે/ ધબધબ કરતી બજે પગથિયાં સાથે ચાડતીકને/ પહોંચે ગઈ અગાસીમાં/ કે અચાનક જરી આવ્યો/ કેટલાય દહાડાથી/ ખોઈ નાયેલો/ ચન્દ્ર/ પડેશાનો’

આ કાવ્યમાં બળવંતરાય ઠાકોરના ‘જૂનું પિયરધર’ના આલંબને એક નવો સંદર્ભ કવિ રચે છે. લધુગુરુની છૂટ લેતા બ.ક.ઠ. જેવા દિગ્ગજ પૂર્વજની મીઠી મશકરી પણ કરી લે છે.

‘કવિતા વિષે ચાટૂક્તિઓ’ની બાર રચનાઓમાં કવિતાકળા, કવિતાની સમજ, કવિતાના કાર્યને કવિ અનેક સંદર્ભોથી વળ ચડાવે છે. ‘કરુણાભર્યા/હાડકાના દાગતરની જેમ/ કવિતા સર્જરી કરે છે/ ને કાળજીપૂર્વક/ બદલે છે દુષ્યારી કીડીના વુંટણના સાંધ્યા’ છેલ્લી ચાટૂક્તિમાં ‘તોપના નાળચામાં કવિતા સેવે છે એકકાડી હું’ જેવી પંક્તિ દ્વારા યુદ્ધના કલ્પનની સામે કવિ અને ભંગુર દીગાનું કલ્પન મૂકીને જીવસટોસટ વિદ્રોહની ભૂમિકા રચી આપે છે.

ઉપરકત કાવ્યગુચ્છો ઉપરાંત ‘બનારસ ડાયરી’માં ‘માણસો : અતડા-મળતાવડા’, ‘પેઢીનામું’, ‘પુત્રવધુને’, ઉડવા વિષે’, ‘ઊઘડવા વિષે’, ‘ફોબિયા’,

‘વાંધાઅરજી’, ‘શાદ્વ’ જેવી રચનાઓ છે. જેમાં ‘માણસો : અતડા-મળતાવડા’ને ‘વાંધાઅરજી’ જેવાં કાવ્યોની કથનશૈલી ધ્યાનપાત્ર છે. એજ રીતે ‘પંખીપદારથ’ના ‘ગૃહસ્થસંહિતા’નું અનુસંધાન અર્હી ‘પેઢીનામુ’ અને ‘પુત્રવધુને’એ રચનાઓમાં છે. આ બંને રચનાઓમાં કવિ પોતાના કુળ-મૂળ અને પુત્રવધુ દ્વારા થતાં એના વિસ્તારને કથનની અવનવી શૈલીથી વંજિત કરે છે. ‘પાછોતરા વરસાદ’માં તેમની અગાઉની પર્જન્યસૂક્તાની રચનાઓથી ભિન્ન એવું વરસાદનું એક રસાર્વ ચિત્ર ઊભું થાય છે. ‘બનારસ ડાયરી’ની અંતિમ રચના ‘શાદ્વ’ એ મૂળી તો કવિની સર્જનાધીન મહત્વાકાંક્ષી રચના ‘રત્નાકરભૂષણ પ્રબંધ : એક જ્ઞાતક-કથા’ નામની સુ-દીર્ઘ રચનાનો એક સ્વતઃસંભવા ખંડ છે, જે સ્વતંત્ર અભ્યાસ ખેમે તેવી રચના છે. ‘શિબાંગ સુંદર...’માં જેમ સાહિત્યિક પરિવેશનું વિ-રૂપણ અને વિડંબન છે, એમ આ રચનામાં ધાર્મિક વિધિવિધાનોનું વિ-રૂપણ અને વિડંબન છે. શાદ્વના ચાલી રહેલાં વિધિવિધાનો અને કવિના ચિત્તમાં ચાલતા ભૂત અને વર્તમાનના સંચલનોની વચ્ચે અનેક સંદર્ભોથી કાવ્ય કવિના અંગત અનુભવને બિનઅંગત બનાવી વિશેષ અર્થ પ્રગટાવે છે. આવી અરુદ્ધ રચનાઓ દ્વારા કવિએ ગુજરાતી કવિતાની તાસકમાં બનારસી પાનનું બીંદુ ‘બનારસ ડાયરી’ રૂપે આપ્યું છે ને એ પુરસ્કૃત થયું એ કવિનું તો સન્માન છે જ એક રીતે ગુજરાતી કવિતાનું પણ સન્માન છે. કવિને ખૂબ અભિનંદન !



સાભાર સ્વીકાર

પ્રક્રીણ

સિંહશાસ્ત્ર : ડૉ. સંદીપકુમાર/ડૉ. નિવેદીતા ગાંગુલી, ૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., મુંબઈ/અમદાવાદ, પૃ. ૨૪૮, રૂ. ૨૮૮. **કામકલતા :** મુનિ શીલગુણવિજ્ય, ૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૬૭, રૂ. ૧૭૫. **સમય સાથે Selfie :** અંકીત નિવેદીત, ૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૧૨, રૂ. ૧૫૦. **ઇશ્વરે આપેલી ભેટ :** અંકીત નિવેદીત, ૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ/અમદાવાદ, પૃ. ૧૧૬, રૂ. ૧૫૦. **અંતરદીપ :** ગણપત ઉપાધ્યાય, ૨૦૧૮, ગરવી વિજન, અમરેલી, પૃ. ૧૨૮, રૂ. ૧૫૦.

આવરણચિત્ર : સંદર્ભનોંધ

સંકલન અને પ્રસ્તુતિ : પીપુષ ઠક્કર

ચિત્રકાર : જનક ત્રિવેદી

(જન્મ : ૧૦ જૂન ૧૯૮૪, કોઈ, તા. જસદાણ, જિ. રાજકોટ - અવસાન : ૨૮ જાન્યુઆરી ૨૦૦૭, ગુવાહારી, અસમ) આવરણચિત્રનું શીર્ષક : વિનાશીર્ષક (Untitled) માધ્યમ : કાગળ પર શાહી, જળરંગ, ફૂલી ફોટોકલર • વર્ષ : ૨૦૦૬

'પરબ'ના પાછલા કેટલાક અંકોમાં ઉર્દૂ, અંગ્રેજી, મલયાલમ, હિન્દી અને મરાಠી લેખક-ચિત્રકારોની એમનાં ચિત્રો/શિલ્પો નિમિત્તે થોડીક વાત કરી. દશ્યકળામાં એમની પશ્યતા વિશે અછાતી માહિતી અંકે કરી. આ અંકે ગુજરાતી ભાષાના સુખ્યાત વાતાવાર-નિબંધકાર સદ્ગત જનક ત્રિવેદી વિશે વાત કરીએ.

જનક ત્રિવેદીએ સાહિત્યકારો અને મિત્રોના કેરિકેચર્સ આલેખ્યાં છે, કેટલાક પુસ્તકોનાં આવરણ કર્યા છે, અને રેખાઓનો અને રંગીન ચિત્રો રચ્યાં છે તેમજ મરોડાર અક્ષરે પત્રો-નિબંધો-વાર્તા લખ્યાં છે. એમણે વિખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રાજાની જિંદગી અને કલા પર રજા અને અશોક વાજેયોએ સંયુક્તપણે લખેલા પુસ્તક 'આત્માની ધ્યાબ' (૨૦૦૭)નો ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યો છે. ચિત્રકાર જનક ત્રિવેદીનો વિશેખ : અક્ષરોમાં મરોડ, રેખાઓનો લયાન્વિત, કેરિકેચર્સમાં સફાઈદાર-સુરેખતા અને ચિત્રોમાં વાસ્તવનું આકલ્યન રચવાને રંગ અને રેખામાં નિર્બધ પ્રયોગશીલતા.

આ આવરણચિત્રમાં જનક ત્રિવેદીની એક ચિત્રકાર તરીકેની પ્રૌઢીનો અંદાજ મળે છે. અનુભવે આકારેલી કલાસ્કૂલનું એ પરિચાયક છે. આમ સ્વયંસંચાલિત ચિત્રાણનો આભાસ રચે છે, પણ ચિત્રકારની રંગ-પસંદગી અને છાંટ-બહેલાવ, રેખાઓનાં વાંકવળાંકમાં ચિત્રકારની અંતઃસ્હૂણાનું પ્રમાણ મળે છે. ચિત્રને બે ભાગમાં વહેંચતા રંગપ્રવાહની પદ્ધતિએ છે જીવસૂચિનો અકળ પુદ્ગલ, સતત પરિવર્તનશીલ અને છતાં સ્થિતિયુસ્થ. ચહેરો, આંખ, હાથ - આમ વિવિધ ધારણાઓ ઈંગ્રિત કરતી ચિત્ર-માંડળી ચિત્રકારે ધણાં ખંત અને ધૈર્યથી કરી છે. નહીંતર, વારંવાર રંગના થર ચઢાવવાનું અને રેખાઓના ચિત્રાવકાશને સંગોપવાનું શક્ય બન્યું ન હોતું.

તાજેતરમાં જ જનક ત્રિવેદીના નિબંધસંગ્રહ 'મારો અસભાબ' (૨૦૦૮, ૨૦૨૧)નું નવસંસ્કરણ નવજીવન સાંપ્રત તરફથી પ્રકાશિત થયું છે. પ્રકાશક પુસ્તકની આકર્ષક નયનાભિરામ સંકલ્પના કરી છે. એના આવરણને પણ આ જ ચિત્ર શોભાવે છે. નાની વયથી જ ચિત્રકલામાં હથોટી ધરાવનાર સદ્ગત જનક ત્રિવેદીને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્માં કળાભ્યાસ કરવાના ઓરતા હતા. પણ વિવિની વક્તા એમને રેલવેની નોકરીમાં લઈ ગઈ, જેની ઉપલબ્ધ માટે એમની વાર્તાઓ અને નિબંધો વાંચવા રહ્યા. અંતે, ચિત્રકારના પરિવારને વિનંતી કે સદ્ગતના ચિત્રોનો એક સંપૂર્ણ, ભલે ડિજિટલ તો એમ, પણ સંકલિત કરી વરચ્યુઅલ જગતમાં વહેતો મૂકે.

□

આ અંકના લેખકો

અજયસિંહ ચૌહાણ : ૪૩, શાલિગ્રામ બંગલોઝ, વિનુકાકા માર્ગ, બાકરોલ-આણંદ-૩૮૮૩૧૫.
અનિલ ચાવડા : સી/૩૦૩, અર્જુન વિલા, આનંદ પાર્ટીખોટ પાસે, ન્યૂ રાણીપાટી, અમદાવાદ-૩૮૨૪૮૦
ઉવીશ વસાવડા : આશીવાદ એક્સ રે ક્લિનિક, ચિત્તાભાના રોડ, સિવિલ હોસ્પિટલ રોડ જૂનાગઢ - ૩૬૨૦૦૧
કૃતીદા શાહ : ૧, એરીસી બેન્ક સોસાયટી, સહજાનંદ કોલેજ પાછળ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫
ધીરેન્દ્ર મહેતા : જીવનછાયા, હોસ્પિટલરોડ, ભૂજ-૩૭૦૦૦૧
પારુલ રંગપરિયા : ૧૪, કેપિટલ પાર્ક સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન, વિજય ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૮
પીયુષ ઠક્કર : ૯૦૩, યોગીસ્થાન ઓપાર્ટમેન્ટ, વહાણવટી માતા મંદિર પાસે, ઓઢવપુરા, વડોદરા-૩૮૦૦૨૩
પ્રકાશ ન શાહ : 'પ્રકાશ', નવરંગપુરા પો. ઓ. પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮
મહેન્દ્રસિંહ પરમાર : ૨૦, ગૌરીશંકર સોસાયટી, જવેલ્સ સર્કલ પાસે, ભાવનગર-૩૬૪૦૦૩
યોગેશ જોખી : બી/૩૦૩, અર્જુનગીન્સ, વિશેશર ફ્લેટ પાસે, ૩. ૩. નગર ૨૦૧ રન્નાપાર્ક, અમદાવાદ-૩૮૦૦૬૧
રમણ સોન્ની : ૧૪, હેમ્ડીપ સોસાયટી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા-૩૮૦૦૧૫
રમણીક સોમેશ્વર : c/o દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેંકરી, ભૂજ-૩૭૦૦૦૧
રવીન્દ્ર પારેખ : ૧, યુનિયન ધારા, મોટી બંગલા, અઠવાલાઈન, સુરત-૩૮૫૦૦૭
વજેસિંહ પારગી : Vajesinh.nisad@gmail.com
વિજય પંડ્યા : ૧૧/એ ન્યૂ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮
વિનોદ જોશી : પ્રયાગ, ૩૨, શેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧
હરીશ મીનાશ્રુ : ૮/એ, સુમિરન સૌરભ બંગલા, વિનુકાકા માર્ગ, બાકરોલ-૩૮૮૩૧૫, જી. આણંદ
હેમંત ધોરડા : ૫, યશવંતનગર, શોપર્સ સ્ટોપ પાસે, એસ. વી. રોડ, અંધરી(પૂર્વ) મુખ્ય-૪૦૦૦૫૮
સંધ્યા ભહુ : 'સ્નેહલ' પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી-૩૮૪૬૦૨
હરિકૃષ્ણ પાટક : પ્લોટ નં. ૬૨/૨, સેક્ટર ૨/એ, ગાંધીનગર-૩૮૨૦૦૭

બાળસાહિત્ય-વિવેચનનાં પુસ્તકો

બાળકાય વિમર્શ	હરિકૃષ્ણ પાઈક	140
બાળસાહિત્ય દપ્પણ	ડૉ. રવીન્દ્ર અંધારિયા	150
બાળવાંચન	નિહારિકા થી. ઉંદાણી	125
બાળકથા સાહિત્ય : એક ઝલક	શ્રદ્ધા ત્રિવેદી	90
બાળસાહિત્ય : સમીક્ષા અને દર્શન	નટવર પટેલ	90
બાળસાહિત્ય મંથન	યશવંત મહેતા	100
ગુજરાતી બાળવાર્તા	ઈંદ્ર પરમાર	80
ગુજ. બાળસાહિત્ય : દર્શન અને દિશા	મોહનભાઈ પટેલ	100
બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન	રતિલાલ સાં. નાયક	80
બકોર પટેલની હસ્તી દુનિયા	હુંદરાજ બલવાણી	25

સાહિત્ય/પત્રકારત્વ વિષયક સંદર્ભસાહિત્ય

પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યયન	ડૉ. ચંદ્રકાન્ત મહેતા	170
સંચાર-સંશોધન માધ્યમ	ડૉ. ચંદ્રકાન્ત મહેતા	200
મીડિયા અને આચારસંહિતા	ડૉ. ચંદ્રકાન્ત મહેતા	100
પ્રકાશન નહિ કાયરનું કામ	દીના એમ. મહોત્ત્રા	175
ગુજરાતનાં પત્રકાર-રન્નો [પ્રતિભાશાળી પત્રકારો]	હિનેશ દેસાઈ	115
ગેટ ગુજરાત, ગ્લોબલ ગુજરાત	હિનેશ દેસાઈ	250
દૈનિકપત્રો : તાસીર અને તસવીર	હિનેશ દેસાઈ	150
ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ પ્રવાહો અને પ્રયોગો	વિનાયક જાદવ	450
સમૂહ પ્રત્યાયન	જ્યોતિર રાવલ	120
કરછી બોલી	મહેન્દ્ર સાકરચંદ દીશી	140
ધીણોધર સંભરન (કચ્છ વિષયક વાર્તાઓ, નિબંધો)	સંપા. વીનેશ અંતાણી	240
સોરઠી બોલી	ગોલરાય માંકડ	100
સમયને સથવારે : ગુજરાત (પુરસ્કૃત)	કુન્દનલાલ ધોળકિયા	300
વિધાનસભાના અંતરંગ	વિનોદ દવે	70
ગુજરાત 2004	દિનકર પંડ્યા	80
કચ્છનું સંસ્કૃતિકાર્થન	રામસિંહજી કા. રાઠોડ	1000



ગૂર્જર ગંધીરલન કાર્યાલય

રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001

ફોન : 079-22144663, 09227044777

email : goorjar@yahoo.com website : www.gurjar.biz

ગૂર્જર સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, સીમા હોલ સામે, પ્રદ્લાદનગર, અમદાવાદ-15 ફોન : 26934340, 98252 68759
email : gurjarpakashan@gmail.com, website : www.gspbooksmall.com

રંગદ્વાર પ્રકાશન

G-15, યુનિવર્સિટી ખાડી, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-380009

ફોન નંબર : 079-27913344, વેબ સાઇટ : <http://www.rangdwar.com>

વાર્તાસંગ્રહ

દૂરથી સાથે	રધુવીર ચૌધરી	120
સાદ ભીતરનો	કંદર્પ દેસાઈ	160
રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ	સં. પારુલ તથા કંદર્પ દેસાઈ	200
વૃદ્ધ રંગાટી બજાર	વિજય સોની	140
રણકૃત્પ	રધુવીર ચૌધરી	120
ગેટ ટુગોધર	સાગર શાહ	120
પડછાયાઓ વચ્ચે	અભિમન્યુ આચાર્ય	120
લુ	વિપુલ બાસ	150
નંદીધર	રધુવીર ચૌધરી	150
વણજોયું મહુરત (અનુ.)	દક્ષા પટેલ	180
આકસ્મિક સ્પર્શ	રધુવીર ચૌધરી	150
રણની વચ્ચે	વીનેશ અંતાણી	100
ગેરસમજ	રધુવીર ચૌધરી	120
રસવૈભવ	નીતિન ત્રિવેદી	200
બહાર કોઈ છે	રધુવીર ચૌધરી	180
દસ પાશ્ચાત્ય નવલિકાઓ	સં. રેમંડ પરમાર	150
અતિથિગૃહ	રધુવીર ચૌધરી	150
વિરહિણી ગણિકા	રધુવીર ચૌધરી	200
રખોપું	જગદીશ પટેલ	80
દેરો	કાનજી પટેલ	100
દશ્ય ફરી ભજવાયું	મુનિકુમાર પંડ્યા	100



રનાદે પ્રકાશન

૫૮/૨, લીજે માળે, દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧

ફોન : ૨૨૧૧૦૦૮૯-૨૨૧૧૦૦૬૪

નિબંધસંગ્રહો

પુસ્તકનું નામ	લેખકનું નામ	કિંમત રૂ.
જનસેવક-જનહિતના સંદેશ	ડૉ. જગદીશ ભાવસાર	૮૫.૦૦
(લેખસંગ્રહ)		
યુવા જોશ (લેખસંગ્રહ)	મહર્ષિ દેસાઈ	૧૩૦.૦૦
વ્યક્તિત્વના બંધન તોડીછોડી	ભૂપેન્દ્ર વ્યાસ 'રજ'	૮૦.૦૦
(લલિત નિબંધસંગ્રહ)		
પારિજ્ઞાત (લેખસંગ્રહ)	રેખા ભટ્ટ	૨૬૦.૦૦
એ મને હંમેશા યાદ રહેશો	માનનીય મુખ્યમંત્રીશ્રી	૧૦૦.૦૦
	આનંદીબેન પટેલ	
કોમનમેનની કથની (લેખો)	હસમુખ પટેલ	૨૪૦.૦૦
સાંધ્ય વેળાઓ (વડીલોની વાતો)	રશિમ શાહ	૧૮૫.૦૦
સમજણનો સેતુ	વિપિન પંડ્યા	૧૩૫.૦૦
(સામાજિક લઘુનિબંધો)		
અનાયાસ (નિબંધસંગ્રહ)	પન્ના અધ્વર્યુ	૫૫.૦૦
અનામ આકાશ (લલિત નિબંધસંગ્રહ)	ડૉ. યશવંત ત્રિવેદી	૧૩૫.૦૦
મલકની માયા (નિબંધસંગ્રહ)	મહિલાલ હ. પટેલ	૮૦.૦૦
આત્માની નદીના કાંઠે (નિબંધસંગ્રહ)	વીનેશ અંતાણી	૭૫.૦૦
આસોમાં ઊઘડતો અષાઢ	યજોશ દવે	૫૫.૦૦
(નિબંધસંગ્રહ)		
તરુરાગ અને નદીસ્ફૂક્ત (નિબંધસંગ્રહ)	જયંત પાઠક	૬૫.૦૦
પવનની વ્યાસપીઠ (લલિતનિબંધ)	અનિલ જોશી	૨૩.૫૦
તરુરાગ (નિબંધસંગ્રહ)	જયન્ત પાઠક	૧૧.૦૦
અંધશ્રદ્ધાના એકસરે	જમનાદાસ કોટેચા	૧૩૫.૦૦
(રેશનાલિસ્ટ લેખો)		

પુસ્તકનું નામ	લેખકનું નામ	કિંમત રૂ.
હૃતશોષ (ડૉ. પ્રભાશંકર તેરૈયાના લેખો) ડૉ. રમેશ મહેતા/ ડૉ. મનોજ જોધી		૧૪૦.૦૦
નાનાવિધ (લેખસંગ્રહ)	ચંદ્રકાન્ત ટોપીવાળા	૧૦૫.૦૦
તાઓ (અનુવાદ)	ડૉ. પ્રદીપ પંડ્યા	૩૩.૦૦
ઈશ્વરનું સનાતન મંદિર (લેખસંગ્રહ)	હરીન્દ્ર દવે	૪૮.૦૦

નવલિકા-વાર્તાસંગ્રહો

ડૉ. ચંદ્રકાન્ત મહેતા

પુસ્તકનું નામ	કિંમત રૂ.
વર્તન-પરિવર્તન	૨૨૦.૦૦
ઘોષ-પ્રતિઘોષ	૨૨૦.૦૦
આલબમની તસવીરો	૨૨૦.૦૦
ત્રણાનુંબંધ	૧૯૫.૦૦
સર્મ્પણના સંગાથી	૧૮૦.૦૦
મન મૂકીને વરસો	૧૮૦.૦૦
સંબંધોનું આકાશ	૧૮૦.૦૦
સંબંધોનું મેઘઘનુષ	૧૮૦.૦૦
જિંદગી રંગબેરંગી	૧૮૦.૦૦

મોહન પરમાર

પુસ્તકનું નામ	કિંમત રૂ.
હણહણાટી	૨૫૦.૦૦
નક્કલંક	૨૬૦.૦૦
અંચળો	૧૫૫.૦૦
કુંભી	૧૩૦.૦૦
કોલાહલ	૫૫.૦૦
પોઠ	૧૦૦.૦૦

નાટ્યમાં તમે પરકાયા પ્રવેશ કરી શકો છો. ભગવાને તો આપણાને એક જ જિંદગી આપી છે પણ નાટ્ય દ્વારા આપણે બીજી જિંદગીઓ અનુભવી શકીએ. નૃત્યમાં આપણે સમગ્ર શરીરથી, કેશથી નખ સુધી પ્રત્યેક અંગથી આપણા આત્માનો ભાવ વ્યક્ત કરીએ છીએ અને કાવ્ય દ્વારા આપણે કશા જ ઉપકરણ વગર આપણા અંતરતમના સૌન્દર્યનું અથવા એના ઉચાટનું અથવા એના સ્વભનું સામી વક્તિની ચેતના સાથે તાદાત્ય કરી શકીએ છીએ.

— નંદિની જોશી

શબ્દનો મૂળ અર્થ અવાજ છે. આ શબ્દ સાર્થક બન્યો. અર્થપૂર્ણ અવાજોની રચના એટલે શબ્દ. સાર્થક શબ્દ જ્ઞાન આપનાર થયો. શબ્દપ્રમાણ એ જ્ઞાનનું સાધન ગણાય છે. જ્યાં જ્ઞાન પ્રત્યક્ષ નથી, અનુમાનથી ગમ્ય નથી ત્યાં જ્ઞાનીના શબ્દો જ્ઞાન આપનારા બની ગયા. ભાષાનું અને એ રીતે શબ્દોનું મૂળ સ્વરૂપ તો ધ્વનિમય હતું અને આજે પણ છે. લાખો વર્ષ સુધી જ્ઞાન અને વિદ્યાનું સાધન બોલાતી ભાષા રહી. સંસ્કૃત ‘ભાષ’ ધાતુનો અર્થ પણ બોલવું જ થાય છે. જ્યારે લિપિ શોધાઈ ત્યારે મૌખિક જ્ઞાનને ગ્રંથસ્થ કરવામાં આવ્યું.

— અરવિંદ ભંડારી

કવિઓના આપણે ઋણી એટલા માટે છીએ કે આપણાને આ ચાલુ એક બંધિયાર ઓરડાઓમાં પુરાયેલાઓને એ નવી આંખ આપી મુક્તિનો અનુભવ કરાવે છે. આ બંધિયાર ઓરડો એટલે આ દશ દ્વારનું નગર. કાયાનગર. કવિ આંગળી ચીવિ છે તે જોઈ એટલા આનંદિત થઈ જઈએ. છીએ કે આપણા ઓરડાની કેદ ભૂલી જઈએ.

— મનુભાઈ પંચોળી ‘દર્શક’

: સ્થાનસમર્પિત :

ડૉ. અરુણ જે. કક્કડ

એસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ, દેવમણિ કોલેજ, વિસાવદર

વિહાર

બારી-બારણાં-ભીતાં-વંડી વિનાના, પ્રકાશના ખુલ્લા ચંદરવા નીચે ચાલવાનું મળે એ વિહાર છે. દિગ્-દિગાંત સુધી વિસ્તરેલી આ અસીમ વસુધા પર ચાલવાનું હોય છે. આ વિહારમાં ચારે બાજુથી વહી આવતા શુભ વિચારોને જીલવાની તક સાંપડે છે. તે જીલાય પણ છે. પશુ ચરે છે, પક્ષી વિચરે છે અને માણસ વિચારે છે. કુદરતના સાંનિધ્યમાં વિચરતાં વિચારવાનું પૂર્ણપણે સાંપડે છે. ત્યારે વેદની પ્રાર્થનાનો મર્મ ઉઘડતો લાગે છે.

વિહાર એ ચેતોવિસ્તાર સાધવાની પ્રક્રિયાનો ભાગ છે. અન્નમય કોશ, પ્રાણમય કોશને ઓળંગાને મનોમય કોશ - વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશનાં ઉન્નત શૃંગો તરફ દોરી જતી કેરી છે; ચેતનાના ઉધ્વરોહણના સોપાનની શ્રેષ્ઠી છે.

આવો વિહાર જે માણો તે જ જાણો.

(પાઠશાળા)

- પ્રધુભનસૂરિ

સ્થાનસમર્પિત

વસ્તાત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર

અમદાવાદ

વિહારમાં

ઉજળા તડકાથી શોભતી શિયાળાની બપોર હતી.
સહેજ પણ ધુમાડાની સેર ન હોવાથી આકાશ સ્વચ્છ, નિરભ્ર
અને આસમાની હતું. ખેતરો પણ વધુ સોહામણાં લાગી
રહ્યાં હતાં. અમારી કેરી ખેતર વચ્ચેથી જતી હતી. ક્યારેક,
બે ખેતર વચ્ચેની વાડમાંથી જવાનું આવતું. રાઈડાના છોડ
પર આવેલાં સોનેરી-પીળાં ફૂલોનું જાણે તળાવ. વળી, એને
ચમકાવતો કુમળો તડકો ચારેકોર પથરાયો હતો. તેમાંયે ઠંડો
શિયાળું વાયરો હીંચકાનું કામ કરતો હતો. લયબદ્ધ હિલોળા
લેતાં એ ખેતરોને આંખો ભરીને જોયાં અને મન ભરીને
માઝ્યાં. પગ એ જ લયમાં ગતિ કરતા હતા. મન તૃપ્ત થતું
હતું, તાજું થતું હતું. જાણે અમે આગળ વહેતા હતા !

(પાઠશાળા)

— પ્રધુભસૂરિ

સ્થાનસમર્પિત

નિમેષભાઈ ડગલી

અમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

ઊ/અ. અલકાપુરી સોસાયટી, ઉર્માનપુરા ચાર રસ્તા પાસે,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧૩. ફોન : ૩૨૬૦૬૬૫૫

આજ અને આવતીકાલ માટે સર્વથા પ્રસ્તુત મહાત્મા ગાંધીના જીવન,

કાર્ય અને દર્શનનું અનુશીલન - પરિશીલન

તેમજ અવગાહન કરતું માસિક પત્ર

‘અકાલ પુરુષ’

પ્રબુદ્ધ ચિંતકો, અભ્યાસીઓ, અનુભવીઓ,

કર્મશીલોની કલમે ગાંધી વિમર્શ.

નમૂનાની નકલ મેળવવા માટે લવાજમ માટે :

સુશીલ ટ્રસ્ટ, કતીરા - ૩૧, તોરલગોડન પછી, મુન્દ્રા રિલોકેશન, ભુજ
(કચ્છ) ૩૭૦૦૦૧

લવાજમ - વાર્ષિક રૂ. ૨૦૦ પંચવાર્ષિક રૂ. ૧૦૦૦

લવાજમની રકમ ટ્રસ્ટના ખાતામાં સીધી જમા કરાવી શકો
અથવા સુશીલ ટ્રસ્ટ (Sushil Trust)ના નામે ચેક મોકલી શકો.
ખાતા નં. 9048100000060, બેન્ક ઓફ બરોડા, નીલપર
(Bank of Baroda, Nilpar), IFSC no. BARBODBNIL,
PAN no. AAATS99922R. રકમ સીધી જમા કરાવ્યાની જાણ
કરવી અને તેની સ્લીપ મોકલવી. કુરિયર, રજિસ્ટર્ડ ટપાલ વગેરે
ઉપરના ભુજના સરનામે મોકલવાં ‘અકાલ પુરુષ’ સંબંધી પૃથ્ઘા
02832 - 230143 પર કરવી. વોટ્સએપ નં. -
9408723930 (બેન્ક રસીદ કે બેન્ક વિગત મોકલવા માટે)
Email ID - shashwatgandhi1869@gmail.com

કવિ શ્રી સુન્દરમ્ભના નવા કાવ્યસંગ્રહો

૧.	પલ્લવિતા	૧૮૮૫	૮+૩૪૬	રૂ. ૧૬૦
૨.	મહાનદ	૧૮૮૫	૭+૧૯૩	રૂ. ૮૦
૩.	પ્રભુ-પદ	૧૮૮૭	૧૩+૪૪૧	રૂ. ૨૨૫
૪.	અગમ નિગમા	૧૮૮૭	૧૧+૨૯૨	રૂ. ૧૫૦
૫.	પ્રિયાંકા	૧૮૮૭	૧૧+૩૬૭	રૂ. ૧૫૦
૬.	નિત્યશ્લોક	૧૮૮૭	૧૨+૧૮૮	રૂ. ૧૦૦
૭.	નયા પૈસા	૧૮૮૮	૧૩+૩૩૩	રૂ. ૧૭૫
૮.	વરદા	૧૮૮૮	૧૮+૫૨૮	રૂ. ૨૫૦
૯.	ચક્કદૂત	૧૮૮૮	૮+૨૫૮	રૂ. ૧૨૫
૧૦.	લોકલીલા	૨૦૦૦	૧૩+૨૫૨	રૂ. ૧૦૦
૧૧.	દક્ષિણા-૧	૨૦૦૨	૧૭+૩૨૩	રૂ. ૫૦
૧૨.	મનની મર્મર	૨૦૦૩	૧૦+૩૮૭	રૂ. ૫૦
૧૩.	ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨+૩૪૫	રૂ. ૫૦
૧૪.	ધ્રુવચિત	૨૦૦૪	૧૭+૨૭૪	રૂ. ૫૦
૧૫.	ધ્રુવપદે	૨૦૦૪	૧૧+૨૫૩	રૂ. ૫૦
૧૬.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૫	૧૬+૩૨૦	રૂ. ૨૦૦
૧૭.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૫	૧૬+૩૭૦	રૂ. ૨૦૦
૧૮.	શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨+૩૧૭	રૂ. ૨૫૦
૧૯.	મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮+૨૩૮	રૂ. ૧૫૦
૨૦.	તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮+૩૦૪	રૂ. ૨૫૦
૨૧.	સ્વાગતમૂળ ગીતવાહીને	૨૦૦૮	૧૬+૨૦૭	રૂ. ૧૫૦
૨૨.	‘સાવિત્રી’ના કાવ્યખંડો	૧૮૮૫	૨૪+૪૭૩	રૂ. ૩૦૦
	(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી. મૂળ અંગ્રેજ સાથે)			
૨૩.	દક્ષિણા-૨	૨૦૦૨	૧૮+૬૭૬	રૂ. ૫૦
	(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી. મૂળ અંગ્રેજ સાથે)			

આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

- ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાદ્ધળ,
આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧

ગુજરાતી સાહિત્ય પરિષદનાં મહિનાં પ્રકાશનો




ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૫
(૧૮૮૫-૧૯૩૫) ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કવિઓ
સંપાદક : રમેશ ર. દવે
સંપાદન સહાય : પારુલ દેસાઈ
પાકું પૂર્ણ, પૃ. ૧૪+૪૮૪, કિંમત રૂ. ૪૨૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૬
(દી. ૧૮૮૫-૧૯૩૫)
ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગાંધીસર્જકી
સંપાદક : રમેશ ર. દવે
પાકું પૂર્ણ, પૃ. ૧૮+૭૩૪, કિંમત ૪૨૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૭
(દી. ૧૯૧૦-૧૯૩૫) સ્વાતંત્ર્યોત્તર યુગ-૧
સંપાદક : રમેશ ર. દવે, પારુલ કંદ્ર્પ દેસાઈ
પાકું પૂર્ણ, પૃ. ૬૩૨, કિંમત રૂ. ૪૧૫/-



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૮/ખંડ-૧
(દી. ૧૯૩૬થી ૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ-૨

સં. પારુલ કંદ્ર્પ દેસાઈ પાકું પૂર્ણ, પૃ. ૪૫૬, કિ. રૂ. ૫૬૦/-

‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથશૈક્ષણિકા આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાના કવિઓ, નાટ્યકારો, નિબંધકારો અને બાળસાહિત્યકારોનાં સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડણે.



ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ-૮/ખંડ-૨
(દી. ૧૯૩૬થી ૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ-૨
સં. પારુલ કંદ્ર્પ દેસાઈ પાકું પૂર્ણ, ૪૮૬, કિ. રૂ. ૬૨૦/-
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથશૈક્ષણિકા આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાના નવલકૃતાકારો, વાતાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો અને સંપાદકોના સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડણે.

PARAB 2021 April

RNI No. GUJGUJ/2006/17273

Regd. under Postal Registration No.

GAMC-306/2021-2023 valid upto 31-12-2023

Posted at Ahd. PSO on 10th of every month SSP Ah'd

ISSN : 0250-9747

